

સેટમાં સામેલ અધિસૂચનાઓની વિગતો દર્શાવતું પત્રક

No.	Notification	Date
1.	(GHN-31)GSTR-2020/S.164(54)TH	27-03-2020
2.	(GHN-110)GST-2020/S.148(36)TH	21-11-2020
3.	(GHN-111)GSTR-2020/S.164(66)TH	21-11-2020
4.	(GHN-116) GST-2020/S.168A(9)TH	18-12-2020
5.	(GHN-1) GST-2021/S.164(68)TH	01-01-2021
6.	(GHN-9) GST-2021/S.25 (6D) (2) TH	02-03-2021
7.	(GHN-13) GST-2021/R.48(4)(6)TH	18-03-2021
8.	(GHN-21) GST-2021/S.164(69)TH	11-05-2021
9.	(GHN-22) GST-2021/S.128(28)TH	17-05-2021
10.	(GHN-23) GST-2021/S.50(1)(2)TH	17-05-2021
11.	(GHN-24) GST-2021/S.164(70)TH	17-05-2021
12.	(GHN-25) GST-2021/S.148(37)TH	17-05-2021
13.	(GHN-26) GST-2021/S.168A(10)TH	17-05-2021
14.	(GHN-27) GST-2021/S.164(71)TH	02-06-2021
15.	(GHN-27A) GST-2021/S.9(1) (34)TH	02-06-2021
16.	(GHN-32) GST-2021/S.168A (11)TH	09-06-2021
17.	(GHN-35) GST-2021/S.128 (30)TH	09-06-2021
18.	(GHN-36) GST-2021/S.128 (31)TH	09-06-2021
19.	(GHN-38) GST-2021/S.96(3)TH	09-06-2021
20.	(GHN-41) GST-2021/S.11(1) (54) TH	14-06-2021
21.	(GHN-42) GST-2021/S.11(1) (55) TH	23-06-2021
22.	(GHN-45)GST-2021/S.1(14)TH	02-07-2021
23.	(GHN-48) GST-2021/S.128(33)TH	09-07-2021
24.	(GHN-56) GST-2021/S.57(1)TH	11-08-2021
25.	(GHN-57)GST-2021/R.97(4) (1)TH	11-08-2021



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

VOL. LXI]

WEDNESDAY, MAY 6, 2020 / VAISAKHA 16, 1942

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 27th March, 2020.

Notification No.14/2020-State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-21)GST-2020/R.46(2)TH:-In exercise of the powers conferred by the sixth proviso to rule 46 of the Gujarat Goods and Services Tax Rules, 2017 (hereinafter referred to as the said rules), the Government, on the recommendations of the Council, and in supersession of the notification of the Government of Gujarat, Finance Department No.(GHN-122)GST-2019/S.146(4)TH dated the 17th December, 2019, Notification No. 72/2019 - State Tax, except as respects things done or omitted to be done before such supersession, hereby notifies that an invoice issued by a registered person, whose aggregate turnover in a financial year exceeds five hundred crore rupees, other than those referred to in sub-rules (2), (3), (4) and (4A) of rule 54 of said rules, and registered person referred to in section 14 of the Integrated Goods and Services Tax Act, 2017, to an unregistered person (hereinafter referred to as B2C invoice), shall have Dynamic Quick Response (QR) code:

Provided that where such registered person makes a Dynamic Quick Response (QR) code available to the recipient through a digital display, such B2C invoice issued by such registered person containing cross-reference of the payment using a Dynamic Quick Response (QR) code, shall be deemed to be having Quick Response (QR) code.

2. This notification shall come into force from the 1st day of October, 2020.

By order and in the name of the Governor of Gujarat,

K. R. RATHAVA,
Under Secretary to Government.

**FINANCE DEPARTMENT
NOTIFICATION**

Sachivalaya, Gandhinagar, 27th March, 2020.

Notification No.13/2020-State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-22)GST-2020/R.48(4)(2)TH:- In exercise of the powers conferred by sub-rule (4) of rule 48 of the Gujarat Goods and Services Tax Rules, 2017 (hereinafter referred as said rules), the Government on the recommendations of the Council, and in supersession of the Notification of the Government of Gujarat, Finance Department No. (GHN-119)GST-2019/R.48(4)(1)TH dated the 17th December, 2019, Notification No. 70/2019 - State Tax, except as respects things done or omitted to be done before such supersession, hereby notifies registered person, other than those referred to in sub-rules (2), (3), (4) and (4A) of rule 54 of the said rules, whose aggregate turnover in a financial year exceeds one hundred crore rupees, as a class of registered person who shall prepare invoice and other prescribed documents, in terms of sub-rule (4) of rule 48 of the said rules in respect of supply of goods or services or both to a registered person.

2. This notification shall come into force from the 1st day of October, 2020.

By order and in the name of the Governor of Gujarat,

K. R. RATHAVA,
Under Secretary to Government.

**FINANCE DEPARTMENT
NOTIFICATION**

Sachivalaya, Gandhinagar, 27th March, 2020.

Notification No.11/2020-State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-23)GST-2020/S.148(26)TH:- In exercise of the powers conferred by section 148 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017) (hereinafter referred to as the said Act), the Government, on the recommendations of the Council, hereby notifies those registered persons (hereinafter referred to as the erstwhile registered person), who are corporate debtors under the provisions of the Insolvency and Bankruptcy Code, 2016 (31 of 2016), undergoing the corporate insolvency resolution process and the management of whose affairs are being undertaken by interim resolution professionals (IRP) or resolution professionals (RP), as the class of persons who shall follow the following special procedure, from the date of the appointment of the IRP/RP till the period they undergo the corporate insolvency resolution process, as mentioned below.

2. **Registration.-** The said class of persons shall, with effect from the date of appointment of IRP / RP, be treated as a distinct person of the corporate debtor, and shall be liable to take a new registration (hereinafter referred to as the new registration) **in the State, if the corporate debtor was registered in the State earlier,** within thirty days of the appointment of the IRP/RP:

Provided that in cases where the IRP/RP has been appointed prior to the date of this notification, he shall take registration within thirty days from the commencement of this notification, with effect from date of his appointment as IRP/RP.

3. **Return.-** The said class of persons shall, after obtaining registration file the first return under section 40 of the said Act, from the date on which he becomes liable to registration till the date on which registration has been granted.

4. **Input tax credit.**-(1)The said class of persons shall, in his first return, be eligible to avail input tax credit on invoices covering the supplies of goods or services or both, received since his appointment as IRP/RP but bearing the GSTIN of the erstwhile registered person, subject to the conditions of Chapter V of the said Act and the rules made thereunder, except the provisions of sub-section (4) of section 16 of the said Act and sub-rule (4) of rule 36 of the Gujarat Goods and Service Tax Rules, 2017 (hereinafter referred to as the said rules).

(2) Registered persons who are receiving supplies from the said class of persons shall, for the period from the date of appointment of IRP / RP till the date of registration as required in this notification or thirty days from the date of this notification, whichever is earlier, be eligible to avail input tax credit on invoices issued using the GSTIN of the erstwhile registered person, subject to the conditions of Chapter V of the said Act and the rules made thereunder, except the provisions of sub-rule (4) of rule 36 of the said rules.

5. Any amount deposited in the cash ledger by the IRP/RP, in the existing registration, from the date of appointment of IRP/RP to the date of registration in terms of this notification shall be available for refund to the erstwhile registration.

Explanation.- For the purposes of this notification, the terms "corporate debtor", "corporate insolvency resolution professional", "interim resolution professional" and "resolution professional" shall have the same meaning as assigned to them in the Insolvency and Bankruptcy Code, 2016 (31 of 2016).

6. This notification shall be deemed to have come into force with effect from the 21st day of March, 2020.

By order and in the name of the Governor of Gujarat,

K. R. RATHAVA,
Under Secretary to Government.

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 27th March, 2020.

Notification No.12/2020-State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-24)GST-2020/S.148(27)TH:- In exercise of the powers conferred by section 148 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), the State Government, on the recommendations of the Council, hereby makes the following amendment in the Notification of Government of Gujarat, Finance Department, No. (GHN-43)GST-2019/S.148(15)TH dated the 24th April, 2019, Notification No.21/2019- State Tax, namely:-

In the said notification, in paragraph 2, the following proviso shall be inserted, namely: -

"Provided that the said persons who have, instead of furnishing the statement containing the details of payment of self-assessed tax in **FORM GST CMP-08** have furnished a return in **FORM GSTR-3B** under the Gujarat Goods and Services Tax Rules, 2017 (hereinafter referred to as the said rules) for the tax periods in the financial year 2019-20, such taxpayers shall not be required to furnish the statement in outward supply of goods or services or both in **FORM GSTR-1** of the said rules or the statement containing the details of payment of self-assessed tax in **FORM GST CMP-08** for all the tax periods in the financial year 2019-20."

2. This notification shall be deemed to have come into force with effect from the 21st day of March, 2020.

By order and in the name of the Governor of Gujarat,

K. R. RATHAVA,
Under Secretary to Government.

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 27th March, 2020.

Notification No.27/2020-State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-25)GST-2020/S.148(28)TH:- In exercise of the powers conferred by section 148 of the Gujarat Goods and Services Tax Act, 2017 (12 of 2017) (hereafter in this notification referred to as the said Act), the Gujarat Government, on the recommendations of the Council, hereby notifies the registered persons having aggregate turnover of up to 1.5 crore rupees in the preceding financial year or the current financial year, as the class of registered persons who shall follow the special procedure as mentioned below for furnishing the details of outward supply of goods or services or both.

2. The said registered persons shall furnish the details of outward supply of goods or services or both in **FORM GSTR-1** under the Gujarat Goods and Services Tax Rules, 2017, effected during the quarter as specified in column (2) of the Table below till the time period as specified in the corresponding entry in column (3) of the said Table, namely:-

Table

Sl. No.	Quarter for which details in FORM GSTR-1 are furnished	Time period for furnishing details in FORM GSTR-1
(1)	(2)	(3)
1	April, 2020 to June, 2020	31 st July, 2020
2	July, 2020 to September, 2020	31 st October, 2020

3. The time limit for furnishing the details or return, as the case may be, under sub-section (2) of section 38 of the said Act, for the months of April, 2020 to September, 2020 shall be subsequently notified in the *Official Gazette*.

By order and in the name of the Governor of Gujarat,

K. R. RATHAVA,
Under Secretary to Government.

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 27th March, 2020.

Notification No.17/2020-State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-26)GST-2020/S.25(6D)(1)TH:- In exercise of the powers conferred by sub-section (6D) of section 25 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), the State

Government, on the recommendations of the Council, hereby notifies that the provisions of sub-section (6B) or sub-section (6C) of the said Act shall not apply to a person who is not a citizen of India or to a class of persons other than the following class of persons, namely:-

- (a) Individual;
- (b) authorised signatory of all types;
- (c) Managing and Authorised partner; and
- (d) Karta of an Hindu undivided family.

2. This notification shall come into effect from the 1st day of April, 2020.

By order and in the name of the Governor of Gujarat,

K. R. RATHAVA,
Under Secretary to Government.

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 27th March, 2020.

Notification No.18/2020-State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-27)GST-2020/S.25(6B)(1)TH:- In exercise of the powers conferred by sub-section (6B) of section 25 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), the State Government, on the recommendations of the Council, hereby notifies the date of coming into force of this notification as the date, from which an individual shall undergo authentication, of Aadhaar number, as specified in rule 8 of the Gujarat Goods and Services Tax Rules, 2017 (hereinafter referred to as the said rules), in order to be eligible for registration:

Provided that if Aadhaar number is not assigned to the said individual, he shall be offered alternate and viable means of identification in the manner specified in rule 9 of the said rules.

2. This notification shall come into effect from the 1st day of April, 2020.

By order and in the name of the Governor of Gujarat,

K. R. RATHAVA,
Under Secretary to Government.

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 27th March, 2020.

Notification No.19/2020-State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-28)GST-2020/S.25(6C)(1)TH:- In exercise of the powers conferred by sub-section (6C) of section 25 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), the State Government, on the recommendations of the Council, hereby notifies the date of coming into force of this notification as the date, from which the-

- (a) authorised signatory of all types;
- (b) Managing and Authorised partners of a partnership firm; and
- (c) Karta of an Hindu undivided family,

shall undergo authentication of possession of Aadhaar number, as specified in rule 8 of the Gujarat Goods and Services Tax Rules, 2017 (hereinafter referred to as the said rules), in order to be eligible for registration under GST:

Provided that if Aadhaar number is not assigned to the said persons, they shall be offered alternate and viable means of identification in the manner specified in rule 9 of the said rules.

2. This notification shall come into effect from the 1st day of April, 2020.

By order and in the name of the Governor of Gujarat,

K. R. RATHAVA,
Under Secretary to Government.

FINANCE DEPARTMENT
NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 27th March, 2020.

Notification No.02/2020-State Tax (Rate)

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-29)GST-2020/S.9(1)(32)TH:- In exercise of the powers conferred by sub-section (1), sub-section (3) and sub-section (4) of section 9, sub-section (1) of section 11, sub-section (5) of section 15 and section 148 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj. 25 of 2017), the Gujarat Government, on being satisfied that it is necessary in the public interest so to do, on the recommendations of the Council, hereby makes the following further amendments in the notification of the Government of Gujarat, Finance Department No. (GHN-32) GST-2017/S.9(1)(2)-TH dated 30th June, 2017, Notification No. 11/2017-State Tax (Rate) namely:-

In the said notification, in the Table, against serial number 25,

(a) after item (i) and entries relating thereto, in columns (3), (4) and (5), the following items and entries shall be inserted, namely, -

(3)	(4)	(5)
"(ia) Maintenance, repair or overhaul services in respect of aircrafts, aircraft engines and other aircraft components or parts.	2.5	-

(b) in item (ii), in column (3), after the brackets and figures "(i)", the word, brackets, and figures "and (ia)" shall be inserted.

2. This notification shall come into force with effect from the 1st day of April, 2020.

By order and in the name of the Governor of Gujarat,

K. R. RATHAVA,
Under Secretary to Government.

FINANCE DEPARTMENT**NOTIFICATION**Sachivalaya, Gandhinagar, 27th March, 2020.**Notification No.03/2020-State Tax (Rate)****GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.**

No.(GHN-30)GST-2020/S.9(1)(33)TH:- In exercise of the powers conferred by sub-section (1) of section 9 and sub-section (5) of section 15 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj. 25 of 2017), the Gujarat Government, on the recommendations of the Council, hereby makes the following further amendments in the notification of the Government of Gujarat, Finance Department No. (GHN-31) GST-2017/S.9(1) (I)-TH dated 30th June, 2017, Notification No. 1/2017-State Tax (Rate) namely:-

In the said notification, -

(a) in Schedule I - 2.5%, serial number 187 and the entries relating thereto shall be omitted;

(b) in Schedule II - 6%,-

(i) after serial number 75 and the entries relating thereto, the following serial number and entries shall be inserted, namely :-

"75A.	3605 00 10	All goods";
-------	------------	-------------

(ii) serial numbers 202 and 203 and the entries relating thereto shall be omitted;

(c) in Schedule III - 9%,-

(i) serial number 73 and the entries relating thereto shall be omitted;

(ii) in serial number 379, for the entry in column (3), the entry "All goods" shall be substituted;

2. This notification shall come into force on the 1st day of April, 2020.

By order and in the name of the Governor of Gujarat,

K. R. RATHAVA,

Under Secretary to Government.

FINANCE DEPARTMENT**NOTIFICATION**Sachivalaya, Gandhinagar, 27th March, 2020.**Notification No.16/2020-State Tax****GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.**

No.(GHN-31)GSTR-2020/S.164(54)TH:- In exercise of the powers conferred by section 164 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), the State Government hereby makes the following rules further to amend the Gujarat Goods and Services Tax Rules, 2017, namely :-

1. (1) These rules may be called the Gujarat Goods and Services Tax (Third Amendment) Rules, 2020.

(2) Save as otherwise provided in these rules, they shall come into force with effect from the 23rd day of March, 2020.

2. In the Gujarat Goods and Services Tax Rules, 2017 (hereinafter referred to as the said rules), in rule 8, after sub-rule (4), the following sub-rule shall be inserted, namely:-

"(4A) The applicant shall, while submitting an application under sub-rule (4), with effect from 01.04.2020, undergo authentication of Aadhaar number for grant of registration."

3. In the said rules, in rule 9, in sub-rule (1), with effect from 01.04.2020, the following proviso shall be inserted, namely:-

"Provided that where a person, other than those notified under sub-section (6D) of section 25, fails to undergo authentication of Aadhaar number as specified in sub-rule (4A) of rule 8, then the registration shall be granted only after physical verification of the principle place of business in the presence of the said person, not later than sixty days from the date of application, in the manner provided under rule 25 and the provisions of sub-rule (5) shall not be applicable in such cases."

4. In the said rules, for rule 25, the following rule shall be substituted, namely:-

"Physical verification of business premises in certain cases.-Where the proper officer is satisfied that the physical verification of the place of business of a person is required due to failure of Aadhaar authentication before the grant of registration, or due to any other reason after the grant of registration, he may get such verification of the place of business, in the presence of the said person, done and the verification report along with the other documents, including photographs, shall be uploaded in **FORM GST REG-30** on the common portal within a period of fifteen working days following the date of such verification."

5. In the said rules, in rule 43, in sub-rule (1) with effect from the 1st April, 2020,-

(a) for clause (c), the following clause shall be substituted, namely:-

"(c) the amount of input tax in respect of capital goods not covered under clauses (a) and (b), denoted as 'A', being the amount of tax as reflected on the invoice, shall credit directly to the electronic credit ledger and the validity of the useful life of such goods shall extend upto five years from the date of the invoice for such goods:

Provided that where any capital goods earlier covered under clause (a) is subsequently covered under this clause, input tax in respect of such capital goods denoted as 'A' shall be credited to the electronic credit ledger subject to the condition that the ineligible credit attributable to the period during which such capital goods were covered by clause (a), denoted as 'Tie', shall be calculated at the rate of five percentage points for every quarter or part thereof and added to the output tax liability of the tax period in which such credit is claimed:

Provided further that the amount 'Tie' shall be computed separately for input tax credit of central tax, State tax, Union territory tax and integrated tax and declared in **FORM GSTR-3B**.

Explanation.- An item of capital goods declared under clause (a) on its receipt shall not attract the provisions of sub-section (4) of section 18, if it is subsequently covered under this clause."

(b) for clause (d), the following clause shall be substituted, namely:-

"the aggregate of the amounts of 'A' credited to the electronic credit ledger under clause (c) in respect of common capital goods whose useful life remains during the tax period, to be denoted as 'Tc', shall be the common credit in respect of such capital goods:

Provided that where any capital goods earlier covered under clause (b) are subsequently covered under clause (c), the input tax credit claimed in respect of such capital good(s) shall be added to arrive at the aggregate value 'Tc';";

(c) in clause (e), the following Explanation shall be inserted, namely:-

"Explanation.- For the removal of doubt, it is clarified that useful life of any capital goods shall be considered as five years from the date of invoice and the said formula shall be applicable during the useful life of the said capital goods.";

(d) clause (f) shall be omitted.

6. In the said rules, in rule 80, in sub-clause (3), the following proviso shall be inserted, namely:-

"Provided that every registered person whose aggregate turnover during the financial year 2018-2019 exceeds five crore rupees shall get his accounts audited as specified under sub-section (5) of section 35 and he shall furnish a copy of audited annual accounts and a reconciliation statement, duly certified, in **FORM GSTR-9C** for the financial year 2018-2019, electronically through the common portal either directly or through a Facilitation Centre notified by the Commissioner."

7. In the said rules, in rule 86, after sub-rule (4), the following sub-rule shall be inserted, namely:-

"(4A) Where a registered person has claimed refund of any amount paid as tax wrongly paid or paid in excess for which debit has been made from the electronic credit ledger, the said amount, if found admissible, shall be re-credited to the electronic credit ledger by the proper officer by an order made in **FORM GST PMT-03**".

8. In the said rules, in rule 89, in sub-rule (4), for clause (C), the following clause shall be substituted, namely:-

"(C) "Turnover of zero-rated supply of goods" means the value of zero-rated supply of goods made during the relevant period without payment of tax under bond or letter of undertaking or the value which is 1.5 times the value of like goods domestically supplied by the same or, similarly placed, supplier, as declared by the supplier, whichever is less, other than the turnover of supplies in respect of which refund is claimed under sub-rules (4A) or (4B) or both;"

9. In the said rules, in rule 92,-

(a) after sub-rule (1), the following sub-rule shall be inserted, namely:-

"(1A) Where, upon examination of the application of refund of any amount paid as tax other than the refund of tax paid on zero-rated supplies or deemed export, the proper officer is satisfied that a refund under sub-section (5) of section 54 of the Act is due and payable to the applicant, he shall make an order in **FORM RFD-06** sanctioning the amount of refund to be paid, in cash, proportionate to the amount debited in cash against the total amount paid for discharging tax liability for the relevant period, mentioning therein the amount adjusted against any outstanding demand under the Act or under any existing law and the balance amount refundable and for the remaining amount which has been debited from the electronic credit ledger for making payment of such tax, the proper officer shall issue **FORM GST PMT-03** re-crediting the said amount as Input Tax Credit in electronic credit ledger.";

(b) in sub-rule (4), after the words, brackets and figure "amount refundable under sub-rule (1)", the words, brackets, figure and letter "or sub-rule (1A)", shall be inserted;

(c) in sub-rule (5), after the words, brackets and figure "amount refundable under sub-rule (1)", the words, figures and letter "or sub-rule (1A)", shall be inserted.

10. In the said rules, in rule 96, in sub-rule (10), in clause (b) with effect from the 23rd October, 2017, the following Explanation shall be inserted, namely,-

"Explanation.- For the purpose of this sub-rule, the benefit of the notifications mentioned therein shall not be considered to have been availed only where the registered person has paid Integrated Goods and Services Tax and Compensation Cess on inputs and has availed exemption of only Basic Customs Duty (BCD) under the said notifications."

11. In the said rules, after rule 96A, the following rule shall be inserted, namely:-

"96B. Recovery of refund of unutilised input tax credit or integrated tax paid on export of goods where export proceeds not realised. -(1) Where any refund of unutilised input tax credit on account of export of goods or of integrated tax paid on export of goods has been paid to an applicant but the sale proceeds in respect of such export goods have not been realised, in full or in part, in India within the period allowed under the Foreign Exchange Management Act, 1999 (42 of 1999), including any extension of such period, the person to whom the refund has been made shall deposit the amount so refunded, to the extent of non- realisation of sale proceeds, along with applicable interest within thirty days of the expiry of the said period or, as the case may be, the extended period, failing which the amount refunded shall be recovered in accordance with the provisions of section 73 or 74 of the Act, as the case may be, as is applicable for recovery of erroneous refund, along with interest under section 50:

Provided that where sale proceeds, or any part thereof, in respect of such export goods are not realised by the applicant within the period allowed under the Foreign Exchange Management Act, 1999 (42 of 1999), but the Reserve Bank of India writes off the requirement of realisation of sale proceeds on merits, the refund paid to the applicant shall not be recovered.

(2) Where the sale proceeds are realised by the applicant, in full or part, after the amount of refund has been recovered from him under sub-rule (1) and the applicant produces evidence about such realisation within a period of three months from the date of realisation of sale proceeds, the amount so recovered shall be refunded by the proper officer, to the applicant to the extent of realisation of sale proceeds, provided the sale proceeds have been realised within such extended period as permitted by the Reserve Bank of India."

12. In the said rules, in rule 141, in sub-rule (2), for the word "Commissioner", the words "proper officer" shall be substituted.

13. In the said rules, in **FORM GST RFD-01**, after the declaration under rule 89 (2) (g), the following undertaking shall be inserted, namely:-

"UNDERTAKING

I hereby undertake to deposit to the Government the amount of refund sanctioned along with interest in case of non-receipt of foreign exchange remittances as per the proviso to section 16 of the IGST Act, 2017 read with rule 96B of the GGST Rules 2017.

Signature-

Name-

Designation / Status"

By order and in the name of the Governor of Gujarat,

K. R. RATHAVA,
Under Secretary to Government.



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXI | SATURDAY, NOVEMBER 21, 2020/ KARTIKA 30, 1942

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 21st November, 2020.

NOTIFICATION NO. 85/2020-STATE TAX

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-110)GST-2020/S.148(36)TH:- In exercise of the powers conferred by section 148 read with sub-section (7) of section 39 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), (hereinafter referred to as the said Act), the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby notifies the registered persons, notified under proviso to sub-section (1) of section 39 of the said Act, who have opted to furnish a return for every quarter or part thereof, as the class of persons who may, in first month or second month or both months of the quarter, follow the special procedure such that the said persons may pay the tax due under proviso to sub-section (7) of section 39 of the said Act, by way of making a deposit of an amount in the electronic cash ledger equivalent to, -

- (i) thirty five per cent. of the tax liability paid by debiting the electronic cash ledger in the return for the preceding quarter where the return is furnished quarterly; or
- (ii) the tax liability paid by debiting the electronic cash ledger in the return for the last month of the immediately preceding quarter where the return is furnished monthly:

Provided that no such amount may be required to be deposited-

- (a) for the first month of the quarter, where the balance in the electronic cash ledger or electronic credit ledger is adequate for the tax liability for the said month or where there is nil tax liability:
- (b) for the second month of the quarter, where the balance in the electronic cash ledger or electronic credit ledger is adequate for the cumulative tax liability for the first and the second month of the quarter or where there is nil tax liability:

Provided further that registered person shall not be eligible for the said special procedure unless he has furnished the return for a complete tax period preceding such month.

Explanation- For the purpose of this notification, the expression "a complete tax period" means a tax period in which the person is registered from the first day of the tax period till the last day of the tax period.

2. This notification shall come into force with effect from the 1st day of January, 2021.

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXI | SATURDAY, NOVEMBER 21, 2020 / KARTIKA 30, 1942

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts.

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 21st November, 2020

Notification No. 82/2020-State Tax

Gujarat Goods and Services Tax Act, 2017.

No.(GHN-111)GSTR-2020/S.164(66)TH:— In exercise of the powers conferred by section 164 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby makes the following rules further to amend the Gujarat Goods and Services Tax Rules, 2017, namely: -

1. Short title and commencement:

(1) These rules may be called the Gujarat Goods and Services Tax (Thirteenth Amendment) Rules, 2020.

(2) Save as otherwise provided in these rules, they shall be deemed to have come into force with effect from the 10th day of November, 2020.

2. In the Gujarat Goods and Services Tax Rules, 2017 (hereafter in this notification referred to as the said rules), for rule 59, the following rule shall be substituted with effect from the 1st day of January, 2021, namely: -

"59. Form and manner of furnishing details of outward supplies.- (1) Every registered person, other than a person referred to in section 14 of the Integrated Goods and Services Tax Act, 2017 (13 of 2017), required to furnish the details of outward supplies of goods or services or both under section 37, shall furnish such details in FORM GSTR-1 for the month or the quarter, as the case may be, electronically through the common portal, either directly or through a Facilitation Centre as may be notified by the Commissioner.

(2) The registered persons required to furnish return for every quarter under proviso to sub-section (1) of section 39 may furnish the details of such outward supplies of goods or services or both to a registered person, as he may consider necessary, for the first and second months of a quarter, up to a cumulative value of fifty lakh rupees in each of the months,- using invoice furnishing facility

(hereafter in this notification referred to as the "IFF") electronically on the common portal, duly authenticated in the manner prescribed under rule 26, from the 1st day of the month succeeding such month till the 13th day of the said month.

(3) The details of outward supplies furnished using the IFF, for the first and second months of a quarter, shall not be furnished In FORM GSTR-1 for the said quarter.

(4) The details of outward supplies of goods or services or both furnished in FORM GSTR-1 shall include the-

(a) invoice wise details of all –

(i) inter-State and Intra-State supplies made to the registered persons; and

(ii) inter-State supplies with Invoice value more than two and a half lakh rupees made to the unregistered persons;

(b) consolidated details of all –

(i) intra-State supplies made to unregistered persons for each rate of tax; and

(ii) State wise inter-State supplies with Invoice value upto two and a half lakh rupees made to unregistered persons for each rate of tax;

(c) debit and credit notes, if any, issued during the month for invoices issued previously.

(5) The details of outward supplies of goods or services or both furnished using the IFF shall include the -

(a) invoice wise details of inter-State and intra-State supplies made to the registered persons;

(b) debit and credit notes, If any, issued during the month for such invoices issued previously."

3. In the said rules, for rule 60, the following rule shall be substituted with effect from the 1st day of January, 2021, namely: -

"60. Form and manner of ascertaining details of inward supplies.- (1)The details of outward supplies furnished by the supplier in FORM GSTR-1 or using the IFF shall be made available electronically to the concerned registered persons (recipients) in Part A of FORM GSTR-2A, in FORM GSTR-4A and in FORM GSTR-6A through the common portal, as the case may be.

(2) The details of invoices furnished by a non-resident taxable person in his return in FORM GSTR-5 under rule 63 shall be made available to the recipient of credit in Part A of FORM GSTR 2A electronically through the common portal.

(3) The details of invoices furnished by an Input Service Distributor in his return in FORM GSTR-6 under rule 65 shall be made available to the recipient of credit in Part B of FORM GSTR 2A electronically through the common portal.

(4) The details of tax deducted at source furnished by the deductor under sub-section (3) of section 39 in FORM GSTR-7 shall be made available to the deductee in Part C of FORM GSTR-2A electronically through the common portal.

(5) The details of tax collected at source furnished by an e-commerce operator under section 52 in FORM GSTR-8 shall be made available to the concerned person in Part C of FORM GSTR 2A electronically through the common portal.

(6) The details of the integrated tax paid on the import of goods or goods brought in domestic Tariff Area from Special Economic Zone unit or a Special Economic Zone developer on a bill of entry shall be made available in Part D of FORM GSTR-2A electronically through the common portal.

(7) An auto-drafted statement containing the details of input tax credit shall be made available to the registered person in FORM GSTR-2B, for every month, electronically through the common portal, and shall consist of -

(i) the details of outward supplies furnished by his supplier, other than a supplier required to furnish return for every quarter under proviso to sub-section (1) of section 39, in FORM GSTR-1, between the day immediately after the due date of furnishing of FORM GSTR-1 for the previous month to the due date of furnishing of FORM GSTR-1 for the month;

(ii) the details of invoices furnished by a non-resident taxable person in FORM GSTR-5 and details of invoices furnished by an Input Service Distributor in his return in FORM GSTR-6 and details of outward supplies furnished by his supplier, required to furnish return for every quarter under proviso to subsection (1) of section 39, in FORM GSTR-1 or using the IFF, as the case may be,-

(a) for the first month of the quarter, between the day immediately after the due date of furnishing of FORM GSTR-1 for the preceding quarter to the due date of furnishing details using the IFF for the first month of the quarter;

(b) for the second month of the quarter, between the day immediately after the due date of furnishing details using the IFF for the first month of the quarter to the due date of furnishing details using the IFF for the second month of the quarter;

(c) for the third month of the quarter, between the day Immediately after the due date of furnishing of details using the IFF for the second month of the quarter to the due date of furnishing of FORM GSTR-1 for the quarter;

(iii) the details of the integrated tax paid on the import of goods or goods brought in the domestic Tariff Area from Special Economic Zone unit or a Special Economic Zone developer on a bill of entry in the month.

(8) The Statement in FORM GSTR-2B for every month shall be made available to the registered person, -

(i) for the first and second month of a quarter, a day after the due date of furnishing of details of outward supplies for the said month, in the IFF by a registered person required to furnish return for every quarter under proviso to sub-section (1) of section 39, or in FORM GSTR-1 by a registered person, other than those required to furnish return for every quarter under proviso to sub-section (1) of section 39, whichever is later;

(ii) in the third month of the quarter, a day after the due date of furnishing of details of outward supplies for the said month, in FORM GSTR-1 by a registered person required to furnish return for every quarter under proviso to sub-section (1) of section 39."

4. In the said rules, in rule 61, after sub-rule (5), the following sub-rule shall be inserted, namely: -

"(6) Every registered person other than a person referred to in section 14 of the Integrated Goods and Services Tax Act, 2017 (13 of 2017) or an Input Service Distributor or a non-resident taxable person or a person paying tax under section 10 or section 51 or, as the case may be, under section 52 shall furnish a return In FORM GSTR-3B, electronically through the common portal either directly or through a Facilitation Centre notified by the Commissioner, on or before the twentieth day of the month succeeding such tax period:

Provided that for taxpayers having an aggregate turnover of up to five crore rupees in the previous financial year, whose principal place of business is in the States of Chhattisgarh, Madhya Pradesh, Gujarat, Maharashtra, Karnataka, Goa, Kerala, Tamil Nadu, Telangana, Andhra Pradesh, the Union territories of Daman and Diu and Dadra and Nagar Haveli, Puducherry, Andaman and Nicobar Islands or Lakshadweep, the return in FORM GSTR-3B of the said rules for the months of October, 2020 to March, 2021 shall be furnished electronically through the common portal, on or before the twenty- second day of the month succeeding such month:

Provided further that for taxpayers having an aggregate turnover of up to five crore rupees in the previous financial year, whose principal place of business is in the States of Himachal Pradesh, Punjab, Uttarakhand, Haryana, Rajasthan, Uttar Pradesh, Bihar, Sikkim, Arunachal Pradesh,

Nagaland, Manipur, Mizoram, Tripura, Meghalaya, Assam, West Bengal, Jharkhand or Odisha, the Union territories of Jammu and Kashmir, Ladakh, Chandigarh or Delhi, the return in FORM GSTR-3B of the said rules for the months of October, 2020 to March, 2021 shall be furnished electronically through the common portal, on or before the twenty-fourth day of the month succeeding such month."

5. In the said rules, for rule 61, the following rule shall be substituted with effect from the 1st day of January, 2021, namely: -

"61. Form and manner of furnishing of return.-(1) Every registered person other than a person referred to in section 14 of the Integrated Goods and Services Tax Act, 2017 (13 of 2017) or an Input Service Distributor or a non-resident taxable person or a person paying tax under section 10 or section 51 or, as the case may be, under section 52 shall furnish a return in FORM GSTR-3B, electronically through the common portal either directly or through a Facilitation Centre notified by the Commissioner, as specified under -

(i) sub-section (1) of section 39, for each month, or part thereof, on or before the twentieth day of the month succeeding such month:

(ii) proviso to sub-section (1) of section 39, for each quarter, or part thereof, for the class of registered persons mentioned in column (2) of the Table given below, on or before the date mentioned in the corresponding entry in column (3) of the said Table, namely:-

Table

No.	Class of registered persons	Due Date
(1)	(2)	(3)
1.	Registered persons whose principal place of business is in the States of Chhattisgarh, Madhya Pradesh, Gujarat, Maharashtra, Karnataka, Goa, Kerala, Tamil Nadu, Telangana, Andhra Pradesh, the Union territories of Daman and Diu and Dadra and Nagar Haveli, Puducherry, Andaman and Nicobar Islands or Lakshadweep.	twenty-second day of the month succeeding such quarter.
2.	Registered persons whose principal place of business is in the States of Himachal Pradesh, Punjab, Uttarakhand, Haryana, Rajasthan, Uttar Pradesh, Bihar, Sikkim, Arunachal Pradesh, Nagaland, Manipur, Mizoram, Tripura, Meghalaya, Assam, West Bengal, Jharkhand or Odisha, the Union territories of Jammu and Kashmir, Ladakh, Chandigarh or Delhi.	twenty-fourth day of the month succeeding such quarter.

(2) Every registered person required to furnish return, under sub-rule (1) shall, subject to the provisions of section 49, discharge his liability towards tax, interest, penalty, fees or any other amount payable under the Act or the provisions of this Chapter by debiting the electronic cash ledger or electronic credit ledger and include the details in the return in FORM GSTR-3B.

(3) Every registered person required to furnish return, for every quarter, under clause (ii) of sub-rule (1) shall pay the tax due under proviso to sub-section (7) of section 39, for each of the first two months of the quarter, by depositing the said amount in FORM GST PMT-06, by the twenty fifth day of the month succeeding such month:

Provided that the Commissioner may, on the recommendations of the Council, by notification, extend the due date for depositing the said amount in FORM GST PMT-06, for such class of taxable persons as may be specified therein:

Provided further that any extension of time limit notified by the Commissioner of Central tax shall be deemed to be notified by the Commissioner:

Provided also that while making a deposit in FORM GST PMT-06, such a registered person may -

(a) for the first month of the quarter, take into account the balance in the electronic cash ledger.

(b) for the second month of the quarter, take into account the balance in the electronic cash ledger excluding the tax due for the first month.

(4) The amount deposited by the registered persons under sub-rule (3) above, shall be debited while filing the return for the said quarter in FORM GSTR-3B, and any claim of refund of such amount lying in balance in the electronic cash ledger, if any, out of the amount so deposited shall be permitted only after the return in FORM GSTR-3B for the said quarter has been filed."

6. In the said rules, after rule 61, the following rule shall be inserted, namely: -

"61A. Manner of opting for furnishing quarterly return.- (1) Every registered person intending to furnish return on a quarterly basis under proviso to sub-section (1) of section 39, shall in accordance with the conditions and restrictions notified in this regard, indicate his preference for furnishing of return on a quarterly basis, electronically, on the common portal, from the 1st day of the second month of the preceding quarter till the last day of the first month of the quarter for which the option is being exercised:

Provided that where such option has been exercised once, the said registered person shall continue to furnish the return on a quarterly basis for future tax periods, unless the said registered person,-

(a) becomes ineligible for furnishing the return on a quarterly basis as per the conditions and restrictions notified in this regard; or

(b) opts for furnishing of return on a monthly basis, electronically, on the common portal:

Provided further that a registered person shall not be eligible to opt for furnishing quarterly return in case the last return due on the date of exercising such option has not been furnished.

(2) A registered person, whose aggregate turnover exceeds 5 crore rupees during the current financial year, shall opt for furnishing of return on a monthly basis, electronically, on the common portal, from the first month of the quarter, succeeding the quarter during which his aggregate turnover exceeds 5 crore rupees.

7. In the said rules, in rule 62,

- (i) in sub-rule (1), the words, figures, letters and brackets "or paying tax by availing the benefit of Government Notification, Finance Department No. (GHN-22)GST-2019/S.11(1)(42)-TH dated the 7th March, 2019, Notification No. 02/2019-State Tax (Rate)" shall be omitted;
- (ii) in sub-rule (4), the words, figures, letters and brackets "or by availing the benefit of Government Notification, Finance Department No. (GHN-22)GST-2019/S.11(1)(42)-TH dated the 7th March, 2019, Notification No. 02/2019-State Tax (Rate)" shall be omitted;
- (iii) in the explanation to sub-rule (4), the words, figures, letters and brackets "or opting for paying tax by availing the benefit of Government Notification, Finance Department No. (GHN-22)GST- 2019/S. 11(1)(42)-TH dated the 7th March, 2019, Notification No. 02/2019-State Tax (Rate)." shall be omitted;
- (iv) sub-rule (6) shall be omitted.

8. In FORM GSTR-1, in the Instructions, after serial number 17, the following Instruction shall be inserted, namely:-

"18. It will be mandatory to specify the number of digits of HSN code for goods or services that a class of registered persons shall be required to mention as may be specified in the notification issued from time to time under proviso to rule 46 of the said rules.

9. After FORM-2A, the following FORM shall be inserted, namely: -

"FORM-2B

[See rule 60(7)] Auto-drafted ITC Statement

(From FORM GSTR-1, GSTR-5, GSTR-6 and Import data received from ICEGATE)

Year	YYYY-YY
Month	

1. GSTIN	
2(a). Legal name of the registered person	
2(b). Trade name, if any	
2(c). Date of generation	DD/MM/YYYY HH:MM

3. ITC Available Summary (Amount in ₹ in all sections)

S. No.	Heading	GSTR-3B table	Integrated Tax (₹)	Central Tax (₹)	State/UT tax (₹)	Cess (₹)	Advisory
Credit which may be availed under FORM GSTR-3B							
Part A ITC Available - Credit may be claimed in relevant headings in GSTR-3B							
I	All other ITC - Supplies from registered persons other than reverse charge	4(A)(5)					If this is positive, credit may be availed under Table 4(A)(5) of FORM GSTR-3B. If this is negative, credit shall be reversed under Table 4(B)(2) of FORM GSTR-3B.
Details	B2B - Invoices						
	B2B - Debit notes						
	B2B - Invoices (Amendment)						
	B2B - Debit notes (Amendment)						
II	Inward Supplies from ISD	4(A)(4)					If this is positive, credit may be availed under Table 4(A)(4) of FORM GSTR-3B. If this is negative, credit shall be reversed under Table 4(B)(2) of FORM GSTR-3B.
Details	ISD – Invoices						
	ISD – Invoices (Amendment)						
III	Inward Supplies liable for reverse charge	3.1(d) 4(A)(3)					These supplies shall be declared in Table 3.1(d) of FORM GSTR-3B for payment of tax. Credit may be availed under Table 4(A)(3) of FORM GSTR-3B on payment of tax.

S. No.	Heading	GSTR-3B table	Integrated Tax (₹)	Central Tax (₹)	State/ UT tax (₹)	Cess (₹)	Advisory
Details	B2B - Invoices						
	B2B - Debit notes						
	B2B - Invoices (Amendment)						
	B2B - Debit notes (Amendment)						
IV	Import of Goods	4(A)(1)					If this is positive, credit may be availed under Table 4(A)(1) of FORM GSTR-3B. If this is negative, credit shall be reversed under Table 4(B)(2) of FORM GSTR-3B.
Details	IMPG-Import of goods from overseas						
	IMPG (Amendment)						
	IMGSEZ-Import of goods from SEZ						
	IMGSEZ (Amendment)						
Part B	ITC Reversal – Credit shall be reversed in relevant headings in GSTR-3B						
I	Others	4(B)(2)					If this is positive, Credit shall be reversed under Table 4(B)(2) of FORM GSTR-3B. If this is negative, then credit may be reclaimed subject to reversal of the same on an earlier Instance.
Details	B2B-Credit notes						
	B2B-Credit notes (Amendment)						
	B2B-Credit notes (Reverse Charge)						
	B2B-Credit notes (Reverse Charge) (Amendment)						
	ISD-Credit notes						
	ISD-Credit notes (Amendment)						

4. ITC NOT Available Summary

(Amount in ₹ in all sections)

S. No.	Heading	GSTR-3B Table	Integrated Tax (₹)	Central Tax (₹)	State/ UT tax (₹)	Cess (₹)	Advisory
Credit which may not be availed under FORM GSTR-3B							
Part A	ITC Not Available						
I	All other ITC - Supplies from registered persons other than reverse charge	NA					Such Credit shall not be taken in FROM GSTR-3B
Details	B2B – Invoices						
	B2B - Debit notes						
	B2B - Invoices (Amendment)						
	B2B - Debit notes (Amendment)						
II	Inward Supplies from ISD	NA					Such Credit shall not be taken in FROM GSTR-3B
Details	ISD – Invoices						
	ISD Amendment – Invoices						

S. No.	Heading	GSTR-3B Table	Integrated Tax (₹)	Central Tax (₹)	State/UT tax (₹)	Cess (₹)	Advisory
III	Inward Supplies liable for reverse charges	3.1(d)					These supplies shall be declared in Table 3.1(d) of FORM GSTR-3B for payment of tax. However, Credit will not be available on the same.
Details	B2B – Invoices						
	B2B - Debit notes						
	B2B - Invoices (Amendment)						
	B2B - Debit notes (Amendment)						
Part B	ITC Reversal						
I	Others	4(B)(2)					Credit shall be reversed under Table 4(B)(2) of FROM-GSTR-3B.
Details	B2B-Credit notes						
	B2B-Credit notes (Amendment)						
	B2B-Credit notes (Reverse Charge)						
	B2B-Credit notes (Reverse Charge) (Amendment)						
	ISD-Credit notes						
	ISD-Credit notes (Amendment)						

Instructions:

1. Terms Used

- (a) ITC - Input tax credit
- (b) B2B - Business to Business
- (c) ISD - Input service distributor
- (d) IMPG - Import of goods
- (e) IMPGSEZ - Import of goods from SEZ

2. Important Advisory;

(a) FORM GSTR-2B is a statement which has been generated on the basis of the information furnished by your suppliers in their respective FORMS GSTR-1,5 and 6. It is a static statement and will be made available once a month. The documents filed by the supplier in any FORMS GSTR-1,5 and 6 would reflect in the next open FORM GSTR-2B of the recipient irrespective of supplier's date of filing. Taxpayers are advised to refer FORM GSTR-2B for availing credit in FORM GSTR-3B. However, in case for additional details, they may refer to their respective FORM GSTR-2A (which is updated on near real time basis) for more details.

(b) Input tax credit shall be indicated to be non-available in the following scenarios: -

i. Invoice or debit note for supply of goods or services or both where the recipient is not entitled to input tax credit as per the provisions of sub-section (4) of Section 16 of GGST Act, 2017.

ii. Invoice or debit note where the Supplier (GSTIN) and place of supply are in the same State while recipient is in another State.

However, there may be other scenarios for which input tax credit may not be available to the taxpayers and the same has not been generated by the system. Taxpayers, should self-assess and reverse such credit in their FORM GSTR-3B.

3. It may be noted that FORM GSTR-2B will consist of all the FORM GSTR-1s, 5s and 6s being filed by your suppliers, generally between the due dates of filing of two consequent GSTR-1 or furnishing of IFFs, based on the filing option (monthly or quarterly) as chosen by the corresponding supplier. The dates for which the relevant data has been extracted is specified in the GGST Rules and is also available under the "View Advisory" tab on the online portal. For example, FORM GSTR-2B for the month of February will consist of all the documents filed by suppliers who choose to file their FORM GSTR-1 monthly from 00:00 hours on 12th February to 23:59 hours on 11th March.
4. It also contains information on imports of goods from the ICEGATE system including data on imports from Special Economic Zones Units / Developers.
5. It may be noted that reverse charge credit on import of services is not part of this statement and will be continued to be entered by taxpayers in Table 4(A)(2) of FORM GSTR-3B.
6. Table 3 captures the summary of ITC available as on the date of generation of FORM GSTR- 2B. It is divided into following two parts:
 - A. Part A captures the summary of credit that may be availed in relevant tables of FORM GSTR-3B.
 - B. Part B captures the summary of credit that shall be reversed in relevant table of FORM GSTR-3B.
7. Table 4 captures the summary of ITC not available as on the date of generation of FORM GSTR-2B. Credit available in this table shall not be availed as credit in FORM GSTR-3B. However, the liability to pay tax on reverse charge basis and the liability to reverse credit on receipt of credit notes continues for such supplies.
8. Taxpayers are advised to ensure that the data generated in FORM GSTR-2B is reconciled with their own records and books of accounts. Tax payers shall ensure that
 - a. No credit shall be taken twice for any document under any circumstances.
 - b. Credit shall be reversed wherever necessary,
 - c. Tax on reverse charge basis shall be paid.
9. Details of Invoices, credit notes, debit notes, ISD invoices, ISD credit and debit notes, bill of entries etc. will also be made available online and through download facility.
10. There may be scenarios where a percentage of the applicable rate of tax rate may be notified by the Government. A separate column will be provided for invoices / documents where such rate is applicable.
11. Table wise instructions:

Table No. and Heading	Instructions
Table 3 Part A Section I All other ITC - Supplies from registered persons other than reverse charge	<ol style="list-style-type: none"> i. This section consists of the details of supplies (other than those on which tax is to be paid on reverse charge basis), which have been declared and filed by your suppliers in their FORM GSTR-1 and 5. ii. This table displays only the supplies on which input tax credit is available. iii. Negative credit, if any may arise due to amendment in B2B- Invoices and B2B - Debit notes. Such credit shall be reversed in Table 4(B)(2) of FORM GSTR-3B.
Table 3 Part A Section II Inward Supplies from ISD	<ol style="list-style-type: none"> i. This section consists of the details of supplies, which have been declared and filed by an input service distributor in their FORM GSTR-6. ii. This table displays only the supplies on which ITC is available. iii. Negative credit, if any, may arise due to amendment in ISD, Amendments - Invoices, Such credit shall be reversed in table 4(B)(2) of FORM GSTR-3B.

Table No. and Heading	Instructions
Table 3 Part A Section III Inward Supplies liable for reverse charge	i. This section consists of the details of supplies on which tax is to be paid on reverse charge basis, which have been declared and filed by your suppliers in their FORM GSTR-1. ii. This table provides only the supplies on which ITC is available. iii. These supplies shall be declared in Table 3.1(d) of FORM GSTR-3B for payment of tax. Credit may be availed under Table 4(A)(3) of FORM GSTR-3B on payment of tax.
Table 3 Part A Section IV Import of Goods	i. This section provides the details of IGST paid by you on import of goods from overseas and SEZ units / developers on bill of entry and amendment thereof. These details are updated on near real time basis from the ICEGATE system. ii. This table shall consist of data on the imports made by you (GSTIN) in the month for which FORM GSTR-2B is being generated for. iii. The ICEGATE reference date is the date from which the recipient is eligible to take input tax credit. iv. The table also provides if the Bill of entry was amended. v. Information is provided in the tables based on data received from ICEGATE. Information on certain imports such as courier imports, may not be available.
Table 3 Part B Section I Others	i. This section consists of the details of credit notes received and amendment thereof which have been declared and filed by your suppliers in their FORM GSTR-1 and 5 ii. Such credit shall be reversed under Table 4(B)(2) of FORM GSTR-3B. If this value is negative, then credit may be reclaimed subject to reversal of the same on an earlier instance.
Table 4 Part A Section I All other ITC - Supplies from registered persons other than reverse charge	i. This section consists of the details of supplies (other than those on which tax is to be paid on reverse charge basis), which have been declared and filed by your suppliers in their FORM GSTR-1 and 5. ii. This table provides only the supplies on which ITC is not available. iii. This is for information only and such credit shall not be taken in FORM GSTR-3B.
Table 4 Part A Section II Inward Supplies from ISD.	i. This section consists of the details of supplies, which have been declared and filed by an input service distributor in their FORM GSTR-6. ii. This table provides only the supplies on which ITC is not available. iii. This is for information only and such credit shall not be taken in FORM GSTR-3B.
Table 4 Part A Section III Inward Supplies liable for reverse charge.	i. This section consists of the details of supplies, liable for reverse charge, which have been declared and filed by your suppliers in their FORM GSTR-1. ii. This table provides only the supplies on which ITC is not available. iii. This supplies shall be declared in Table 3.1(d) of FROM GSTR-3B for payment of tex. However, credit will not be available on such supplies.
Table 4 Part B Section I Others.	i. This section consists of the details the credit notes received and amendment thereof which have been declared and filed by your suppliers in their FORM GSTR-1 and 5. ii. This table provides only the credit notes on which ITC is not available. iii. Such credit shall be reversed under Table 4(B)(2) of FORM GSTR-3B.

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXI | FRIDAY, DECEMBER 18, 2020/ AGRAHAYANA 27, 1942

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 18th December, 2020.

Notification No. 91/2020-State Tax

Gujarat Goods and Services Tax Act, 2017.

No.(GHN-116) GST-2020/S.168A(9)TH:- In exercise of the powers conferred by sections 168A of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017) The Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby makes the following further amendment in the notification of the Government of Gujarat, Finance Department No. (GHN-37) GST-2020/S.168A(1)-TH dated the 9th April, 2020 being Notification No. 35/2020-State Tax, namely:-

In the said notification, in the first paragraph, in the proviso to clause (i),

- (i) for the words figures and letters "29th day of November, 2020", the words, figures and letters "30th day of March, 2021" shall be substituted.
- (ii) for the words figures and letters "30th day of November, 2020", the words, figures and letters "31st day of March, 2021" shall be substituted.

2. This notification shall be deemed to have come into force with effect from the 1st day of December, 2020.

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,

Deputy Secretary to Government.

GOVERNMENT CENTRAL PRESS, GANDHINAGAR.



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXI]

FRIDAY, JANUARY 1, 2021/ PAUSA 11, 1942

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 1st January, 2021.

Notification No. 1/2021-State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-1) GST-2021/S.164(68)TH:- In exercise of the powers conferred by section 164 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby makes the following rules further to amend the Gujarat Goods and Services Tax Rules, 2017, namely: -

1. Short title and commencement:

(1) These rules may be called the Gujarat Goods and Services Tax (Amendment) Rules, 2021.

(2) These rules shall come into force on the date of their publication in the Official Gazette.

2. In the Gujarat Goods and Services Tax Rules, 2017 (hereafter in this notification referred to as the said rules, in rule 59, after sub-rule (5), the following sub-rule shall be inserted, namely: -

“(6) Notwithstanding anything contained in this rule, -

- (a) a registered person shall not be allowed to furnish the details of outward supplies of goods or services or both under section 37 in **FORM GSTR-1**, if he has not furnished the return in **FORM GSTR-3B** for preceding two months;
- (b) a registered person, required to furnish return for every quarter under the proviso to sub-section (1) of section 39, shall not be allowed to furnish the details of outward supplies of goods or services or both under section 37 in **FORM GSTR-1** or using the invoice furnishing facility, if he has not furnished the return in **FORM GSTR-3B** for preceding tax period;
- (c) a registered person, who is restricted from using the amount available in electronic credit ledger to discharge his liability towards tax in excess of ninety-nine per cent. of such tax liability under rule 86B, shall not be allowed to furnish the details of outward supplies of goods or services or both under section 37 in **FORM GSTR-1** or using the invoice furnishing facility, if he has not furnished the return in **FORM GSTR-3B** for preceding tax period.”.

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.

GOVERNMENT CENTRAL PRESS, GANDHINAGAR.



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXI | TUESDAY, MARCH 2, 2021/ PHALGUNA 11, 1942

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 2nd March, 2021.

Notification No. 3/2021-State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-9) GST-2021/S.25 (6D) (2) TH:- In exercise of the powers conferred by sub-section (6D) of section 25 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), (hereafter in this notification referred to as the said Act), the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council and in supersession of the notification of the Government of Gujarat, Finance Department No. (GHN-26)GST-2020/S.25(6D)(1)-TH dated the 27th March, 2020, being Notification No. 17/2020-State Tax, except as respects things done or omitted to be done before such supersession, hereby notifies that the provisions, of sub-section (6B) or sub-section (6C) of section 25 of the said Act shall not apply to a person who is,-

- (a) not a citizen of India; or
- (b) a Department or establishment of the Central Government or State Government; or
- (c) a local authority; or
- (d) a statutory body; or
- (e) a Public Sector Undertaking; or
- (f) a person applying for registration under the provisions of sub-section (9) of section 25 of the said Act.

2. This notification shall be deemed to have come into force with effect from the 23rd day of February, 2021.

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.

GOVERNMENT CENTRAL PRESS, GANDHINAGAR.



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

VOL. LXII] THURSDAY, MARCH 18, 2021 / PHALGUNA 27, 1942

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 18th March, 2021

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017

No.(GHN-13) GST-2021/R.48(4)(6)TH:- In exercise of the powers conferred by sub-rule (4) of rule 48 of the Gujarat Goods and Services Tax Rules, 2017, the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby makes the following further amendment in the notification of the Government of Gujarat, Finance Department No.(GHN-22)GST-2020/R.48(4)(2)-TH dated the 27th March, 2020, being Notification No.13/2020-State Tax, namely:-

In the said notification, in the first paragraph, with effect from the 1st day of April, 2021, for the words "one hundred crore rupees", the words "fifty crore rupees" shall be substituted.

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.

Government Central Press, Gandhinagar.



सत्यमेव जयते

The Gujarat Government Gazette

**EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY**

VOL. LXIII

MONDAY, MAY 17, 2021 / VAISAKHA 27, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

**Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts**

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 11th May, 2021

Notification No. 07/2021- State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017

No.(GHN-21) GST-2021/S.164(69)TH:- In exercise of the powers conferred by section 164 of the Gujarat Good and Services Tax Act, 2017 (Guj.25 of 2017), the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby makes the following rules further to amend the Gujarat Goods and Services Tax Rules, 2017, namely :-

1. Short title and commencement:

- (1) These rules may be called the Gujarat Goods and Services Tax (Second Amendment) Rules, 2021.
- (2) These rules shall be deemed to have come into force with effect from the 27th day of April, 2021.

2. In the Gujarat Goods and Services Tax Rules, 2017, in rule 26 in sub-rule (1), after the third proviso, the following proviso shall be inserted, namely :-

"Provided also that a registered person registered under the provisions of the Companies Act, 2013 (18 of 2013) shall, during the period from the 27th day of April, 2021 to the 31st Day of May, 2021, also be allowed to furnish the return under section 39 in **FORM GSTR-3B** and the details of outward supplies under section 37 in **FORM GSTR-1** or using invoice furnishing facility, verified through electronic verification code (EVC)."

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,

Deputy Secretary to Government.

FINANCE DEPARTMENT**NOTIFICATION**Sachivalaya, Gandhinagar, 17th May, 2021**Notification No. 09/2021- State Tax****GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017**

No.(GHN-22) GST-2021/S.128(28)TH:- In exercise of the powers conferred by section 128 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby makes the following further amendments in the notification of the Government of Gujarat, Finance Department No. (GHN-134)GST-2018/S.128(13)-TH dated the 31st December, 2018 being Notification No. 76/2018-State Tax, namely:-

In the said notification, after the seventh proviso, the following proviso shall be inserted, namely: –

“Provided also that the amount of late fee payable under section 47 shall stand waived for the period as specified in column (4) of the Table given below, for the tax period as specified in the corresponding entry in column (3) of the said Table, for the class of registered persons mentioned in the corresponding entry in column (2) of the said Table, who fail to furnish the returns in **FORM GSTR-3B** by the due date, namely:-

Table

S.No. (1)	Class of registered persons (2)	Tax period (3)	Period for which late fee waived (4)
1.	Taxpayers having an aggregate turnover of more than rupees 5 crores in the preceding financial year	March, 2021 and April, 2021	Fifteen days from the due date of furnishing return
2.	Taxpayers having an aggregate turnover of up to rupees 5 crores in the preceding financial year who are liable to furnish the return as specified under sub-section (1) of section 39	March, 2021 and April, 2021	Thirty days from the due date of furnishing return
3.	Taxpayers having an aggregate turnover of up to rupees 5 crores in the preceding financial year who are liable to furnish the return as specified under proviso to sub-section (1) of section 39	January-March, 2021	Thirty days from the due date of furnishing return.”.

2. This notification shall be deemed to have come into force with effect from the 20th day of April, 2021.

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,

Deputy Secretary to Government.

FINANCE DEPARTMENT**NOTIFICATION**Sachivalaya, Gandhinagar, 17th May, 2021**Notification No. 08/2021- State Tax****GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017**

No.(GHN-23) GST-2021/S.50(1)(2)TH:- In exercise of the powers conferred by sub-section (1) of section 50 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017) read with section 148

of the said Act, the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby makes the following further amendments in notification of the Government of Gujarat, Finance Department No. (GHN-30) GST-2017/S.50,54&56(1)-TH dated the 30th June, 2017 being Notification No. 13/2017-State Tax, namely:—

(i) In the said notification, in the first paragraph, in the first proviso, in the Table after S. No. 3, the following shall be inserted, namely: —

(1)	(2)	(3)	(4)
“4.	Taxpayers having an aggregate turnover of more than rupees 5 crores in the preceding financial year	9 per cent for the first 15 days from the due date and 18 per cent thereafter	March, 2021, April, 2021
5.	Taxpayers having an aggregate turnover of up to rupees 5 crores in the preceding financial year who are liable to furnish the return as specified under sub-section (1) of section 39	Nil for the first 15 days from the due date, 9 per cent for the next 15 days, and 18 per cent thereafter	March, 2021, April, 2021
6.	Taxpayers having an aggregate turnover of up to rupees 5 crores in the preceding financial year who are liable to furnish the return as specified under proviso to sub-section (1) of section 39	Nil for the first 15 days from the due date, 9 per cent for the next 15 days, and 18 per cent thereafter	March, 2021, April, 2021
7.	Taxpayers who are liable to furnish the return as specified under sub-section (2) of section 39	Nil for the first 15 days from the due date, 9 per cent for the next 15 days, and 18 per cent thereafter	Quarter ending March, 2021.”.

2. This notification shall be deemed to have come into force with effect from the 18th day of April, 2021.

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,

Deputy Secretary to Government.

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 17th May, 2021

Notification No. 13/2021- State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017

No.(GHN-24) GST-2021/S.164(70)TH:- In exercise of the powers conferred by section 164 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby makes the following rules further to amend the Gujarat Goods and Services Tax Rules, 2017, namely: -

1. Short title and commencement:

(1) These rules may be called the Gujarat Goods and Services Tax (Third Amendment) Rules, 2021.

(2) These rules shall be deemed to have come into force with effect from the 1st day of May, 2021.

2. In the Gujarat Goods and Services Tax Rules, 2017,-

(i) in sub-rule (4) of rule 36, after the first proviso, the following proviso shall be inserted, namely:-

“Provided further that such condition shall apply cumulatively for the period April and May, 2021 and the return in **FORM GSTR-3B** for the tax period May, 2021 shall be furnished with the cumulative adjustment of input tax credit for the said months in accordance with the condition above.”;

(ii) in sub-rule (2) of rule 59, the following proviso shall be inserted, namely:-

“Provided that a registered person may furnish such details, for the month of April, 2021, using IFF from the 1st day of May, 2021 till the 28th day of May, 2021.”.

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 17th May, 2021

Notification No. 10/2021- State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017

No.(GHN-25) GST-2021/S.148(37)TH:- In exercise of the powers conferred by section 148 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby makes the following further amendments in the notification of the Government of Gujarat, Finance Department No. (GHN-43)GST-2019/S.148(15)-TH dated the 24th April, 2019 being Notification No. 21/2019-State Tax, namely:-

In the said notification, in the third paragraph, after the first proviso, the following proviso shall be inserted, namely: –

“Provided further that the said persons shall furnish the return in **FORM GSTR-4** of the Gujarat Goods and Services Tax Rules, 2017, for the financial year ending 31st March, 2021, upto the 31st day of May, 2021.”.

2. This notification shall be deemed to have come into force with effect from the 30th day of April, 2021.

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 17th May, 2021

Notification No. 14/2021- State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017

No.(GHN-26) GST-2021/S.168A(10)TH:- In exercise of the powers conferred by section 168A of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017) (hereafter in this notification referred to as the said Act), in view of the spread of pandemic COVID-19 across many parts of

India, the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby notifies, as under,-

- (i) where, any time limit for completion or compliance of any action, by any authority or by any person, has been specified in, or prescribed or notified under the said Act, which falls during the period from the 15th day of April, 2021 to the 30th day of May, 2021, and where completion or compliance of such action has not been made within such time, then, the time limit for completion or compliance of such action, shall be extended upto the 31st day of May, 2021, including for the purposes of—
- (a) completion of any proceeding or passing of any order or issuance of any notice, intimation, notification, sanction or approval or such other action, by whatever name called, by any authority, commission or tribunal, by whatever name called, under the provisions of the Act stated above; or
- (b) filing of any appeal, reply or application or furnishing of any report, document, return, statement or such other record, by whatever name called, under the provisions of the Act stated above;

but, such extension of time shall not be applicable for the compliances of the following provisions of the said Act, namely: -

- (a) Chapter IV;
- (b) sub-section (3) of section 10, sections 25, 27, 31, 37, 47, 50, 69, 90, 122, 129;
- (c) section 39, except sub-section (3), (4) and (5);
- (d) section 68, in so far as e-way bill is concerned; and
- (e) rules made under the provisions specified at clause (a) to (d) above :

Provided that where, any time limit for completion of any action, by any authority or by any person, specified in, or prescribed or notified under rule 9 of the Gujarat Goods and Services Tax Rules, 2017, falls during the period from the 1st day of May, 2021 to the 31st day of May, 2021, and where completion of such action has not been made within such time, then, the time limit for completion of such action, shall be extended upto the 15th day of June, 2021;


- (ii) in cases where a notice has been issued for rejection of refund claim, in full or in part and where the time limit for issuance of order in terms of the provisions of sub-section (5), read with sub-section (7) of section 54 of the said Act falls during the period from the 15th day of April, 2021 to the 30th day of May, 2021, in such cases the time limit for issuance of the said order shall be extended to fifteen days after the receipt of reply to the notice from the registered person or the 31st day of May, 2021, whichever is later.

2. This notification shall be deemed to have come into force with effect from the 15th day of April, 2021.

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,

Deputy Secretary to Government.





सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

VOL. LXII]

WEDNESDAY, JUNE 02, 2021 / JYAISTHA 12, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 2nd June, 2021.

Notification No. 15/2021- State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-27) GST-2021/S.164(71)TH:- In exercise of the powers conferred by section 164 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby makes the following rules further to amend the Gujarat Goods and Services Tax Rules, 2017, namely: -

1. Short title and commencement:

- (1) These rules may be called the Gujarat Goods and Services Tax (Fourth Amendment) Rules, 2021.
- (2) These rules shall be deemed to have come into force with effect from the 18th day of May, 2021.

2. In the Gujarat Goods and Services Tax Rules, 2017, -

(i) in rule 23, in sub-rule (1), after the words "date of the service of the order of cancellation of registration", the words and figures "or within such time period as extended by the Deputy Commissioner or the Joint Commissioner, as the case may be, in exercise of the powers provided under the proviso to sub-section (1) of section 30," shall be inserted;

(ii) in rule 90, -

(a) in sub-rule (3), the following proviso shall be inserted, -

"Provided that the time period, from the date of filing of the refund claim in FORM GST RFD-01 till the date of communication of the deficiencies in FORM GST RFD-03 by the proper officer, shall be excluded from the period of two years as specified under sub-section (1) of Section 54, in respect of any such fresh refund claim Filed by the applicant after rectification of the deficiencies.";

(b) after sub-rule (4), the following sub-rules shall be inserted, namely: -

"(5) The applicant may, at any time before issuance of provisional refund sanction order in FORM GST RFD-04 or final refund sanction order in FORM GST RFD-06 or payment order in FORM GST RFD-05 or refund withhold order in FORM GST RFD-07 or notice in FORM GST RFD-08, in respect of any refund application filed in FORM GST RFD-01, withdraw the said application for refund by filing an application in FORM GST RFD-01W.

(6) On submission of application for withdrawal of refund in **FORM GST RFD-01W**, any amount debited by the applicant from electronic credit ledger or electronic cash ledger, as the case may be, while filing application for refund in **FORM GST RFD-01**, shall be credited back to the ledger from which such debit was made.";

(iii) in rule 92, -

(a) in sub-rule (1), the proviso shall be omitted;

(b) in sub-rule (2), -

(i) for the word and letter "Part B", the word and letter "Part A" shall be substituted;

(ii) the following proviso shall be inserted, namely: -

"Provided that where the proper officer or the Commissioner is satisfied that the refund is no longer liable to be withheld, he may pass an order for release of withheld refund in Part B of **FORM GST RFD- 07**.";

(iv) in rule 96, -

(a) in sub-rule (6), for the word and letter "Part B", the word and letter "Part A" shall be substituted;

(b) in sub-rule (7), for the words, letters and figures, "after passing an order in **FORM GST RFD-06**", the words, letters and figures, "by passing an order in **FORM GST RFD-06** after passing an order for release of withheld refund in Part B of **FORM GST RFD-07**" shall be substituted;

(v) in **FORM GST REG-21**, under the sub-heading "Instructions for submission of application for revocation of cancellation of registration", in the first bullet point "after the words "date of service of the order of cancellation of registration", the words and figures "or within such time period as extended by the Deputy Commissioner or the Joint Commissioner, as the case may be, in exercise of the powers provided under proviso to sub-section (1) of section 30," shall be inserted;

(vi) in rule 138E, for the words "in respect of a registered person, whether as a supplier or a recipient, who, —" the words „in respect of any outward movement of goods of a registered person, who, —" shall be substituted.

(vii) for **FORM GST RFD-07**, the following **FORM** shall be substituted, namely: -

"FORM GST RFD-07

[See rules 92(2) & 96(6)]

Reference No.

Date: <DD/MM/YYYY>

To

.....(GSTIN/UIN/Temp. ID)

.....(Name)

.....(Address)

.....(ARN)

Part-A

Order for withholding the refund

Refund payable to the taxpayer with respect to ARN specified above are hereby withheld in accordance with the provisions of sub-section (10)/ (11) of section 54 of the GGST Act, 2017. The reasons for withholding are given as under:

S. No.	Particulars	
1	ARN	
2	Amount Claimed in RFD-01	< Auto-populated >
3	Amount Inadmissible in RFD-06	< Auto-populated >
4	Amount Adjusted in RFD-06	< Auto-populated >
5	Amount Withheld	
6	Reasons for withholding (More than one reason can be selected)	<input type="checkbox"/> Recoverable dues not paid <input type="checkbox"/> In view of sub-section 11 of Section 54 <input type="checkbox"/> On account of fraud (s) of serious nature <input type="checkbox"/> Others, (specify)
7	Description of the reasons	(Up to 500 characters, separate file can be attached for detailed reasons)
8	Record of Personal Hearing	(Up to 500 characters, separate file can be attached for detailed records)

Part-B**Order for release of withheld refund**

This has reference to your refund application <ARN> dated <date> against which the payment of refund amount sanctioned vide order <RFD-06 order no> dated <date> was withheld by this office order <Order Reference No> dated <date>. It has been now found to my satisfaction that the conditions for withholding of refund no longer exist and therefore, the refund amount withheld is hereby allowed to be released as given under:

S. No.	Particulars	
1	ARN	
2	Amount Claimed in RFD-01	<Auto-populated>
3	Amount Inadmissible in RFD-06	<Auto-populated>
4	Amount Adjusted in RFD-06	<Auto-populated>
5	Amount Withheld in RFD-07 A	<Auto-populated>
6	Amount Released	
7	Amount to be Paid	

Date:

Place:

Signature (DSC):

Name:

Designation:

Office Address: ";

(viii) after FORM GST RFD-01 B, the following FORM shall be inserted, namely: -

"FORM GST RFD-01 W*[Refer Rule 90(5)]***Application for Withdrawal of Refund Application**

1. ARN:
2. GSTIN:
3. Name of Business (Legal):
4. Trade Name, if any:
5. Tax Period:
6. Amount of Refund Claimed:
7. Grounds for Withdrawing Refund Claim:
 - i. Filed the refund application by mistake
 - ii. Filed Refund Application under wrong category
 - iii. Wrong details mentioned in the refund application
 - iv. Others (Please Specify)
8. Declaration: I/We <Taxpayer Name> hereby solemnly affirm and declare that the information given herein is true and correct to the best of my/ our knowledge and belief and nothing has been concealed therefrom.

Place:

Date:

Signature of Authorised Signatory

Name

Designation/ Status".

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

VOL. LXII]

MONDAY, JUNE 7, 2021 / JYAISTHA 17, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 2nd June, 2021

Notification No. 01/2021- State Tax (Rate)

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-27A) GST-2021/S.9(1) (34)TH:- In exercise of the powers conferred by sub-section (1) of section 9 and sub-section (5) of section 15 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj. 25 of 2017), the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby makes the following further amendments in the notification of the Government of Gujarat, Finance Department No. (GHN-31) GST-2017/S.9(1)(1)-TH dated the 30th June, 2017 being Notification No. 1/2017-State Tax (Rate), namely:-

In the said notification,-

- (a) in Schedule I - 2.5%, against S. No. 259A, for the entry in column (2), the entry "9503" shall be substituted;
 - (b) after Schedule I, in the List 1, after serial number 230 and the entries relating thereto, the following shall be inserted, namely-
"(231) Diethylcarbamazine".
2. This notification shall come into force with effect from the 2nd day of June, 2021.

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.

GOVERNMENT CENTRAL PRESS, GANDHINAGAR.



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

VOL. LXII]

WEDNESDAY, JUNE 9, 2021 / JYAISTHA 19, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 9th June, 2021.

Notification No. 24/2021-State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-32) GST-2021/S.168A (11)TH:- In exercise of the powers conferred by section 168A of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017) (hereafter in this notification referred to as the said Act), the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby makes the following amendments in the notification of the Government of Gujarat, Finance Department No. (GHN-26)GST-2021/S.168A(10)-TH dated the 17th May, 2021, being Notification No. 14/2021-State Tax, namely:-

In the said notification, in the first paragraph,-

(i) in clause (i), —

- a. for the figures, letters and words "30th day of May, 2021", the figures, letters and words "29th day of June, 2021" shall be substituted;
- b. for the figures, letters and words "31st day of May, 2021", the figures, letters and words "30th day of June, 2021" shall be substituted;

(ii) in proviso to clause (i), —

- a. for the figures, letters and words "31st day of May, 2021", the figures, letters and words "30th day of June, 2021" shall be substituted;
- b. for the figures, letters and words "15th day of June, 2021", the figures, letters and words "15th day of July, 2021" shall be substituted;

(iii) in clause (ii), —

- a. for the figures, letters and words "30th day of May, 2021", the figures, letters and words "29th day of June, 2021" shall be substituted;
- b. for the figures, letters and words "31st day of May, 2021", the figures, letters and words "30th day of June, 2021" shall be substituted.

2. This notification shall be deemed to have come into force with effect from the 30th day of May, 2021.

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.

GOVERNMENT CENTRAL PRESS, GANDHINAGAR.



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

VOL. LXII]

WEDNESDAY, JUNE 9, 2021 / JYAISTHA 19, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 9th June, 2021

Notification No. 20/2021-State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-35) GST-2021/S.128 (30)TH:- In exercise of the powers conferred by section 128 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017)(hereafter in this notification referred to as the said Act), the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby makes the following further amendments in the notification of the Government of Gujarat, Finance Department No. (GHN-8)/GST-2018/S.128(5)-TH dated the 23rd January, 2018 being Notification No. 4/2018-State Tax, namely:-

In the said notification, after the fourth proviso, the following proviso shall be inserted, namely: —

"Provided also that the total amount of late fee payable under section 47 of the said Act for the tax period June, 2021 onwards or quarter ending June, 2021 onward, as the case may be, shall stand waived which is in excess of an amount as specified in column (3) of the Table given below, for the class of registered persons mentioned in the corresponding entry in column (2) of the said Table, who fail to furnish the details of outward supplies in **FORM GSTR-1** by the due date, namely: —

TABLE

S. No. (1)	Class of registered persons (2)	Amount (3)
1.	Registered persons who have nil outward supplies in the tax period	Two hundred and fifty rupees
2.	Registered persons having an aggregate turnover of up to rupees 1.5 crores in the preceding financial year, other than those covered under S. No. 1	One thousand rupees
3.	Registered persons having an aggregate turnover of more than rupees 1.5 crores and up to rupees 5 crores in the preceding financial year, other than those covered under S. No. 1	Two thousand and five hundred rupees".

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.

GOVERNMENT CENTRAL PRESS, GANDHINAGAR.



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

VOL. LXII | WEDNESDAY, JUNE 9, 2021 / JYAISTHA 19, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 9th June, 2021

Notification No. 21/2021-State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-36) GST-2021/S.128 (31)TH:- In exercise of the powers conferred by section 128 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017)(hereafter in this notification referred to as the said Act), the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, hereby makes the following further amendments in the notification of the Government of Gujarat, Finance Department No. (GHN-141)GST-2017/S.128(4)-TH dated the 29th December, 2017 being Notification No. 73/2017-State Tax, namely:-

In the said notification, after the third proviso, the following proviso shall be inserted, namely: —

"Provided also that the total amount of late fee payable under section 47 of the said Act for financial year 2021-22 onwards, by the registered persons who fail to furnish the return in **FORM GSTR-4** by the due date, shall stand waived -

- (i) which is in excess of two hundred and fifty rupees where the total amount of State tax payable in the said return is nil;
- (ii) which is in excess of one thousand rupees for the registered persons other than those covered under clause (i)."

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.

GOVERNMENT CENTRAL PRESS, GANDHINAGAR.



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

VOL. LXII]

WEDNESDAY, JUNE 9, 2021 / JYAISTHA 19, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

**Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts**

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 9th June, 2021

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-38) GST-2021/S.96(3)TH:- In exercise of the powers conferred by section 96 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017), the Government of Gujarat, hereby amends the Government of Gujarat notification, Finance Department No. (GHN-58)GST-2017/S.96(1)-TH, dated the 12th July, 2017, as under:-

In the said notification, for the existing entries (i) and (ii), the following entries shall be substituted, namely:-

- "(i) Additional Commissioner or Joint Commissioner of Central Tax as nominated by the Central Government;
and
- (ii) Joint Commissioner (Legal) of State Tax."

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.

GOVERNMENT CENTRAL PRESS, GANDHINAGAR.



સત્યમેવ જયતે

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

VOL. LXII]

MONDAY, JUNE 14, 2021 / JYAISTHA 24, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 14th June, 2021.

Notification No. 5/2021-State Tax (Rate)

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-41) GST-2021/S.11(1) (54) TH:- In exercise of the powers conferred by sub-section (1) of section 11 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017) (hereafter in this notification referred to as "the said Act"), the Government of Gujarat, on being satisfied that it is necessary in the public interest so to do, on the recommendations of the Goods and Services Tax Council, hereby exempts the goods specified in column (3) of the Table below, falling under the tariff item, sub-heading, heading or Chapter as specified in the First Schedule to the Customs Tariff Act, 1975 (51 of 1975), as the case may be, as specified in the corresponding entry in column (2), of the Table below, from the so much of the State tax leviable thereon under section 9 of the said Act, as in excess of the amount as specified in corresponding entry in column (4) of the Table aforesaid:

Table

SI. No.	Chapter, Heading, Sub-heading or Tariff item	Description of Goods	Rate
(1)	(2)	(3)	(4)
1	2804	Medical Grade Oxygen	2.5%
2	30	Tocilizumab	Nil
3	30	Amphotericin B	Nil
4	30	Remdesvir	2.5%
5	30	Heparin (anti-coagulant)	2.5%
6	3002 or 3822	Covid-19 testing kits	2.5%
7	3002 or 3822	Inflammatory Diagnostic (marker) kits, namely-IL6, D-Dimer, CRP (C-Reactive Protein), LDH (Lactate De-Hydrogenase), Ferritin, Pro Calcitonin (PCT) and blood gas reagents.	2.5%
8	3804 94	Hand Sanitizer	2.5%
9	6506 99 00	Helmets for use with non-invasive ventilation	2.5%
10	8417 or 8514	Gas/Electric/other furnaces for crematorium	2.5%
11	9018 19 or 9804	Pulse Oximeter	2.5%
12	9018	High flow nasal canula device	2.5%
13	9019 20 or 9804	Oxygen Concentrator/ generator	2.5%

Sl. No.	Chapter, Heading, Sub-heading or Tariff item	Description of Goods	Rate
(1)	(2)	(3)	(4)
14	9018 or 9019	Ventilators	2.5%
15	9019	BiPAP Machine	2.5%
16	9019	(i) Non-invasive ventilation nasal or oronasal masks for ICU ventilators (ii) Canula for use with ventilators	2.5%
17	9025	Temperature check equipment	2.5%
18	8702 or 8703	Ambulance	6%

2. This notification shall remain in force upto and inclusive of the 30th September, 2021.

By order and in the name of the Governor of Gujarat,

VIJAY SANGADIYA,
Section Officer to Government.

Government Central Press, Gandhinagar.



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

VOL. LXII] THURSDAY, JUNE 24, 2021 / ASADHA 3, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

CORRIGENDUM

Sachivalaya, Gandhinagar, 23rd June, 2021.

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-42) GST-2021/S.11(1) (55) TH:- In the notification of the Government of Gujarat, Finance Department No. (GHN-41) GST-2021/S.11(1) (54)-TH dated the 14th June, 2021 being Notification No. 5/2021-State Tax (Rate), in the Table, against SI. No. 8, in column (2), for "3804 94", read "3804 94".

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.

Government Central Press, Gandhinagar.

Extra No. 201



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

VOL. LXII]

MONDAY, JULY 05, 2021 / ASADHA 14, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 2nd July, 2021.

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-45)GST-2021/S.1(14)TH:- In exercise of the powers conferred by sub-section (2) of section 1 of the Gujarat Goods and Services Tax (Amendment) Act, 2019 (Guj.29 of 2019), the Government of Gujarat hereby appoints and shall deemed to have been appointed the 17th day of December, 2019, as the date on which the provisions of section 13 of the said Act shall have come into force.

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.

IV-B Ex.-201

201-1



Government Central Press, Gandhinagar.

Extra No. 215



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

MONDAY, JULY 12, 2021 / ASADHA 21, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 9th July, 2021.

Notification No. 28/2021-State Tax

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-48) GST-2021/S.128(33)TH:- In exercise of the powers conferred by section 128 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj.25 of 2017) (hereafter in this notification referred to as the said Act), the Government of Gujarat, on the recommendations of the Goods and Services Tax Council, and in supersession of notification of the Government of Gujarat, Finance Department No. (GHN-115) GST-2020/S.128(26)TH dated the 17th December, 2020 being Notification No. 89/2020-State Tax, except as respects things done or omitted to be done before such supersession, hereby waives the amount of penalty payable by any registered person under section 125 of the said Act for non-compliance of the provisions of notification of the Government of Gujarat, Finance Department No. (GHN-21) GST-2020/R.46(2) TH dated the 27th March, 2020 being Notification No. 14/2020-State Tax, between the period from the 1st day of December, 2020 to the 30th day of September, 2021.

By order and in the name of Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.

IV-B Ex.-215

215-1



Government Central Press, Gandhinagar.

Extra No. 269



The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

FRIDAY, AUGUST 13, 2021 / SRAVANA 22, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 11th August, 2021

GUJARAT GOODS AND SERVICES TAX ACT, 2017.

No.(GHN-56) GST-2021/S.57(1)TH:- In exercise of the powers conferred by section 57 of the Gujarat Goods and Services Tax Act, 2017 (Guj. 25 of 2017), the Government of Gujarat hereby constitute the Gujarat Consumer Welfare Fund for the purposes of the said Act, with effect from 1st July, 2017.

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,

Deputy Secretary to Government.

IV-B Ex.-269

269-1



Government Central Press, Gandhinagar.

Extra No. 270



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII] FRIDAY, AUGUST 13, 2021 / SRAVANA 22, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-B

Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made
by the Government of Gujarat under the Gujarat Acts

FINANCE DEPARTMENT

ORDER

Sachivalaya, Gandhinagar, 11th August, 2021

GUJARAT GOODS AND SERVICES TAX RULES, 2017.

No.(GHN-57)GST-2021/R.97(4) (1)TH:- In pursuance of the powers conferred by sub-rule (4) of rule 97 of the Gujarat Goods and Services Tax Rules, 2017, the Government of Gujarat, hereby constitute a Standing Committee, to make recommendations for proper utilization of the money credited to the Gujarat Consumer Welfare Fund for welfare of the consumers, consisting of the following members, namely:—

1. Chief Commissioner of State Tax	Chairman
2. Special Commissioner of State Tax	Vice Chairman
3. Additional Commissioner of State Tax	Member Secretary
4. Additional Secretary/Joint Secretary/Deputy Secretary (Tax), Finance Department	Member
5. Additional Secretary/Joint Secretary/Deputy Secretary, Industries and Mines Department	Member
6. Managing Director, Gujarat State Civil Supplies Corporation	Member
7. Commissioner/Director of Information	Member

By order and in the name of the Governor of Gujarat,

DILIP THAKER,
Deputy Secretary to Government.

IV-B Ex.-270

270-1



Government Central Press, Gandhinagar.

Extra No. 115

વાર્ષિક લવાજમનો દર રૂ. ૪,૦૦૦/-



સત્યમેવ જયતે

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

THURSDAY, MARCH 25, 2021 / CHAITRA 4, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૫ મી માર્ચ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૨૭ મી માર્ચ, ૨૦૨૦ના જાહેરનામા ક્રમાંક:(જાએચએન-૩૧)જાએસટીઆર-૨૦૨૦/એસ.૧૬૪(૫૪)-ઠ.-નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

NOTIFICATION

Regarding

Amendment to the Gujarat Goods and Services Tax Rules, 2017

ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ સુધારવા સંબંધી

જાહેરનામું.

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૭મી માર્ચ, ૨૦૨૦

જાહેરનામું ક્રમાંક: ૧૬/૨૦૨૦ - રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક: (જીએચએન-૩૧) જીએસટીઆર-૨૦૨૦/એસ.૧૬૪(પ૪)-ઠ:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના રપમા)ની કલમ ૧૬૪થી મળેલી સત્તાની રૂએ, રાજ્ય સરકાર, આથી, ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ વધુ સુધારવા માટે નીચેના નિયમો કરે છે:-

૧. (૧) આ નિયમો ગુજરાત માલ અને સેવા વેરા (તૃતીય સુધારા) નિયમો, ૨૦૨૦ કહેવાશે.
(૨) આ નિયમોમાં અન્યથા જોગવાઈ કરી હોય તે સિવાય, તે સન ૨૦૨૦ના માર્ચ મહિનાની ૨૩મી તારીખથી અમલમાં આવશે.
૨. ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭માં (જેનો આમાં હવે પછી, સદરહુ નિયમો તરીકે ઉલ્લેખ કર્યો છે તેમાં), નિયમ ૮માં, પેટા-નિયમ (૪) પછી, નીચેનો પેટા-નિયમ દાખલ કરવો:-
““(૪ક) સન ૨૦૨૦ના એપ્રિલ મહિનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ, અરજદારે, પેટા-નિયમ (૪) હેઠળ અરજી રજૂ કરતી વખતે, રજિસ્ટ્રેશનની પરવાનગી માટે આધાર નંબરનું પ્રમાણીકરણ કરાવવું જોઈશે.”.
૩. સન ૨૦૨૦ના એપ્રિલ મહિનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ, સદરહુ નિયમોમાં, નિયમ-૯-માં, પેટા-નિયમ (૧)માં, નીચેનો પરંતુક દાખલ કરવો:-
“પરંતુ કલમ ૨૫ની પેટા-કલમ (૬ઘ) હેઠળ જાહેર કરવામાં આવી હોય તે સિવાયની વ્યક્તિ, નિયમ ૮ના પેટા-નિયમ (૪ક)માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે આધાર નંબરનું પ્રમાણીકરણ કરવામાં નિષ્ફળ થાય ત્યારે, નિયમ ૨૫ હેઠળ જોગવાઈ કરેલી રીતે, અરજીની તારીખથી સાંઠ દિવસની અંદર, સદરહુ વ્યક્તિની હાજરીમાં ધંધાના મુખ્ય સ્થળની પ્રત્યક્ષ ખરાઈ કર્યા પછી રજિસ્ટ્રેશનની પરવાનગી આપવામાં આવશે અને આવા કિસ્સાઓમાં પેટા-નિયમ (૫)ની જોગવાઈઓ લાગુ પડશે નહિ.”.
૪. સદરહુ નિયમોમાં, નિયમ ૨૫ને બદલે, નીચેનો નિયમ મૂકવો:-
“અમુક કિસ્સામાં ધંધાના સ્થળની પ્રત્યક્ષ ખરાઈ- રજિસ્ટ્રેશનની પરવાનગી આપ્યા પહેલા આધાર પ્રમાણીકરણની નિષ્ફળતાને લીધે અથવા રજિસ્ટ્રેશનની પરવાનગી આપ્યા પછી કોઈ અન્ય કારણને લીધે, વ્યક્તિના ધંધાના સ્થળની પ્રત્યક્ષ ખરાઈ જરૂરી છે તેવી યોગ્ય અધિકારીને ખાતરી થાય ત્યારે, તે સદરહુ વ્યક્તિની હાજરીમાં ધંધાના સ્થળની આવી ખરાઈ કરી શકે છે અને ફોટોગ્રાફ સહિતના અન્ય દસ્તાવેજો સાથેનો ખરાઈ અહેવાલ, આવી ખરાઈની તારીખ પછીના પંદર કામકાજના દિવસોની મુદતની અંદર કોમન પોર્ટલ પર નમૂના જીએસટી આરઈજી-૩૦માં અપલોડ કરવો જોઈશે.
૫. સન ૨૦૨૦ના એપ્રિલ મહિનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ, સદરહુ નિયમોમાં, નિયમ ૪૩માં પેટા-નિયમ (૧)માં,
(ક) ખંડ (ગ)ને બદલે, નીચેનો ખંડ મૂકવો:-

(ગ) ખંડ (ક) અને (ખ) હેઠળ, સમાવેશ થયો ન હોય તેવા મૂડીગત માલના સંદર્ભમાં 'A' તરીકે દર્શાવેલી ઈનપુટ વેરા શાખની રકમ ભરતિયામાં દર્શાવેલ વેરાની રકમને લીધે ઇલેક્ટ્રોનિક જમા ખાતાવહીમાં જમા કરવામાં આવશે અને આવા માલની ઉપયોગી અવધિ, આવા માલ માટેના ભરતિયાની તારીખથી પાંચ વર્ષની મુદત સુધીની ગણાશે:-

પરંતુ અગાઉ ખંડ (ક) આવરી લેવાયેલ કોઈ મૂડીગત માલનો, ત્યાર પછીથી આ ખંડ હેઠળ સમાવેશ થયેલો હોય, ત્યારે, ખંડ (ક)થી આવરે લીધેલ 'Tie' તરીકે દર્શાવેલ આવા મૂડીગત માલની મુદત સુધીમાં મળવાપાત્ર અપાત્ર શાખની ગણતરી, દરેક ત્રિમાસ અથવા તેના ભાગ દીઠ પાંચ ટકાના પોઈન્ટના દરથી કરવી જોઈશે અને આવી શાખનો દાવો કરવામાં આવ્યો હોય તે વેરા મુદતમાંથી ઉત્પાદન (આઉટપુટ) વેરા જવાબદારીમાં ઉમેરવી જોઈશે. તે શરતને આધીન 'A' તરીકે દર્શાવેલ આવા મૂડીગત માલના સંબંધમાં ઈનપુટ વેરો ઇલેક્ટ્રોનિક જમા ખાતાવહીમાં જમા થશે:

વધુમાં કેન્દ્રીય વેરા, રાજ્ય વેરા, સંઘ રાજ્યક્ષેત્ર વેરા અને સંકલિત વેરાની ઈનપુટ વેરા શાખ માટેની રકમ 'Tie' અલગ રીતે ગણવામાં આવશે અને નમૂના જીએસટીઆર-૩બ-માં જાહેર કરવામાં આવશે.

સ્પષ્ટીકરણ.-(માલ) મળ્યેથી ખંડ (ક) હેઠળ જાહેર કરેલી મૂડીગત માલની ચીજવસ્તુનો, આ ખંડ હેઠળ પાછળથી સમાવેશ કર્યો હોય, તો કલમ ૧૮ની પેટા-કલમ (જ)ની જોગવાઈઓ લાગુ પડશે નહિ.”

(ખ) ખંડ (ઘ)ને બદલે, નીચેનો ખંડ મૂકવો:-

“વેરા મુદતમાં જેની ઉપયોગી અવધિ બાકી રહેતી હોય તેવા સામાન્ય મૂડીગત માલના સંદર્ભમાં, ખંડ (ગ) હેઠળ ઇલેક્ટ્રોનિક જમા ખાતાવહીમાં જમા કરેલી 'A' રકમની એકંદર કિંમત 'Tc' તરીકે દર્શાવવાની રહેશે જે આવા મુડીગત માલના સંદર્ભમાં સામાન્ય શાખ રહેશે:

વધુમાં, જ્યાં અગાઉ કોઈ પણ મૂડીગત માલ ખંડ (ખ) હેઠળ આવરી લેવામાં આવેલ હોય અને ત્યારબાદ ખંડ (ગ) હેઠળ આવરી લેવામાં આવેલ હોય, ત્યારે આવી મૂડીગત માલના સંદર્ભમાં દાવો કરાયેલ ઈનપુટ વેરા શાખને એકંદર મૂલ્ય 'Tc' પર પહોંચવા માટે ઉમેરવામાં આવશે”;

(ગ) ખંડ (ચ)માં, નીચેનું સ્પષ્ટીકરણ દાખલ કરવું:-

“સ્પષ્ટીકરણ. - શંકાને દૂર કરવા માટે, તે સ્પષ્ટ કરવામાં આવે છે કે, કોઈપણ મૂડીગત માલનું ઉપયોગી આયુષ્ય ભરતિયાની તારીખથી પાંચ વર્ષ તરીકે ગણવામાં આવશે અને સદરહુ સૂત્ર, સદરહુ મૂડીગત માલના ઉપયોગી આયુષ્ય દરમિયાન લાગુ રહેશે.”;

(ઘ) ખંડ (છ) રદ્દ કરવો.

૬. સદરહુ નિયમોમાં, નિયમ ૮૦ માં, પેટા-નિયમ (૩)માં, નીચેનો પરંતુક દાખલ કરવો:-

“પરંતુ, નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯ દરમિયાન જેનું ટર્નઓવર પાંચ કરોડ રૂપિયા કરતા વધી જાય તેવી દરેક રજિસ્ટર થયેલી વ્યક્તિએ, કલમ ૩૫-ની પેટા-કલમ (૫) હેઠળ નિર્દિષ્ટ કર્યા મુજબ તેના હિસાબોનું ઓડિટ કરાવવું જોઈશે અને તેણે પ્રત્યક્ષ રીતે કોમન પોર્ટલ મારફત અથવા કમિશનર દ્વારા જાહેર કરેલા સુવિધા કેન્દ્ર મારફત નમૂના જીએસટીઆર-૯-ગ-માં, યોગ્ય રીતે પ્રમાણિત કરેલા, ઓડિટ થયેલા વાર્ષિક હિસાબો અને મેળપત્રકની નકલ, ઇલેક્ટ્રોનિક રીતે રજૂ કરવી જોઈશે.”.

૭. સદરહુ નિયમોમાં, નિયમ ૮૬માં, પેટા-નિયમ (જ) પછી, નીચેનો પેટા-નિયમ દાખલ કરવો:-

“(જક) જ્યાં રજિસ્ટર થયેલી વ્યક્તિએ, કરવેરા તરીકે ખોટી રીતે ચૂકવેલ અથવા વધુ ચૂકવણી કરેલ રકમ કે જે ઇલેક્ટ્રોનિક શાખ ખાતાવહીમાંથી ઉઘારેલ હોય, તેના રિફંડનો દાવો કર્યો હોય તો, સદરહુ રકમ, જો સ્વીકાર્ય હોય તો, નમૂના જીએસટી પીએમટી-૦૩માં કરવામાં આવેલ હુકમથી યોગ્ય અધિકારી દ્વારા ઇલેક્ટ્રોનિક શાખ ખાતાવહીમાં ફરીથી જમા કરવી જોઈશે.”.

૮. સદરહુ નિયમોમાં, નિયમ ૮૯માં, પેટા-નિયમ (જ)માં, ખંડ (ગ)ને બદલે, નીચેનો ખંડ મૂકવો:-

“(ગ) “માલના શૂન્ય દરના પુરવઠાનું ટર્નઓવર” એટલે બોન્ડ અથવા બાંધઘરી પત્ર હેઠળ વેરાની ચૂકવણી કર્યા સિવાય સંબંધિત મુદ્દત દરમિયાન કરેલા માલના શૂન્ય દરના પુરવઠાની કિંમત અથવા પુરવઠાના ટર્નઓવર સિવાય, જે સંદર્ભે પેટા-કલમ (જક) અથવા (જખ) અથવા બંને હેઠળ રિફંડ માટે દાવો કરવામાં આવેલ હોય તે સિવાય, પુરવઠાકાર દ્વારા આપવામાં આવેલ માલ જેવા ઘરેલુ માલ અથવા તે જ રીતે મૂકાયેલ, પુરવઠાકાર દ્વારા જાહેર કરાયેલ સમાન માલના મૂલ્યના ૧.૫ ગણું મૂલ્ય, બેમાંથી જે ઓછું હોય તે;”.

૯. સદરહુ નિયમોમાં, નિયમ ૯૨માં,-

(ક) પેટા-નિયમ (૧) પછી, નીચેનો પેટા-નિયમ દાખલ કરવો:-

“(૧ક) જ્યાં, શૂન્ય દરના પુરવઠા અથવા માનવામાં આવેલ નિકાસ ઉપર ચૂકવેલ વેરાના રિફંડ સિવાય વેરા તરીકે ચૂકવેલ કોઈ રકમની રિફંડની અરજીની ચકાસણી થયેથી, યોગ્ય અધિકારીને ખાતરી થાય કે કલમ ૫૪ની પેટા-કલમ (૫) હેઠળ રિફંડ ચૂકવવાપાત્ર છે અને અરજદારને ચૂકવવાપાત્ર છે, તો સંબંધિત સમયગાળા માટે, વેરા જવાબદારીની મુક્તિ માટે ચૂકવેલ કુલ રકમની સામે રોકડમાં ઉધારેલ રકમના, પ્રમાણસર રોકડમાં, રિફંડની રકમની ચૂકવણીની મંજૂરી આપતો હુકમ નમૂના આરએફડી-૦૬માં કરવો જોઈશે, જેમાં આ અધિનિયમ હેઠળ અથવા કોઈ વિધમાન કાયદા હેઠળ કોઈ બાકી નીકળતી માગણી સામે સમાયોજિત કરેલી રકમ અને રિફંડપાત્ર બાકી રકમનો ઉલ્લેખ કરવો જોઈશે અને આવા વેરાની ચૂકવણી માટે ઇલેક્ટ્રોનિક શાખ ખાતાવહીમાંથી ઉધારેલ બાકી રકમ માટે, સદરહુ રકમ ઇનપુટ વેરા શાખ તરીકે ઇલેક્ટ્રોનિક શાખ ખાતાવહીમાં ફરી જમા કરવા નમૂનો જીએસટી પીએમટી-૦૩ જારી કરવો જોઈશે.”;

(ખ) પેટા-નિયમ (જ) માં, “પેટા-નિયમ (૧) હેઠળ રિફંડપાત્ર રકમ” એ શબ્દો, કૌંસ અને આંકડા પછી, “અથવા પેટા-નિયમ(૧ક)” એ શબ્દો, કૌંસ, આંકડા અને દાખલ કરવા ;

(ગ) પેટા-નિયમ (૫) માં, “પેટા-નિયમ (૧) હેઠળ રિફંડપાત્ર રકમ” એ શબ્દો, કૌંસ અને આંકડા પછી, “અથવા પેટા-નિયમ(૧ક)” એ શબ્દો, કૌંસ, આંકડા અને દાખલ કરવા ;

૧૦. સદરહુ નિયમોમાં, નિયમ ૯૬માં, પેટા-નિયમ (૧૦)માં, સન ૨૦૧૭ના ઓક્ટોબર મહિનાની ૨૩મી તારીખથી અમલી ખંડ (ખ)માં, નીચેનું સ્પષ્ટીકરણ દાખલ કરવું,-

સ્પષ્ટીકરણ”.- આ પેટાનિયમના હેતુ માટે, તેમાં જણાવેલ જાહેરનામાનો લાભ ફક્ત ત્યારે જ લીધેલો ગણાશે નહીં કે જ્યાં રજિસ્ટર થયેલ વ્યક્તિએ ઇનપુટ પર સંકલિત માલ અને સેવા વેરો અને વળતરનો સેસ ચૂકવ્યો હોય અને તેણે જાહેરનામાઓ હેઠળ માત્ર મૂળભૂત સીમા શુલ્કમાંથી મુક્તિ મેળવી હોય.”.

૧૧. સદરહુ નિયમોમાં, નિયમ ૯૬ક પછી, નીચેનો નિયમ દાખલ કરવો:-

“૯૬ખ. વણવપરાયેલ ઇનપુટ વેરા શાખ અથવા નિકાસ ઊપજો વસૂલ ન થયેલ હોય ત્યારે માલની નિકાસ પર ચૂકવેલ સંકલિત વેરાના રિફંડની વસૂલાત.- (૧) માલની નિકાસને કારણે વણવપરાયેલ ઇનપુટ વેરા શાખનું અથવા માલની નિકાસ પર ચૂકવેલ સંકલિત વેરાનું કોઈપણ રિફંડ અરજદારને ચૂકવેલ હોય, પરંતુ વિદેશી ઠૂંકિયામણ વ્યવસ્થાપન અધિનિયમ, ૧૯૯૯ (સન ૧૯૯૯નો જર-મા) હેઠળ પરવાનગી આપેલ મુદતની અંદર, તેવી મુદતના કોઈપણ વિસ્તરણ સહિત, ભારતમાં તેવા નિકાસના માલના વેચાણની ઊપજોનું પૂર્ણતઃ અથવા આંશિક ઊપજ વસૂલ થયેલ ન હોય ત્યારે વેચાણની ખરેખર ઊપજ ન થાય ત્યાં સુધીની, આમ રિફંડ જેને આપવામાં આવેલ હોય તે વ્યક્તિએ, સદરહુ મુદતની સમાપ્તિથી ત્રીસ દિવસની અંદર અથવા ચથાપ્રસંગ, લંબાવેલ મુદતની અંદર, લાગુ પડતા વ્યાજ સાથે આપેલા રિફંડની રકમ જમા કરાવવાની રહેશે, તેમાં ચૂક થયેથી, રિફંડ કરેલ રકમ, અધિનિયમની કલમ ૭૩ અથવા ચથાપ્રસંગ, કલમ ૭૪ની જોગવાઈઓ અનુસાર, કલમ ૫૦ હેઠળ વ્યાજ સાથે ભૂલભરેલ રિફંડની વસૂલાત માટે લાગુ પડતી હોય તેમ વસૂલાત કરવાની રહેશે.

પરંતુ વિદેશી હૂંડિયામણ વ્યવસ્થાપન અધિનિયમ, ૧૯૯૯ (સન ૧૯૯૯ના જર-મા) હેઠળ અરજદારે તેવા નિકાસના માલના સંબંધમાં વેચાણની ઊપજ અથવા તેના કોઈ ભાગની ખરેખર વસૂલાત કરેલ નથી, પણ ભારતીય રિઝર્વ બેંક પાત્રતાના આધારે વેચાણની ઊપજની વસૂલાતની જરૂરિયાતને રદ કરે, ત્યારે અરજદારને ચૂકવેલ રિફંડ વસૂલ કરવી જોઈશે નહિ.

- (૨) પેટા-નિયમ (૧) હેઠળ તેની પાસેથી રિફંડની રકમ વસૂલ કર્યા પછી, અરજદાર દ્વારા વેચાણની ઊપજોની પૂર્ણતઃ અથવા આંશિક ખરેખર વસૂલ કરેલ હોય અને વેચાણની ઊપજોની વસૂલાતની તારીખથી ત્રણ મહિનાની મુદતની અંદર તેવી વસૂલાત અંગે પુરાવો રજૂ કરેલ હોય, ત્યારે, ભારતીય રિઝર્વ બેંકે પરવાનગી આપ્યા મુજબની તેવી લંબાવેલ મુદતની અંદર વેચાણની ઊપજોની વસૂલાત થયેલ હોય એ શરતને આધીન, ખરેખર વેચાણની ઊપજોની વસૂલાત સુધી, એવી રીતે વસૂલ કરેલ રકમ, યોગ્ય અધિકારી દ્વારા અરજદારને રિફંડ કરવામાં આવશે.”
૧૨. સદરહુ નિયમોમાં, નિયમ ૧૪૧માં, પેટા-નિયમ (૨)માં, “કમિશનર” એ શબ્દને બદલે, “યોગ્ય અધિકારી” એ શબ્દ મૂકવો.
૧૩. સદરહુ નિયમોમાં, નમૂના જીએસટી આરએફડી-૦૧માં, નિયમ ૮૯(૨) (જ) હેઠળના એકરાર પછી, નીચેનો એકરાર દાખલ કરવો:-

“બાંધઘરી”

હું આથી જીએસટી નિયમો, ૨૦૧૭ના નિયમ ૯૬૫ સાથે વાંચતા આઈજીએસટી અધિનિયમ, ૨૦૧૭ના નિયમ ૧૬ના પરંતુક મુજબ વિદેશી હૂંડિયામણના ભરણાં ન મળવાના કિસ્સામાં, વ્યાજ સાથે મંજૂર કરેલ રિફંડની રકમ સરકારમાં જમા કરાવવા બાંધઘરી આપું છું.

સહી-

નામ-

હોદ્દો “પદ/

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

કે. આર. રાઠવા,

સરકારના ઉપ સચિવ.



સત્યમેવ જયતે

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII | FRIDAY, FEBRUARY 19, 2021 / MAGHA 30, 1942

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
સચિવાલય, ગાંધીનગર, ૧૨મી ફેબ્રુઆરી, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૨૧મી નવેમ્બર, ૨૦૨૦ના સરકારી જાહેરનામા ક્રમાંક: (જાએચએન-૧૧૦)જાએસટી-૨૦૨૦/ એસ.૧૪૮(૩૬)ઠ.- નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

Notification**Under****The Gujarat Goods and Services Tax Act, 2017.****ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ હેઠળ****જાહેરનામું.****નાણા વિભાગ**

સચિવાલય, ગાંધીનગર, ૨૧મી નવેમ્બર, ૨૦૨૦.

જાહેરનામું ક્રમાંક. ૮૫/૨૦૨૦-રાજ્ય વેરો**ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.**

ક્રમાંક. (જીએચએન-૧૧૦)જીએસટી-૨૦૨૦/એસ.૧૪૮(૩૬)ઃ- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા) (જેનો આમાં હવે પછી, "સદરહુ અધિનિયમ" તરીકે ઉલ્લેખ કર્યો છે તે)ની કલમ ૩૮ની પેટા-કલમ (૭) સાથે વાંચતા કલમ ૧૪૮થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોને આધારે, આથી, જેમણે દરેક ત્રિમાસ અથવા તેના ભાગ માટે પત્રક રજૂ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હોય તેવી, સદરહુ અધિનિયમની કલમ ૩૮ની પેટા-કલમ (૧)ના પરંતુક હેઠળ જાહેર કરેલી, રજિસ્ટર થયેલી વ્યક્તિઓને, એવા વ્યક્તિઓના વર્ગ તરીકે જાહેર કરે છે કે જેઓ પ્રથમ મહિનામાં અથવા દ્વિતીય મહિનામાં અથવા ત્રિમાસના બંને મહિનામાં એવી ખાસ કાર્યરીતિ અનુસરી શકશે કે સદરહુ વ્યક્તિઓ, -

- (૧) ત્રિમાસિક પત્રક રજૂ કરવાનું હોય, ત્યારે અગાઉના ત્રિમાસ માટે, પત્રકમાં ઇલેક્ટ્રોનિક રોકડ ખાતાવહી ઉધારીને ચૂકવેલી વેરા જવાબદારીના ૩૫ ટકા રકમ; અથવા
- (૨) માસિક પત્રક રજૂ કરવાનું હોય, ત્યારે તરત પહેલાંના ત્રિમાસના છેલ્લા મહિના માટે, પત્રકમાં ઇલેક્ટ્રોનિક રોકડ ખાતાવહી ઉધારીને ચૂકવેલી વેરા જવાબદારીની રકમ:

-જેટલી રકમ રોકડ ખાતાવહીમાં જમા કરાવીને, સદરહુ અધિનિયમની કલમ ૩૮ની પેટા-કલમ (૭)ના પરંતુક હેઠળ ચૂકવવાપાત્ર વેરો ચૂકવી શકે:

પરંતુ-

- (ક) ઇલેક્ટ્રોનિક રોકડ ખાતાવહી અથવા ઇલેક્ટ્રોનિક જમા ખાતાવહીમાંની સિલક, સદરહુ મહિના માટેની વેરા જવાબદારી માટે પર્યાપ્ત હોય, ત્યારે અથવા વેરા જવાબદારી શૂન્ય હોય, ત્યારે ત્રિમાસના પ્રથમ મહિના માટે; અથવા
- (ખ) ઇલેક્ટ્રોનિક રોકડ ખાતાવહી અથવા ઇલેક્ટ્રોનિક જમા ખાતાવહીમાંની સિલક, ત્રિમાસના પ્રથમ અને દ્વિતીય મહિના માટેની સંચિત વેરા જવાબદારી માટે પર્યાપ્ત હોય, ત્યારે અથવા વેરા જવાબદારી શૂન્ય હોય, ત્યારે ત્રિમાસના દ્વિતીય મહિના માટે,

આવી કોઈ રકમ જમા કરાવવાની રહેશે નહિ:

વધુમાં, રજિસ્ટર થયેલી વ્યક્તિએ આવા મહિના પહેલાંની સંપૂર્ણ વેરા મુદત માટે પત્રક રજૂ કર્યું હોય તે સિવાય, તે (વ્યક્તિ), સદરહુ ખાસ કાર્યરીતિ માટે પાત્ર ગણાશે નહિ.

સ્પષ્ટીકરણ. - આ જાહેરનામાના હેતુ માટે, "સંપૂર્ણ વેરા મુદત" એ શબ્દપ્રયોગ એટલે જેમાં વેરા મુદતના પ્રથમ દિવસથી વેરા મુદતના અંતિમ દિવસ સુધી વ્યક્તિ રજિસ્ટર થયેલી હોય તે વેરા મુદત.

૨. આ જાહેરનામું સન ૨૦૨૧ના જાન્યુઆરી મહિનાની ૧-લી તારીખથી અમલમાં આવ્યું હોવાનું ગણાશે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,

સરકારના નાયબ સચિવ.

Extra No. 164



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

FRIDAY, JULY 9, 2021 / ASADHA 18, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૯મી જુલાઈ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૨૧મી નવેમ્બર, ૨૦૨૦ના જાહેરનામા ક્રમાંક: (જાએચએન-૧૧૧) જાએસટીઆર-૨૦૨૦/એસ.૧૬૪(૬૬)૬- નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

Notification**Regarding****Amendment to the Gujarat Goods and Services Tax Rules, 2017.**

ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ સુધારવા સંબંધી

જાહેરનામું

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૧મી નવેમ્બર, ૨૦૨૦

જાહેરનામું ક્રમાંક: ૮૨/૨૦૨૦-રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

(જીએસટીઆર-૨૦૨૦/ એસ.૧૬૪(૬૬)ઠ.)- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા)ની કલમ ૧૬૪થી મળેલી સત્તાની રૂએ, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોને આધારે, ગુજરાત સરકાર, આથી, ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭, વધુ સુધારવા નીચેના નિયમો કરે છે:-

૧. ટૂંકી સંજ્ઞા અને આરંભ:

(૧) આ નિયમો ગુજરાત માલ અને સેવા વેરા (તેરમા સુધારા) નિયમો, ૨૦૨૦ કહેવાશે.

(૨) આ નિયમોમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય, તે સન ૨૦૨૦ના નવેમ્બર મહિનાની ૧૦મી તારીખે અમલમાં આવ્યું હોવાનું ગણાશે.

૨. ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ (જેનો હવે પછી, આ જાહેરનામામાં “સદરહુ નિયમો” તરીકે ઉલ્લેખ કર્યો છે તે)માં, નિયમ ૫૮ને બદલે, સન ૨૦૨૧ના જાન્યુઆરી મહિનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ, નીચેનો નિયમ મૂકવો:-

“૫૮. જાવક પુરવઠાની વિગતો રજૂ કરવાનો નમૂનો અને રીત.- (૧) સંકલિત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ૧૩મા)ની કલમ ૧૪માં ઉલ્લેખેલ હોય તે સિવાયની દરેક રજિસ્ટર થયેલી વ્યક્તિએ, કલમ ૩૭ હેઠળ ફરમાવ્યા પ્રમાણે, મહિના અથવા યથાપ્રસંગ, ત્રિમાસ માટે માલ અથવા સેવા અથવા તે બંનેના જાવક પુરવઠાની વિગતો, કોમન પોર્ટલ મારફત પ્રત્યક્ષ રીતે અથવા કમિશનર જાહેર કરે તેવા સુવિધા કેન્દ્ર મારફત ઇલેક્ટ્રોનિક સ્વરૂપે આવી વિગતો નમૂના જીએસટીઆર-૧માં પૂરી પાડવી જોઈશે.

(૨) કલમ ૫૮ની પેટા-કલમ (૧)ના પરંતુક હેઠળ દરેક ત્રિમાસ માટે પત્રક રજૂ કરવાનું ફરમાવવામાં આવ્યું હોય તેવી રજિસ્ટર થયેલ વ્યક્તિઓ, રજિસ્ટર થયેલ વ્યક્તિને કરેલ માલ અથવા સેવા અથવા બંનેના એવા જાવક પુરવઠાની વિગતો, પોતે જરૂરી ગણે તેમ, દરેક મહિનામાં પચાસ લાખ રૂપિયાના એકંદર મૂલ્ય સુધી, ત્રિમાસના પહેલાં અને બીજા મહિના માટે, તેવા મહિનાના તરત પછીના મહિનાની ૧લી તારીખથી સદરહુ મહિનાના ૧૩મી તારીખ સુધી, નિયમ ૨૬ હેઠળ ઠરાવેલી રીતે યોગ્ય રીતે ખરાઈ કરીને કોમન પોર્ટલ પર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ભરતિયા રજૂ કરવાની સગવડ(ઇનવોઇસ ફર્નિશિંગ કેસિલિટી) (જેનો હવે પછી, આ જાહેરનામામાં “આઈએફએફ” તરીકે ઉલ્લેખ કર્યો છે તે)નો ઉપયોગ કરીને પૂરી પાડી શકશે.

(૩) ત્રિમાસના પહેલાં અને બીજા મહિના માટે, આઈએફએફનો ઉપયોગ કરીને પૂરી પાડેલી જાવક પુરવઠાની વિગતો, સદરહુ ત્રિમાસ માટે નમૂના જીએસટીઆર-૧માં પૂરી પાડવાની રહેશે નહિ.

(૪) નમૂના જીએસટીઆર-૧માં પૂરી પાડેલી માલ અથવા સેવા અથવા તે બંનેના જાવક પુરવઠાની વિગતોમાં નીચેનાનો સમાવેશ થશે-

(ક) (૧) રજિસ્ટર થયેલી વ્યક્તિઓને કરેલા તમામ આંતરરાજ્ય અથવા રાજ્યાંતર્ગત પુરવઠાની ભરતિયા દીઠ વિગતો; અને

(૨) રજિસ્ટર થયેલી ન હોય તેવી વ્યક્તિઓને અઢી લાખથી વધારે કિંમતના ભરતિયા સાથે કરેલા તમામ આંતરરાજ્ય પુરવઠાની ભરતિયા દીઠ વિગતો;

(ખ) (૧) વેરાના દરેક દર માટે રજિસ્ટર થયેલી ન હોય તેવી વ્યક્તિઓને કરેલા રાજ્યાંતર્ગત પુરવઠાની એકંદર વિગતો; અને

(૨) વેરાના દરેક દર માટે રજિસ્ટર થયેલી ન હોય તેવી વ્યક્તિઓએ અઢી લાખથી વધારે કિંમતના ભરતિયાની સાથે કરેલા રાજ્ય દીઠ આંતરરાજ્ય પુરવઠાની એકંદર વિગતો;

(ગ) અગાઉના મહિના દરમિયાન કાઢી આપેલ ભરતિયા માટેની જમા અને ઉધાર નોંધ, જો કોઈ હોય તો તેની વિગતો.

(૫) આઈએફએફનો ઉપયોગ કરીને માલ અથવા સેવા અથવા તે બંનેના પૂરા પાડેલા જાવક પુરવઠાની વિગતોમાં-

(ક) રજિસ્ટર થયેલી વ્યક્તિઓને કરેલા આંતરરાજ્ય અને રાજ્યાંતર્ગત પુરવઠાની ભરતિયા દીઠ વિગતો;

(ખ) અગાઉના મહિના દરમિયાન કાઢી આપેલ ભરતિયા માટેની જમા અને ઉધાર નોંધ, જો કોઈ હોય તો તેની વિગતો; નો સમાવેશ થશે.”

૩. સદરહુ નિયમોમાં, નિયમ ૬૦ના બદલે, સન ૨૦૨૧ના જાન્યુઆરી મહિનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ, નીચેનો નિયમ મૂકવો:-
- “૬૦. આવક પુરવઠાની વિગતોની ખાતરી કરતો નમૂનો અને રીત.- (૧) નમૂનો જીએસટીઆર-૧માં અથવા આઈએફએફનો ઉપયોગ કરીને પુરવઠાકાર દ્વારા રજૂ કરેલા જાવક પુરવઠાની વિગતો, રજિસ્ટર થયેલી સંબંધિત વ્યક્તિઓ(મેળવનાર)ને નમૂના જીએસટીઆર-૨-કના ભાગ ક-માં, યથાપ્રસંગ, નમૂના જીએસટીઆર-૪ક-માં અને નમૂના જીએસટીઆર-૬ક-માં કોમન પોર્ટલ મારફતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉપલબ્ધ કરાવવી જોઈશે.
- (૨) બિન-નિવાસી વેરાપાત્ર વ્યક્તિએ, તેના પત્રકમાં નિયમ ૬૩ હેઠળ નમૂના જીએસટીઆર-૫માં પૂરી પાડેલી ભરતિયાની વિગતો, શાખ મેળવનારને નમૂના જીએસટીઆર-૨ક ના ભાગ ક-માં કોમન પોર્ટલ મારફતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉપલબ્ધ કરાવવી જોઈશે.
- (૩) ઈનપુટ સેવા વિતરક દ્વારા તેના પત્રકમાં નિયમ ૬૫ હેઠળ નમૂના જીએસટીઆર-૬માં પૂરી પાડેલી ભરતિયાની વિગતો, શાખ મેળવનારને, નમૂના જીએસટીઆર-૨ક ના ભાગ ખ-માં કોમન પોર્ટલ મારફતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉપલબ્ધ કરાવવી જોઈશે.
- (૪) નમૂના જીએસટીઆર-૭માં કલમ ૩૮ની પેટા-કલમ (૩) હેઠળ કપાત કરનાર દ્વારા પૂરી પાડેલી મૂળ સ્થાને વેરા કપાતની વિગતો, કપાત કરાવનારને, નમૂના જીએસટીઆર-૨ક ના ભાગ ગ-માં કોમન પોર્ટલ મારફતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉપલબ્ધ કરાવવી જોઈશે.
- (૫) નમૂના જીએસટીઆર-૮માં કલમ ૫૨ હેઠળ, ઈ-કોમર્સ ઓપરેટર દ્વારા પૂરા પાડેલી, મૂળ સ્થાને કપાત કરેલા વેરાની વિગતો, સંબંધિત વ્યક્તિને નમૂના જીએસટીઆર-૨ક ના ભાગ ગ-માં કોમન પોર્ટલ મારફતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉપલબ્ધ કરાવવી જોઈશે.
- (૬) માલની આયાત પર અથવા ખાસ આર્થિક ઝોન એકમ અથવા ખાસ આર્થિક ઝોન વિકાસકાર પાસેથી બિલ ઓફ એન્ટ્રી પર ઘરેલું ટેરિફ વિસ્તાર(ડોમેસ્ટિક ટેરિફ એરિયા)માં લાવેલ માલ પર ચુકવેલ સંકલિત વેરાની વિગતો, નમૂના જીએસટીઆર-૨ક ના ભાગ ઘ-માં કોમન પોર્ટલ મારફતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉપલબ્ધ કરાવવી જોઈશે.
- (૭) ઈનપુટ વેરા શાખનો સમાવેશ કરતું ઓટો-ગ્રાફ્ટેડ પત્રક, રજિસ્ટર થયેલી વ્યક્તિને નમૂના જીએસટીઆર-૨-ખ માં, દરેક મહિના માટે, કોમન પોર્ટલ મારફતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ઉપલબ્ધ કરાવવું જોઈશે અને તેમાં-
- (૧) અગાઉના મહિના માટે નમૂના જીએસટીઆર-૧ પૂરી પાડવાની નિયત તારીખ પછીના તરતના દિવસથી, મહિના માટે નમૂના જીએસટીઆર-૧ પૂરી પાડવાની નિયત તારીખ વચ્ચે, નમૂના જીએસટીઆર-૧માં, કલમ ૩૮ની પેટા-કલમ ૧ના પરંતુક હેઠળ દરેક ત્રિમાસ માટે પત્રક પૂરું પાડવાનું જરૂરી હોય તેવા પુરવઠાકાર સિવાયના પુરવઠાકાર દ્વારા પૂરા પાડેલા જાવક પુરવઠાની વિગતો;
- (૨) (ક) ત્રિમાસના પહેલા મહિના માટે, અગાઉના ત્રિમાસ માટે નમૂના જીએસટીઆર-૧ રજૂ કરવાની નિયત તારીખ પછીના તરતના દિવસથી, ત્રિમાસના પહેલાં મહિના માટે આઈએફએફનો ઉપયોગ કરીને વિગતો પૂરી પાડવાની નિયત તારીખ વચ્ચે;
- (ખ) ત્રિમાસના બીજા મહિના માટે, ત્રિમાસના પહેલા મહિના માટે આઈએફએફનો ઉપયોગ કરીને વિગતો પૂરી પાડવાની નિયત તારીખ પછીના તરતના દિવસથી, ત્રિમાસના બીજા મહિના માટે આઈએફએફનો ઉપયોગ કરીને વિગતો પૂરી પાડવાની નિયત તારીખ વચ્ચે;
- (ગ) ત્રિમાસના ત્રીજા મહિના માટે, ત્રિમાસના બીજા મહિના માટે આઈએફએફનો ઉપયોગ કરીને વિગતો પૂરી પાડવાની નિયત તારીખ પછીના તરતના દિવસથી ત્રિમાસ માટે નમૂના જીએસટીઆર-૧ રજૂ કરવાની નિયત તારીખ વચ્ચે,
- નમૂના જીએસટીઆર-૧માં અથવા યથાપ્રસંગ, આઈએફએફનો ઉપયોગ કરીને, કલમ ૩૮ની પેટા-કલમ (૧)ના પરંતુક હેઠળ દરેક ત્રિમાસ માટે પત્રક પૂરી પાડવાની જરૂરી હોય તેવા બિન-નિવાસી વેરાપાત્ર વ્યક્તિએ નમૂના જીએસટીઆર-૫ માં પૂરી પાડેલા ભરતિયાની વિગતો અને ઈનપુટ સેવા વિતરકે નમૂના જીએસટીઆર-૬માં તેના પત્રકમાં પૂરી પાડેલ ભરતિયાની વિગતો અને તેના પુરવઠાકાર દ્વારા પૂરા પાડેલા જાવક પુરવઠાની વિગતો;
- (૩) બિલ ઓફ એન્ટ્રી પર મહિનામાં માલની આયાત પર અથવા ખાસ આર્થિક ઝોન એકમ અથવા ખાસ આર્થિક ઝોન વિકાસકાર પાસેથી ઘરેલું ટેરિફ વિસ્તાર(ડોમેસ્ટિક ટેરિફ એરિયા)માં લાવેલ માલ પર ચુકવેલ સંકલિત વેરાની વિગતો;
-નો સમાવેશ થશે.
- (૮) (૧) ત્રિમાસના પહેલા અને બીજા મહિના માટે, કલમ ૩૮ની પેટા-કલમ (૧)ના પરંતુક હેઠળ દરેક ત્રિમાસ માટેના પત્રક રજૂ કરવાના જરૂરી હોય તેવી રજિસ્ટર થયેલી વ્યક્તિએ, આઈએફએફમાં સદરહુ મહિના માટે જાવક પુરવઠાની વિગતો રજૂ કરવાની નિયત તારીખ પછીના દિવસમાં, અથવા કલમ ૩૮ની પેટા-કલમ (૧)ના પરંતુક હેઠળ દરેક ત્રિમાસ માટેના પત્રક રજૂ કરવાના જરૂરી હોય તે સિવાયની રજિસ્ટર થયેલી વ્યક્તિએ નમૂના જીએસટીઆર-૧માં, એમાંથી જે પણ મોડું હોય તેમાં;
- (૨) ત્રિમાસના ત્રીજા મહિનામાં, કલમ ૩૮ની પેટા-કલમ (૧)ના પરંતુક હેઠળ દરેક ત્રિમાસ માટેના પત્રક રજૂ કરવાના જરૂરી હોય તેવી રજિસ્ટર થયેલી વ્યક્તિએ, નમૂના જીએસટીઆર-૧માં, સદરહુ મહિના માટે જાવક પુરવઠાની વિગતો રજૂ કરવાની નિયત તારીખ પછીના દિવસમાં
- રજિસ્ટર થયેલી વ્યક્તિને દરેક મહિના માટેનું પત્રક નમૂના જીએસટીઆર-૨-ખ માં ઉપલબ્ધ કરાવવું જોઈશે.
૪. સદરહુ નિયમોમાં, નિયમ ૬૧માં, પેટા-નિયમ (૫) પછી, નીચેનો પેટા-નિયમ દાખલ કરવો:-
- “(૬) સંકલિત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ૧૩મા) ની કલમ ૧૪માં ઉલ્લેખેલ વ્યક્તિ સિવાયની રજિસ્ટર થયેલી દરેક વ્યક્તિએ અથવા ઈનપુટ સેવા વિતરકે અથવા બિન-નિવાસી વેરાપાત્ર વ્યક્તિએ, તેવી વેરા મુદત પછીના

મહિનાના વીસમા દિવસે અથવા તે પહેલાં, કલમ ૧૦ અથવા કલમ ૫૧ અથવા યથાપ્રસંગ, કલમ ૫૨ હેઠળ વેરો ચૂકવતી વ્યક્તિએ કોમન પોર્ટલ ખાતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે નમૂના જીએસટીઆર-૩બ-માં પ્રત્યક્ષ રીતે અથવા કમિશનર જાહેર કરે તેવા સુવિધા કેન્દ્ર મારફત પત્રક પૂરું પાડવું જોઈશે:

પરંતુ અગાઉના નાણાકીય વર્ષમાં પાંચ કરોડ રૂપિયા સુધીનું એકંદર ટર્નઓવર ધરાવતા હોય, જેઓનું ધંધાનું મુખ્ય સ્થળ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, કેરાલા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશના રાજ્યો, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુ અથવા લક્ષદીપના સંઘ રાજ્યક્ષેત્રોમાં હોય તેવા વેરા ચૂકવનારાઓએ, ઓક્ટોબર, ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ સુધીના મહિનાઓ માટે સદરહુ નિયમોના નમૂના જીએસટીઆર-૩બ-માં તેવા મહિના પછીના મહિનાના બાવીસમાં દિવસે અથવા તે પહેલાં, કોમન પોર્ટલ મારફતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પત્રક રજૂ કરવું જોઈશે:

વધુમાં અગાઉના નાણાકીય વર્ષમાં પાંચ કરોડ રૂપિયા સુધીનું એકંદર ટર્નઓવર ધરાવતા હોય, જેઓનું ધંધાનું મુખ્ય સ્થળ હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અથવા ઓડિશાના રાજ્યો, જમ્મુ અને કશ્મીર, લદાખ, ચંડીગઢ અથવા દિલ્હીના સંઘ રાજ્યક્ષેત્રોમાં હોય તેવા વેરા ચૂકવનારાઓએ, ઓક્ટોબર, ૨૦૨૦થી માર્ચ, ૨૦૨૧ સુધીના મહિનાઓ માટે સદરહુ નિયમોના નમૂના જીએસટીઆર-૩બ-માં તેવા મહિના પછીના મહિનાના ચોવીસમાં દિવસે અથવા તે પહેલાં, કોમન પોર્ટલ મારફતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પત્રક રજૂ કરવું જોઈશે.

૫. સદરહુ નિયમોમાં, નિયમ ૬૧ને બદલે, સન ૨૦૨૧ના જાન્યુઆરી મહિનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ, નીચેનો નિયમ મૂકવો:-
- “૬૧. પત્રકની રજૂઆતનો નમૂનો અને રીત.- (૧) સંકલિત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ૧૩મા)ની કલમ ૧૪માં ઉલ્લેખેલ હોય તે સિવાયની દરેક રજિસ્ટર થયેલી વ્યક્તિએ અથવા ઈનપુટ સેવા વિતરક અથવા બિન-નિવાસી વેરાપાત્ર વ્યક્તિએ અથવા કલમ ૧૦ અથવા કલમ ૫૧ હેઠળ અથવા યથાપ્રસંગ, કલમ ૫૨ હેઠળ વેરો ભરતી વ્યક્તિએ,-
- (૧) દરેક મહિના અથવા તેના ભાગ માટે કલમ ૩૯ની પેટા-કલમ (૧) હેઠળ નિર્દિષ્ટ કર્યા મુજબ તેવા મહિના પછીના મહિનાના વીસમા દિવસે અથવા તે પહેલાં:
- (૨) દરેક ત્રિમાસ અથવા તેના ભાગ માટે, કલમ ૩૯ની પેટા-કલમ (૧)ના પરંતુક હેઠળ નિર્દિષ્ટ કર્યા મુજબ, નીચે આપેલા કોષ્ટકની કોલમ ૨-માં ઉલ્લેખ કરેલી રજિસ્ટર થયેલી વ્યક્તિઓના વર્ગ માટે, સદરહુ કોષ્ટકની કોલમ (૩)માંની તત્સમાન નોંધમાં ઉલ્લેખ કરેલ તારીખે અથવા તે પહેલાં:-

કોષ્ટક

ક્રમાંક	રજિસ્ટર થયેલી વ્યક્તિઓનો વર્ગ	નિયત તારીખ
(૧)	(૨)	(૩)
૧.	જેઓનું ધંધાનું મુખ્ય સ્થળ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, કેરાલા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશના રાજ્યો, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુ અથવા લક્ષદીપના સંઘ રાજ્યક્ષેત્રોમાં હોય તેવી રજિસ્ટર થયેલી વ્યક્તિઓ.	તેવા ત્રિમાસ પછીના મહિનાનો બાવીસમો દિવસ
૨.	જેઓનું ધંધાનું મુખ્ય સ્થળ હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અથવા ઓડિશાના રાજ્યો, જમ્મુ અને કશ્મીર, લદાખ, ચંડીગઢ અથવા દિલ્હીના સંઘ રાજ્યક્ષેત્રોમાં હોય તેવી રજિસ્ટર થયેલી વ્યક્તિઓ.	તેવા ત્રિમાસ પછીના મહિનાનો ચોવીસમો દિવસ

- કોમન પોર્ટલ મારફત, પ્રત્યક્ષ રીતે અથવા કમિશનર જાહેર કરે તેવા સુવિધા કેન્દ્ર મારફતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે આવી વિગતો નમૂના જીએસટીઆર-૩બ-માં પત્રક રજૂ કરવાનું રહેશે.
- (૨) પેટા-નિયમ (૧) હેઠળ, પત્રક પૂરું પાડવાનું જરૂરી હોય તેવી રજિસ્ટર થયેલી વ્યક્તિએ, કલમ ૪૯ની જોગવાઈઓને અધીન, અધિનિયમ અથવા આ પ્રકરણની જોગવાઈઓ હેઠળ, ઇલેક્ટ્રોનિક રોકડ ખાતાવહી અથવા ઇલેક્ટ્રોનિક જમા ખાતાવહીને ઉધારીને ચૂકવવાપાત્ર વેરો, વ્યાજ, દંડ, ફી અથવા અન્ય રકમની ચૂકવણી કરવાની રહેશે અને નમૂના જીએસટીઆર-૩બ-માં તેવી વિગતોનો સમાવેશ કરવાનો રહેશે.
- (૩) દરેક ત્રિમાસ માટે, પત્રક પૂરું પાડવાનું જરૂરી હોય તેવી દરેક રજિસ્ટર થયેલી વ્યક્તિએ, પેટા-નિયમ (૧)ના ખંડ (૨) હેઠળ, ત્રિમાસના પહેલા દરેક બે મહિના માટે, નમૂના જીએસટી પીએમટી-૦૬માં સદરહુ રકમ જમા કરાવીને, કલમ ૩૯ની પેટા-કલમ (૭)ના પરંતુક હેઠળ બાકી વેરો, તેવા મહિના પછીના મહિનાના પચીસમા દિવસ સુધી ચૂકવવાના રહેશે.

પરંતુ કમિશનર, કાઉન્સિલની ભલામણ પર, જાહેરનામાથી, તેમાં નિર્દિષ્ટ કરેલી વેરાપાત્ર વ્યક્તિઓના તેવા વર્ગ માટે, નમૂના જીએસટી પીએમટી- ૦૬-માં સદરહુ રકમ જમા કરવવાની નિયત તારીખ લંબાવી શકશે:

વધુમાં, કેન્દ્રીય વેરા કમિશનરે જાહેર કરેલો સમય મર્યાદાનો કોઈ વધારો, કમિશનરે જાહેર કર્યો હોવાનું ગણાશે:

વળી, નમૂના જીએસટી પીએમટી- ૦૬-માં રકમ જમા કરાવતી વખતે આવી રજિસ્ટર થયેલી વ્યક્તિ-

- (ક) ત્રિમાસના પ્રથમ મહિના માટે, ઇલેક્ટ્રોનિક રોકડ ખાતાવાહીમાંની સિલકને ધ્યાને લઈ શકશે;
- (ખ) ત્રિમાસના દ્વિતીય મહિના માટે, પ્રથમ મહિનાના ચૂકવવાના થતા વેરાને બાકાત રાખીને ઇલેક્ટ્રોનિક રોકડ ખાતાવાહીમાંની સિલકને ધ્યાને લઈ શકશે.
- (ઝ) ઉપર્યુક્ત પેટા-નિયમ (૩) હેઠળ રજિસ્ટર થયેલી વ્યક્તિએ જમા કરેલી રકમ, નમૂના જીએસટીઆર-૩બ-માં સદરહુ ત્રિમાસ માટે પત્રક રજૂ કરતી વખતે ઉધાર રાખવી જોઈશે અને તેવી રીતે જમા કરાવેલી રકમમાંથી ઇલેક્ટ્રોનિક રોકડ ખાતાવાહીમાંની સિલકમાં તેવી રકમ, કંઈ હોય, તો તેના રિકંડનો કોઈ દાવો, સદરહુ ત્રિમાસ માટે નમૂના જીએસટી-૩બ-માં પત્રક રજૂ કર્યા પછી જ મંજૂર કરવો જોઈશે. “
૬. સદરહુ નિયમોમાં, નિયમ ૬૧ પછી, નીચેનો નિયમ દાખલ કરવો:-
- “૬૧ ક. ત્રિમાસિક પત્રક રજૂ કરવા માટે વિકલ્પ પસંદ કરવાની રીત.- (૧) કલમ ૩૮ની પેટા-કલમ (૧) ના પરંતુક હેઠળ ત્રિમાસિક ધોરણે પત્રક રજૂ કરવા માંગતી રજિસ્ટર થયેલી દરેક વ્યક્તિએ, આ સંબંધમાં જાહેર કરેલી શરતો અને નિયંત્રણો અનુસાર, ત્રિમાસિકના ધોરણે પત્રક રજૂ કરવા માટેની પોતાની પસંદગી, ઇલેક્ટ્રોનિક રીતે, કોમન પોર્ટલ પર, અગાઉના ત્રિમાસના બીજા મહિનાના ૧લા દિવસથી જે ત્રિમાસ માટે વિકલ્પ આપ્યો હોય તેના પ્રથમ મહિનાના છેલ્લા દિવસ સુધીમાં દર્શાવવી જોઈશે :
- પરંતુ આવો વિકલ્પ એક વાર લેવામાં આવે, તો સદરહુ રજિસ્ટર થયેલી વ્યક્તિએ ભવિષ્યની વેરાની મુદતો માટે ત્રિમાસિક ધોરણે પત્રક રજૂ કરવાનું ચાલુ રાખવાનું રહેશે, સિવાય કે સદરહુ રજિસ્ટર થયેલી વ્યક્તિ,-
- (ક) આ સંબંધમાં જાહેર કરેલી શરતો અને નિયંત્રણો મુજબ ત્રિમાસિક ધોરણે પત્રક રજૂ કરવા માટે પાત્ર ન હોય; અથવા
- (ખ) માસિક ધોરણે ઇલેક્ટ્રોનિક રીતે, કોમન પોર્ટલ પર પત્રક રજૂ કરવાનો વિકલ્પ પસંદ કરે :
- વધુમાં, રજિસ્ટર થયેલી વ્યક્તિએ, આવો વિકલ્પ પસંદ કરવાની તારીખે છેલ્લું રજૂ કરવાનું બાકી હોય તેવું પત્રક રજૂ કર્યું ન હોય, તેવા કિસ્સામાં તે ત્રિમાસિક ધોરણે પત્રક રજૂ કરવાનો વિકલ્પ લેવા માટે પાત્ર થશે નહિ.
- (૨) ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જેનું કુલ ટર્નઓવર ૫ કરોડ કરતા વધારે હોય, તેવી રજિસ્ટર થયેલી વ્યક્તિએ, ઇલેક્ટ્રોનિક રીતે, કોમન પોર્ટલ પર, જે દરમિયાન તેનું કુલ ટર્નઓવર ૫ કરોડ કરતા વધી જતું હોય, તે ત્રિમાસ પછીના ત્રિમાસના પ્રથમ મહિનાથી માસિક ધોરણે પત્રક રજૂ કરવાનો વિકલ્પ પસંદ કરવો જોઈશે.
૭. સદરહુ નિયમોમાં, નિયમ ૬૨-માં,
- (૧) પેટા-નિયમ (૧)માં, “અથવા નાણા વિભાગના તારીખ : ૭મી માર્ચ, ૨૦૧૯ના સરકારી જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૨૨) જીએસટી-૨૦૧૯/ એસ. ૧૧ (૧) (૪૨) -૬, જાહેરનામા ક્રમાંક. ૦૨ /૨૦૧૯- રાજ્ય વેરો (૬૨) નો લાભ લઈને વેરો ભરીને” એ શબ્દો, આંકડા, શબ્દો અને કૌંસ કમી કરવા;
- (૨) પેટા-નિયમ (૪)માં, “અથવા નાણા વિભાગના તારીખ : ૭મી માર્ચ, ૨૦૧૯ના સરકારી જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૨૨) જીએસટી-૨૦૧૯/ એસ. ૧૧ (૧) (૪૨) -૬, જાહેરનામા ક્રમાંક. ૦૨ /૨૦૧૯- રાજ્ય વેરો (૬૨) નો લાભ લઈને” એ શબ્દો, આંકડા, શબ્દો અને કૌંસ કમી કરવા;
- (૩) પેટા-નિયમ (૪) ના સ્પષ્ટીકરણમાં, “અથવા નાણા વિભાગના તારીખ : ૭મી માર્ચ, ૨૦૧૯ના સરકારી જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૨૨) જીએસટી-૨૦૧૯/ એસ. ૧૧ (૧) (૪૨) -૬, જાહેરનામા ક્રમાંક. ૦૨ /૨૦૧૯- રાજ્ય વેરો (૬૨) નો લાભ લઈને વેરો ભરવાનો વિકલ્પ લઈને” એ શબ્દો, આંકડા, શબ્દો અને કૌંસ કમી કરવા;
- (૪) પેટા-નિયમ (૬) કમી કરવો.
૮. નમૂનો જીએસટીઆર-૧ માં, સૂચનામાં, અનુક્રમાંક ૧૭ પછી, નીચેની સૂચના દાખલ કરવી:-
- “૧૮. સદરહુ નિયમોના નિયમ ૪૬ ના પરંતુક હેઠળ વખતોવખત પ્રસિદ્ધ કરવા જાહેરનામામાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે, રજિસ્ટર થયેલી વ્યક્તિઓના વર્ગને તેમ કરવા ફરમાવેલ હોય તેવા માલ અથવા સેવા માટેના એચએસએન(HSN) કોડના આંકડાની સંખ્યા નિર્દિષ્ટ કરવી ફરજિયાત રહેશે.”
૯. નમૂનો- ૨-ક પછી, નીચેનો નમૂનો દાખલ કરવો:-
- “ નમૂનો- ૨-ખ
- [જુઓ નિયમ ૬૦ (૭)] ઓટો- ડ્રાફ્ટેડ આઈટીસી (ITC) પત્રક
- (નમૂનો જીએસટીઆર-૧, જીએસટીઆર-૫, જીએસટીઆર-૬-માંથી અને આઈસીઈજીએટીઈ (ICEGATE)-માંથી મળેલી આયાતની માહિતી (ડેટા))

વર્ષ	YYYY-YY
મહિનો	

૧. જીએસટીઆઈએન	
૨(ક). રજિસ્ટર થયેલી વ્યક્તિનું કાનૂની નામ	
૨(ખ). વેપારનું નામ, કંઈ હોય તો	
૨(ગ). શરૂ કર્યાની તારીખ	DD/MM/YYYY HH:MM

૩. ઉપલબ્ધ આઈટીસી (ITC) અંગે ટૂંકી નોંધ (તમામ સેક્શન (ભાગ)માં રકમ રૂપિયામાં)

અનુક્રમાંક	શીર્ષક	જીએસટીઆર-૩બ કોષ્ટક	સંકલિત વેરો ()	કેન્દ્રીય વેરો	રાજ્ય/યુટી વેરો ()	ઉપકર	માર્ગદર્શન
નમૂનો જીએસટીઆર-૩બ હેઠળ મેળવેલી શાખ							
ભાગ ક	ઉપલબ્ધ આઈટીસી (ITC) - જીએસટીઆર-૩બ-માં સંબંધિત શીર્ષકમાં શાખનો દાવો કરી શકશે						
૧	બીજી તમામ આઈટીસી (ITC) - રિવર્સ ચાર્જ સિવાયનો રજિસ્ટર થયેલી વ્યક્તિનો પુરવઠો	૪ (ક) (૫)					હકારાત્મક હોય, તો નમૂના જીએસટીઆર-૩બ-ના કોષ્ટક ૪(ક)(૫) હેઠળ શાખ મેળવી શકશે. નકારાત્મક હોય, તો નમૂના જીએસટીઆર-૩બ-ના કોષ્ટક ૪(ક)(૫) હેઠળ શાખ રિવર્સ કરી શકશે.
વિગતો	B2B- ભરતિયું						
	B2B- ઉધારપત્રો (ઉધારનોંધ)						
	B2B- ભરતિયું (સુધારો)						
	B2B- ઉધારપત્રો (સુધારો)						
૨	આઈએસડી (ISD) મારફત ઇનવર્ડ પુરવઠો	૪ (ક) (૪)					હકારાત્મક હોય, તો નમૂના જીએસટીઆર-૩બ-ના કોષ્ટક ૪(ક)(૪) હેઠળ શાખ મેળવી શકશે. નકારાત્મક હોય, તો નમૂના જીએસટીઆર-૩બ-ના કોષ્ટક ૪(ક)(૫) હેઠળ શાખ રિવર્સ કરી શકશે.
વિગતો	આઈએસડી (ISD)- ભરતિયું						
	આઈએસડી (ISD)- ભરતિયું (સુધારો)						
૩	રિવર્સ ચાર્જ માટે પાત્ર ઇનવર્ડ(આવક) પુરવઠો	૩.૧ (ઘ) ૪ (ક) (૩)					વેરાની ચુકવણી માટે આ પુરવઠો નમૂનો જીએસટીઆર-૩બ-ના કોષ્ટક ૩.૧(ઘ)-માં જાહેર કરવો જોઈશે. શાખ, વેરાની ચુકવણી કર્યેથી, નમૂનો જીએસટીઆર-૩બ-ના કોષ્ટક ૪(ક)(૩) હેઠળ મેળવી શકશે.
વિગતો	B2B- ભરતિયું						
	B2B- ઉધારપત્રો						
	B2B- ભરતિયું (સુધારો)						
	B2B- ઉધારપત્રો (સુધારો)						
૪	માલની આયાત	૪ (ક) (૧)					હકારાત્મક હોય, તો નમૂના જીએસટીઆર-૩બ-ના કોષ્ટક ૪(ક)(૧) હેઠળ શાખ મેળવી શકશે. નકારાત્મક હોય, તો નમૂના જીએસટીઆર-૩બ-ના કોષ્ટક ૪(ખ)(૨) હેઠળ શાખ રિવર્સ કરી શકશે.

અનુક્રમાંક	શીર્ષક	જીએસટીઆર- -૩બ કોષ્ટક	સંકલિત વેરો ()	કેન્દ્રીય વેરો	રાજ્ય/ યુટી વેરો ()	ઉપકર	માર્ગદર્શન
વિગતો	આઈએમપીજી(IMPG)- વિદેશથી માલની આયાત						
	આઈએમપીજી(IMPG) (સુધારો)						
	આઈએમજીએસઈઝેડ(IMGSE Z)- સેઝ(SEZ)માંથી માલની આયાત						
	આઈએમજીએસઈઝેડ(IMGSE Z) (સુધારો)						
ભાગ ખ	આઈટીસી (ITC) રિવર્સલ -જીએસટીઆર-૩બ-માં સંબંધિત શીર્ષકમાં શાખ રિવર્સ કરવી જોઈશે						
૧	અન્ય	૪(ખ) (૨)					હકારાત્મક હોય, તો નમૂના જીએસટીઆર-૩બ-ના કોષ્ટક ૪(ખ)(૨) હેઠળ શાખ મેળવી શકશે. નકારાત્મક હોય, તો અગાઉના ઉદાહરણ મુજબ તેને રિવર્સ કરવાને અધીન રહીને, શાખ માટે ફરી દાવો કરી શકશે.
વિગતો	B2B- જમાપત્ર (નોંધ)						
	B2B- જમાપત્ર (નોંધ) (સુધારો)						
વિગતો	બી ટુ બી - જમા નોંધો (વિપરીત ચાર્જ)						
	બી ટુ બી - જમા નોંધો (વિપરીત ચાર્જ) (સુધારો)						
	આઈએસડી - જમા નોંધો						
	આઈએસડી - જમા નોંધો (સુધારો)						

૪. બિન-ઉપલભ્ય આઈટીસી-નો સારાંશ

(બધા ભાગોમાં રકમ રૂપિયામાં)

અનુક્રમાંક	શીર્ષક	જીએસટીઆર- ૩બ કોષ્ટક	સંકલિત વેરો (રૂપિયા)	કેન્દ્રીય વેરો (રૂપિયા)	રાજ્ય / સંઘરાજ્ય ક્ષેત્ર વેરો (રૂપિયા)	ઉપકર (રૂપિયા)	એડવાઈઝરી (સૂચના)
નમૂનો જીએસટીઆર-૩બ હેઠળ લાભ લઈ ન શકાય તે શાખ							
ભાગ ક	બિન-ઉપલભ્ય આઈટીસી						
૧	વિપરીત ચાર્જ સિવાયના રજિસ્ટર થયેલી વ્યક્તિ પાસેથી બીજી તમામ આઈટીસી - પુરવઠા	એનએ					આવી શાખ, નમૂનો જીએસટીઆર- ૩બમાં લેવામાં આવશે નહિ
વિગતો	બી ટુ બી - ભરતિયા						
	બી ટુ બી - ઉધાર નોંધો						
	બી ટુ બી - ભરતિયા (સુધારો)						
	બી ટુ બી - ઉધાર નોંધો (સુધારો)						

અનુક્રમાંક	શીર્ષક	જીએસટીઆર- ઉપ કોષ્ટક	સંકલિત વેરો (રૂપિયા)	કેન્દ્રીય વેરો (રૂપિયા)	રાજ્ય / સંઘરાજ્ય ક્ષેત્ર વેરો (રૂપિયા)	ઉપકર (રૂપિયા)	એડવાઈઝરી (સૂચના)
૨	આઈએસડી તરફથી આવક પુરવઠા	એનએ					આવી શાખ, નમૂનો જીએસટીઆર- ઉપમાં લેવામાં આવશે નહિ
વિગતો	આઈએસડી - ભરતિયા આઈએસડી સુધારો - ભરતિયા						
૩	વિપરીત ચાર્જ માટે પાત્ર આવક પુરવઠા	૩.૧(ઘ)					આ પુરવઠા, નમૂનો-ઉપ-ના કોષ્ટક ૩.૧(ઘ)માં વેરાની ચુકવણી માટે જાહેર કરવા જોઈશે. તેમ છતાં, તેના પર શાખ ઉપલબ્ધ થશે નહિ.
વિગતો	બી ટુ બી - પુરવઠા બી ટુ બી - ઉધાર નોંધો બી ટુ બી - ભરતિયા (સુધારો) બી ટુ બી - ઉધાર નોંધો (સુધારો)						
ભાગ ખ ૧	આઈટીસી-નો ઊલટક્રમ અન્ય	૪(ખ)(૨)					નમૂનો જીએસટીઆર- ઉપના કોષ્ટક ૪(ખ)(૨) હેઠળ શાખ ઊલટાવવી જોઈશે.
વિગતો	બી ટુ બી - જમા નોંધો બી ટુ બી - જમા નોંધો (સુધારો) બી ટુ બી - જમા નોંધો (વિપરીત ચાર્જ) બી ટુ બી - જમા નોંધો (વિપરીત ચાર્જ) (સુધારો) આઈએસડી - જમા નોંધો આઈએસડી - જમા નોંધો (સુધારો)						

સૂચનો:

૧. વપરાયેલા શબ્દો :-
 - ક. આઈટીસી - ઇનપુટ વેરા શાખ
 - ખ. બીટુબી - બિઝનેસ ટુ બિઝનેસ
 - ગ. આઈએસડી - ઇનપુટ સેવા વિતરક
 - ઘ. આઈએમપીજી - માલની આયાત
 - ચ. આઈએમપીજીએસઈઝેડ - એસઈઝેડ (SEZ) તરફથી આયાત કરેલ માલ

૨. અગત્યની એડવાઈઝરી (સૂચના):

ક) નમૂનો જીએસટીઆર-૨ખ નિવેદન છે જે તમારા પુરવઠાકાર દ્વારા તેમના સંબંધિત નમૂનો જીએસટીઆર-૧, ૫ અને ૬માં પૂરી પાડવામાં આવેલી માહિતીના આધારે જનરેટ કરવામાં આવે છે. આ સ્થાયી નિવેદન છે અને તે મહિનામાં એકવાર જ ઉપલબ્ધ થશે. કોઈ જીએસટીઆર-૧, ૫ અને ૬માં પુરવઠાકાર દ્વારા રજૂ કરવામાં આવેલ દસ્તાવેજો, પુરવઠાકારની રજૂ કરવાની તારીખને લક્ષમાં લીધા વિના મેળવનારના પછીના ખુલ્લા નમૂના જીએસટીઆર-૨ખ માં પ્રદર્શિત થશે. વેરો ચૂકવનારાને નમૂનો જીએસટીઆર-૩ખ-માં શાખ મેળવવા માટે, નમૂનો જીએસટીઆર-૨ ખ જોવાની સલાહ અપાવામાં આવે છે. તેમ છતાં, વધારાની વિગતોના કિસ્સામાં, તેઓ તેમના સંબંધિત નમૂનો જીએસટીઆર-૨ક (જે નજીકના વાસ્તવિક સમયના આધારે અદ્યતન કરેલું હોય છે) તેનો વધુ વિગતો માટે સંદર્ભ લઈ શકે છે.

ખ) ઈનપુટ વેરા શાખને નીચેના સંદર્ભમાં બિન-ઉપલબ્ધ તરીકે દર્શાવી શકાશે:-

૧. ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૧૬ની પેટા-કલમ (ઠ)ની જોગવાઈઓ મુજબ, મેળવનાર ઈનપુટ વેરા શાખને પાત્ર ન હોય ત્યારે માલ અથવા સેવા અથવા બંનેના પુરવઠા માટેનું ભરતિયું અથવા ઉધાર નોંધ.

૨. મેળવનાર બીજા રાજ્યમાં હોય અને પુરવઠાકાર (જીએસટીઆઈએન) અને પુરવઠાની જગ્યા એક જ રાજ્યમાં હોય ત્યારે ભરતિયું અથવા ઉધાર નોંધ.

તેમ છતાં, બીજા એવા સંદર્ભો હોઈ શકે છે જેના માટે વેરો ચૂકવનારાને ઈનપુટ વેરા શાખ ઉપલબ્ધ થઈ શકશે નહિ અને તે સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવી નથી.

વેરો ચૂકવનારાએ સ્વ-આકારણી કરવી જોઈશે અને આવી શાખ તેમના નમૂના જીએસટીઆર-૩ખ-માં ઊલટાવવી જોઈશે.

૩. નમૂનો જીએસટીઆર-૨ખ-માં, તમારા પુરવઠાકાર દ્વારા, સામાન્ય રીતે બે અનુવર્તી જીએસટીઆર-૧ અથવા આઈએફએફએસ રજૂ કરવાની નિયત તારીખોની વચ્ચે ફાઈલ કરવામાં આવતા, તત્સમાન પુરવઠાકાર દ્વારા રજૂ કરવા માટે પસંદ કરવામાં આવેલા (માસિક અથવા ત્રિમાસિક) વિકલ્પના આધારે, તમામ નમૂના જીએસટીઆર-૧એસ, ૫-એસ અને ૬એસ-નો સમાવેશ થશે તેની નોંધ લઈ શકાશે. જે તારીખો માટેની સુસંગત માહિતી મેળવવામાં આવી છે તે જીએસટી નિયમોમાં નિર્દિષ્ટ કરવામાં આવી છે અને ઓનલાઈન પોર્ટલ પર “વ્યૂ એડવાઈઝરી” હેઠળ પણ ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, ફેબ્રુઆરી મહિના માટે નમૂના જીએસટીઆર-૨-ખ-માં પુરવઠાકારો દ્વારા રજૂ કરવામાં આવતા તમામ દસ્તાવેજોનો સમાવેશ થશે કે જે તેમનો નમૂનો જીએસટીઆર-૧ દર મહિને ૧૨-મી ફેબ્રુઆરીના રોજ ૦૦:૦૦ કલાકથી ૧૧મી માર્ચના રોજ ૨૩:૫૯ કલાક સુધી રજૂ કરવાનું પસંદ કરે છે.
૪. તેમાં ખાસ આર્થિક ક્ષેત્રોના એકમો / વિકાસકારો તરફથી આયાત કરેલા ડેટા સહિત આઈસગેટ સિસ્ટમ તરફથી આયાત કરેલા માલની વિગતો પણ સમાવિષ્ટ છે.
૫. આયાત કરેલી સેવા પરની વિપરીત ચાર્જ શાખ આ નિવેદનનો ભાગ નથી અને નમૂનો જીએસટીઆર-૩ખ-ના કોષ્ટક ૪(ક)(૨)માં વેરો ચૂકવનારા દ્વારા દાખલ થવાની ચાલુ રહેશે તેની નોંધ લઈ શકાશે.
૬. કોષ્ટક ૩, નમૂનો જીએસટીઆર-૨ ખ જનરેટ કર્યાની તારીખે ઉપલબ્ધ આઈટીસી-નો સારાંશ ધરાવે છે. તે નીચેની રીતે બે ભાગોમાં વહેંચેલી છે:
 - ક. ભાગ ક, નમૂનો જીએસટીઆર-૩ખ ના સુસંગત કોષ્ટકમાં મેળવી શકાય તેવી શાખનો સારાંશ ધરાવે છે.
 - ખ. ભાગ ખ, નમૂનો જીએસટીઆર-૩ખ ના સુસંગત કોષ્ટકમાં ઊલટાવવી જોઈશે તેવી શાખનો સારાંશ ધરાવે છે.
૭. કોષ્ટક ૪ એ આઈટીસીનો સારાંશ દર્શાવે છે કે જે નમૂનો જીએસટીઆર-૨-ખ જનરેટ થયાની તારીખે ઉપલબ્ધ નથી, આ કોષ્ટકમાં ઉપલબ્ધ શાખ, નમૂનો જીએસટીઆર-૩ખ-માં શાખ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે નહિ. તેમ છતાં, વિપરીત ચાર્જના આધારે વેરો ચૂકવવાની જવાબદારી અને જમા નોંધની પ્રાપ્તિ પર શાખ ઊલટાવવાની જવાબદારી આવા પુરવઠા માટે ચાલુ રહે છે.
૮. વેરા ચૂકવનારાને સુનિશ્ચિત કરવાની સલાહ અપાવામાં આવે છે કે નમૂનો જીએસટીઆર -૨- ખ-માં જનરેટ કરવામાં આવેલા ડેટાને, તેમના પોતાના રેકોર્ડ્સ અને હિસાબોના ચોપડા સાથે સુસંગત બનાવવામાં આવેલ છે. વેરો ચૂકવનારા ખાતરી કરશે કે-
 - ક. કોઈપણ સંજોગોમાં કોઈ દસ્તાવેજ માટે બે વાર કોઈપણ શાખ લેવામાં આવશે નહિ.
 - ખ. શાખ જ્યાં જરૂરી હોય ત્યાં ઊલટાવવી જોઈશે.
 - ગ. વિપરીત ચાર્જના આધારે વેરો ચૂકવવામાં આવશે.
૯. ભરતિયા જમા નોંધ, ઉધાર નોંધ, આઈએસડી ભરતિયા, આઈએસડી શાખ અને ઉધાર નોંધ, નોંધનું બિલ વગેરેની વિગતો, ઓનલાઈન અને ડાઉનલોડ સુવિધા દ્વારા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
૧૦. એવા સંજોગો હોઈ શકે છે કે જ્યાં વેરા દરના લાગુ પડતા દરની ટકાવારીને, સરકાર જાહેર કરી શકશે. આવા દર લાગુ પડતા હોય ત્યાં ભરતિયા / દસ્તાવેજો માટે એક અલગ કોલમ પૂરી પાડવામાં આવશે.

૧૧. કોષ્ટક મુજબની સૂચનાઓ:

કોષ્ટક અનુક્રમાંક અને મથાળું	સૂચના
કોષ્ટક ૩ ભાગ ૬ વિભાગ ૧ અન્ય તમામ આઈટીસી - વિપરીત ચાર્જ સિવાય રજિસ્ટર થયેલી વ્યક્તિઓ પાસેથી પુરવઠો	૧. આ વિભાગમાં (તે વિપરીત ચાર્જના આધારે જેના પર વેરો ચૂકવવાનો છે તે સિવાય), પુરવઠાની વિગતોનો સમાવેશ થાય છે, જે તમારા પુરવઠાકારો દ્વારા તેમના નમૂના જીએસટીઆર -૧ અને ૫ માં જાહેર કરવામાં આવી છે અને ફાઇલ કરવામાં આવી છે. ૨. આ કોષ્ટક ફક્ત પુરવઠા દર્શાવે છે કે જેના પર ઈનપુટ વેરા શાખ ઉપલબ્ધ છે. ૩. ખ-૨-ખ ભરતિયા અને ખ-૨-ખ ઉધાર નોંધમાં સુધારાને લીધે નકારાત્મક શાખ, જો કોઈ હોય તો તે ઊભી થઈ શકે છે. આવી શાખ, નમૂના જીએસટીઆર -૩ખ ના કોષ્ટક ૪ (ખ) (૨) માં ઊલટાવવામાં આવશે.
કોષ્ટક ૩ ભાગ ૬ વિભાગ ૨ આઈએસડીમાંથી આવક પુરવઠા	૧. આ વિભાગમાં પુરવઠાકારોની વિગતોનો સમાવેશ થાય છે, જે ઈનપુટ સેવા વિતરક દ્વારા તેમના નમૂના જીએસટીઆર - ૬માં જાહેર અને ફાઇલ કરવામાં આવી છે. ૨. આ કોષ્ટક ફક્ત પુરવઠા દર્શાવે છે કે જેના પર આઈટીસી ઉપલબ્ધ છે. ૩. આઈએસડી સુધારા - ભરતિયામાં સુધારાને કારણે નકારાત્મક શાખ, જો કોઈ હોય તો તે ઊભી થઈ શકે છે. આવી શાખ, નમૂના જીએસટીઆર - ૩ખ ના કોષ્ટક ૪(ખ)(૨) માં ઊલટાવવામાં આવશે.
કોષ્ટક ૩ ભાગ ૬ વિભાગ ૩ વિપરીત ચાર્જ માટે જવાબદાર આવક પુરવઠા	૧. આ વિભાગમાં વિપરીત ચાર્જના આધારે જેના પર વેરો ચૂકવવાનો છે તે પુરવઠાની વિગતોનો સમાવેશ થાય છે, જે તમારા પુરવઠાકારો દ્વારા તેમના નમૂના જીએસટીઆર-૧માં જાહેર અને ફાઇલ કરવામાં આવ્યા છે. ૨. આ કોષ્ટક ફક્ત પુરવઠા પૂરા પાડે છે કે જેના પર આઈટીસી ઉપલબ્ધ છે. ૩. આ પુરવઠા વેરાની ચુકવણી માટે નમૂના જીએસટીઆર-૩ખના કોષ્ટક ૩.૧(ઘ) માં જાહેર કરવામાં આવશે. વેરાની ચુકવણી પર નમૂના જીએસટીઆર -૩ખ ના કોષ્ટક ૪(ક)(૩) હેઠળ શાખ મેળવી શકાશે.
કોષ્ટક ૩ ભાગ ૬ વિભાગ ૪ માલની આયાત	૧. આ વિભાગ દરિયાપાર અને SEZ એકમો / વિકાસકર્તાઓ પાસેથી પ્રવેશના બિલ પર અને તેના સુધારા પર માલની આયાત પર તમારા દ્વારા ચૂકવેલ આઈજીએસટી ની વિગતો પૂરી પાડે છે. આ વિગતો આઈસીઈજીએટી(આઈસગેટ) સિસ્ટમમાંથી નજીકના વાસ્તવિક સમયના આધારે અપડેટ કરવામાં આવે છે. ૨. આ કોષ્ટકમાં જે મહિના માટે નમૂનો જીએસટીઆર-૨ખ માટે જનરેટ કરવામાં આવી રહ્યો છે તે મહિનામાં તમારા દ્વારા(જીએસટીઆઈએન) કરવામાં આવેલા આયાત પરના ડેટાનો સમાવેશ થશે. ૩. આઈસગેટ સંદર્ભ તારીખ એ તારીખ છે કે જ્યાંથી પ્રાપ્તકર્તા ઈનપુટ વેરા શાખ મેળવવા માટે પાત્ર છે. ૪. કોષ્ટક જો પ્રવેશ બિલ(પત્ર) સુધારવામાં આવ્યું હોય, તો તે પણ પૂરું પાડે છે. ૫. આઈસગેટમાંથી પ્રાપ્ત ડેટાના આધારે કોષ્ટકોમાં માહિતી પૂરી પાડવામાં આવે છે. અમુક આયાત જેવી કે કુરિયર આયાત પરની માહિતી ઉપલબ્ધ હોઈ શકે નહિ.
કોષ્ટક ૩ ભાગ ૫ વિભાગ ૧ અન્ય	૧. આ વિભાગ પ્રાપ્ત જમા નોંધ અને તેમાં સુધારાની વિગતો સામેલ કરે છે જે તમારા પુરવઠાકારો દ્વારા તેમના નમૂના જીએસટીઆર -૧ અને ૫ માં જાહેર અને ફાઇલ કરવામાં આવી છે. ૨. આવી શાખ નમૂના જીએસટીઆર -૩ ખ-ના કોષ્ટક ૪ (ખ) (૨) હેઠળ ઊલટાવવામાં આવશે. જો આ મૂલ્ય નકારાત્મક હોય, તો પછી શાખ અગાઉના દાખલા પર તેને ઊલટાવવાને અધીન રહીને, પાછી મેળવી શકાશે.
કોષ્ટક ૪ ભાગ ૬ વિભાગ ૧ અન્ય તમામ આઈટીસી - વિપરીત ચાર્જ સિવાય રજિસ્ટર થયેલી વ્યક્તિઓ પાસેથી પુરવઠો	૧. આ વિભાગમાં (તેના વિપરીત ચાર્જના આધારે જેના પર વેરો ચૂકવવાનો છે તે સિવાય), પુરવઠાની વિગતોનો સમાવેશ થાય છે જે તમારા પુરવઠાકારો દ્વારા તેમના નમૂના જીએસટીઆર -૧ અને ૫ માં જાહેર કરવામાં આવી છે અને ફાઇલ કરવામાં આવી છે. ૨. આ કોષ્ટક ફક્ત પુરવઠો પૂરો પાડે છે કે જેના પર આઈટીસી ઉપલબ્ધ નથી. ૩. આ ફક્ત માહિતી માટે છે અને આવી શાખ, નમૂના જીએસટીઆર-૩ ખમાં લેવામાં આવશે નહિ.

કોષ્ટક અનુક્રમાંક અને મથાળું	સૂચના
કોષ્ટક ૪ ભાગ ક વિભાગ આઈએસટીમાંથી આવક પુરવઠા	૧. આ વિભાગમાં પુરવઠાકારોની વિગતોનો સમાવેશ થાય છે, જે ઈનપુટ સેવા વિતરક દ્વારા તેમના નમૂના જીએસટીઆર -૬ માં જાહેર અને ફાઈલ કરવામાં આવી છે. ૨. આ કોષ્ટક ફક્ત પુરવઠો પૂરો પાડે છે કે જેના પર આઈટીસી ઉપલબ્ધ નથી. ૩. આ ફક્ત માહિતી માટે છે અને આવી શાખ, નમૂના જીએસટીઆર-૩ ખમાં લેવામાં આવશે નહિ.
કોષ્ટક ૪ ભાગ ક વિભાગ ૩ વિપરીત ચાર્જ માટે જવાબદાર આવક પુરવઠા	૧. આ વિભાગમાં વિપરીત ચાર્જ માટે પાત્ર પુરવઠાની વિગતોનો સમાવેશ થાય છે, જે તમારા પુરવઠાકાર દ્વારા તેમના નમૂના જીએસટીઆર -૧ માં જાહેર અને ફાઈલ કરવામાં આવી છે. ૨. આ કોષ્ટક ફક્ત પુરવઠો પૂરો પાડે છે કે જેના પર આઈટીસી ઉપલબ્ધ નથી. ૩. વેરાની ચુકવણી માટે આ પુરવઠો, નમૂના જીએસટીઆર-૩ખ ના કોષ્ટક ૩.૧ (ધ) માં જાહેર કરવામાં આવશે. તેમ છતાં, આવા પુરવઠા પર શાખ ઉપલબ્ધ થશે નહિ.
કોષ્ટક ૪ ભાગ ખ વિભાગ ૧ અન્ય	૧. આ વિભાગ પ્રાપ્ત જમા નોંધ અને તેમાં સુધારાની વિગતો સામેલ કરે છે જે તમારા પુરવઠાકારો દ્વારા તેમના નમૂના જીએસટીઆર -૧ અને ૫-માં જાહેર અને ફાઈલ કરવામાં આવી છે. ૨. આ કોષ્ટક ફક્ત જમા નોંધ પૂરી પાડે છે કે જેના પર આઈટીસી ઉપલબ્ધ નથી. ૩. આવી શાખ, નમૂના જીએસટીઆર-૩ખ-ના કોષ્ટક ૪(ખ) (૨) હેઠળ ઊલટાવવામાં આવશે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.



Extra No. 143



વાર્ષિક લવાજમનો દર રૂ. ૪,૦૦૦/-



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

FRIDAY, JUNE 25, 2021 / ASADHA 4, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૫મી જૂન, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૧૮મી ડિસેમ્બર, ૨૦૨૦ના સરકારી જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૧૧૬) / જીએસટી-૨૦૨૦/એસ.૧૬૮એ(૮)ઠ.- નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

NOTIFICATION

Regarding

Amendment to the Notification of the Government of Gujarat, Finance Department
No. (GHN-37) GST-2020/S.168A(1)-TH, dated the 9th April 2020.

ગુજરાત સરકારના નાણા વિભાગનું તારીખ: ૯મી એપ્રિલ, ૨૦૨૦નું સરકારી જાહેરનામું ક્રમાંક (જીએચએન-૩૭)જીએસટી-૨૦૨૦/એસ.૧૬૮એ(૧)-ઠ. સુધારવા સંબંધી

જાહેરનામું

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૮મી ડિસેમ્બર, ૨૦૨૦

જાહેરનામું ક્રમાંક. ૯૧/૨૦૨૦- રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક. (જીએચએન-૧૧૬)જીએસટી-૨૦૨૦/એસ.૧૬૮એ(૯)ઠ:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા)ની કલમ ૧૬૮-ક-થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોને આધારે, આથી, ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૯મી એપ્રિલ, ૨૦૨૦ના સરકારી જાહેરનામા ક્રમાંક. (જીએચએન-૩૭)જીએસટી-૨૦૨૦-એસ.૧૬૮એ(૧)-ઠ, જાહેરનામા ક્રમાંક ૩૫/૨૦૨૦-રાજ્ય વેરો-માં નીચે પ્રમાણે વધુ સુધારો કરે છે:-

સદરહુ જાહેરનામામાં, પ્રથમ પરિચ્છેદમાં, ખંડ (૧)ના પરંતુકમાં-

- (૧) “સન ૨૦૨૦ના નવેમ્બર મહિનાની ૨૯મી તારીખ” એ શબ્દો, આંકડા અને અક્ષરોને બદલે, “સન ૨૦૨૧ના માર્ચ મહિનાની ૩૦મી તારીખ” એ શબ્દો, આંકડા અને અક્ષરો મૂકવા.
- (૨) “સન ૨૦૨૦ના નવેમ્બર મહિનાની ૩૦મી તારીખ” એ શબ્દો, આંકડા અને અક્ષરોને બદલે, “સન ૨૦૨૧ના માર્ચ મહિનાની ૩૧મી તારીખ” એ શબ્દો, આંકડા અને અક્ષરો મૂકવા.

૨. આ જાહેરનામું સન ૨૦૨૦ના ડિસેમ્બર મહિનાની ૧લી તારીખથી અમલમાં આવ્યું હોવાનું ગણાશે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.

સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII | THURSDAY, MARCH 25, 2021 / CHAITRA 04, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૫મી માર્ચ, ૨૦૨૧.

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૧લી જાન્યુઆરી, ૨૦૨૧ના સરકારી જાહેરનામા ક્રમાંક. (જીએચએન-૧)જીએસટી-૨૦૨૧/એસ.૧૬૪(૬૮)ઠ.નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારૂ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

Notification

Regarding

Amendment to the Gujarat Goods and Services Tax Rules, 2017

ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ સુધારવા સંબંધી

જાહેરનામું

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૧.

જાહેરનામા ક્રમાંક.૧/૨૦૨૧-રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક.(જાએચએન-૧)જાએસટી-૨૦૨૧/એસ.૧૬૪(૬૮)ઠ:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના રપમા)ની કલમ ૧૬૪થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોને આધારે, આથી, ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ વધુ સુધારવા નીચેના નિયમો કરે છે:-

૧. ટૂંકી સંજ્ઞા અને આરંભ:

(૧) આ નિયમો ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) નિયમો, ૨૦૨૧ કહેવાશે.

(૨) આ નિયમો રાજપત્રમાં તેની પ્રસિદ્ધિની તારીખે અમલમાં આવશે.

૨. ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (જેનો આ જાહેરનામામાં, હવે પછી, "સદરહુ નિયમો" તરીકે ઉલ્લેખ કર્યો છે તે)માં, નિયમ પદમાં, પેટા-નિયમ (૫) પછી, નીચેનો પેટા-નિયમ દાખલ કરવો:-

“(૬) આ નિયમમાં ગમે તે મજકૂર હોય તેમ છતાં,-

(ક) રજિસ્ટર થયેલી વ્યક્તિએ, અગાઉના બે મહિના માટે નમૂના જાએસટીઆર-૩ખ માં પત્રક રજૂ કર્યું ન હોય, તો તેને કલમ ૩૭ હેઠળ નમૂના જાએસટીઆર-૧માં માલ અથવા સેવા અથવા તે બંનેના જાવક પુરવઠાની વિગતો રજૂ કરવા પરવાનગી આપવામાં આવશે નહિ;

(ખ) જેને કલમ ૩૮ની પેટા-કલમ(૧)ના પરંતુક હેઠળ દરેક ત્રિમાસ માટે પત્રક રજૂ કરવા ફરમાવેલ હોય તેવી રજિસ્ટર થયેલ વ્યક્તિએ, અગાઉની વેરા મુદત માટે નમૂના જાએસટીઆર-૩ખ માં પત્રક રજૂ કર્યું ન હોય, તો તેને કલમ ૩૭ હેઠળ નમૂના જાએસટીઆર-૧માં માલ અથવા સેવા અથવા તે બંનેના જાવક પુરવઠાની વિગતો રજૂ કરવાની અથવા ભરતિયાં રજૂ કરવાની સુવિધાનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે નહિ;

(ગ) નિયમ ૮૬ખ હેઠળ આવી વેરા જવાબદારીના નવ્વાણુ ટકાથી વધુ હોય તેવી વેરા બાબતની તેની જવાબદારી અદા કરવા ઇલેક્ટ્રોનિક જમા ખાતાવહીમાં ઉપલબ્ધ રકમનો ઉપયોગ કરવા જેને પ્રતિબંધિત કરવામાં આવી હોય તેવી રજિસ્ટર થયેલ વ્યક્તિએ, અગાઉની વેરા મુદત માટે નમૂના જાએસટીઆર-૫ માં પત્રક રજૂ કર્યું ન હોય, તો તેને કલમ ૩૭ હેઠળ નમૂના જાએસટીઆર-૧માં માલ અથવા સેવા અથવા તે બંનેના જાવક પુરવઠાની વિગતો રજૂ કરવાની અથવા ભરતિયાં રજૂ કરવાની સુવિધાનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે નહિ.”

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,

સરકારના નાયબ સચિવ.



સત્યમેવ જયતે

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII | WEDNESDAY, MARCH 23, 2021 / CHAITRA 2, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૩મી માર્ચ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૨૭ માર્ચ, ૨૦૨૧ના જાહેરનામા ક્રમાંક: (જએચએન-૯) જએસટી-૨૦૨૧/એસ.૨૫(કડી)(૨)-૬નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

Notification*Under***The Gujarat Goods and Services Tax Act, 2017.****ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ હેઠળ****જાહેરનામું.****નાણા વિભાગ**

સચિવાલય, ગાંધીનગર, તારીખ: ૨૭ માર્ચ, ૨૦૨૧

જાહેરનામું ક્રમાંક: ૩/૨૦૨૧-રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક. (જીએચએન-૯)જીએસટી-૨૦૨૧/એસ.૨૫(૬ડી)(૨)-૬:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા) (જેનો આમાં હવે પછી, આ જાહેરનામામાં "સદરહુ અધિનિયમ" તરીકે ઉલ્લેખ કર્યો છે તે)ની કલમ ૨૫-ની પેટા-કલમ (૬ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોને આધારે અને નાણા વિભાગનું તારીખ: ૨૭-મી માર્ચ, ૨૦૨૦-નું સરકારી જાહેરનામું ક્રમાંક: (જીએચએન-૨૬)જીએસટી-૨૦૨૦/એસ.૨૫(૬ડી)(૧)-૬, જાહેરનામા ક્રમાંક: ૧૭/૨૦૨૦-રાજ્ય વેરો. ૨૬ કરીને, એવી રીતે ૨૬ થયા પહેલા કરેલી અથવા કરવાની પડતી મુકેલી અમુક બાબતોના સંબંધમાં હોય તે સિવાય, આથી જાહેર કરે છે કે સદરહુ અધિનિયમની કલમ ૨૫-ની પેટા-કલમ (૬ખ) અથવા પેટા-કલમ (૬ગ)ની જોગવાઈઓ, જે વ્યક્તિ, -

(ક) ભારતની નાગરિક ન હોય; અથવા

(ખ) કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો વિભાગ અથવા સંસ્થા હોય; અથવા

(ગ) સ્થાનિક સત્તામંડળ હોય; અથવા

(ઘ) વૈદ્યાનિક મંડળ હોય; અથવા

(ચ) જાહેરક્ષેત્રનું અન્ડરટેકીંગ હોય; અથવા

(છ) સદરહુ અધિનિયમની કલમ ૨૫-ની પેટા-કલમ (૯)ની જોગવાઈઓ હેઠળ રજિસ્ટ્રેશન માટે અરજી કરતી વ્યક્તિ હોય,

તેને લાગુ પડશે નહિ.

૨. આ જાહેરનામું સન ૨૦૨૧-ના ફેબ્રુઆરી મહિનાની ૨૩-મી તારીખથી અમલમાં આવ્યું હોવાનું ગણાશે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,

સરકારના નાયબ સચિવ.

સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

FRIDAY, JUNE 25, 2021 / ASADHA 4, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
સચિવાલય, ગાંધીનગર, ૨૫મી જૂન, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૧૮મી માર્ચ, ૨૦૨૧ના સરકારી જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૧૩) જીએસટી-૨૦૨૧/આર.૪૮ (૪) (૬) ઠ.- નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

NOTIFICATION

Regarding

Amendment to the notification of the Government of Gujarat, Finance Department, No. (GHN-22) GST-2020/R.48(4)(2)-TH, Dated the 27th March, 2020, Notification No.13/2020-State Tax.

ગુજરાત સરકારના નાણા વિભાગનું તારીખ: ૨૭મી માર્ચ, ૨૦૨૦નું જાહેરનામું

ક્રમાંક: (જીએચએન-૨૨)જીએસટી-૨૦૨૦/આર.૪૮(૪)(૨)-ઠ, જાહેરનામું ક્રમાંક. ૧૩/૨૦૨૦-રાજ્ય વેરો સુધારવા સંબંધી જાહેરનામું.

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૮મી માર્ચ, ૨૦૨૧

જાહેરનામું ક્રમાંક. ૫/૨૦૨૧-રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક: (જીએચએન-૧૩) જીએસટી-૨૦૨૧/આર.૪૮ (૪) (૬) ઠ:- ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ના નિયમ ૪૮ના પેટા-નિયમ (૪)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોને આધારે, આથી, ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૨૭મી માર્ચ, ૨૦૨૦ના જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૨૨)જીએસટી-૨૦૨૦/આર.૪૮(૪)(૨)-ઠ, જાહેરનામા ક્રમાંક. ૧૩/૨૦૨૦-રાજ્ય વેરામાં, નીચેના વધુ સુધારા કરે છે:-

સદરહુ જાહેરનામામાં, પહેલા પરિચ્છેદમાં, સન ૨૦૨૧ના એપ્રિલ મહિનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ, “રૂપિયા એક સો કરોડ” એ શબ્દોને બદલે, “રૂપિયા પચાસ કરોડ” એ શબ્દો મૂકવા.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.

સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર.

Extra No. 160



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

WEDNESDAY, JULY 7, 2021 / ASADHA 16, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૭મી જુલાઈ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૧૧મી મે, ૨૦૨૧ના જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૨૧)જીએસટી-૨૦૨૧/એસ.૧૬૪(૬૯)ઠ.- નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

Notification**Regarding****Amendment to the Gujarat Goods and Services Tax Rules, 2017.**

ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ સુધારવા સંબંધી

જાહેરનામું.

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૧મી મે, ૨૦૨૧.

જાહેરનામું ક્રમાંક. ૦૭/૨૦૨૧-રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક. (જીએચએન-૨૧) જીએસટી-૨૦૨૧/એસ.૧૬૪(૬૯)ઠ:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા)ની કલમ ૧૬૪થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોને આધારે, આથી, ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ વધુ સુધારવા નીચેના નિયમો કરે છે:-

૧. ટૂંકી સંજ્ઞા અને આરંભ.-

(૧) આ નિયમો ગુજરાત માલ અને સેવા વેરા (દ્વિતીય સુધારા) નિયમો, ૨૦૨૧ કહેવાશે.

(૨) આ નિયમો સન ૨૦૨૧ના એપ્રિલ મહિનાની ૨૭મી તારીખથી અમલમાં આવ્યા હોવાનું ગણાશે.

૨. ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭માં, નિયમ ૨૬માં, પેટા-નિયમ (૧)માં, ત્રીજા પરંતુક પછી, નીચેનો પરંતુક દાખલ કરવો:-

“વળી, કંપની અધિનિયમ, ૨૦૧૩ (સન ૨૦૧૩ના ૧૮મા)ની જોગવાઈઓ હેઠળ રજિસ્ટર થયેલી વ્યક્તિને, સન ૨૦૨૧ના એપ્રિલ મહિનાની ૨૭મી તારીખથી સન ૨૦૨૧ના મે મહિનાની ૩૧મી તારીખ સુધીની મુદત દરમિયાન, કલમ ૩૯ હેઠળ નમૂના જીએસટીઆર-૩બ-માં પત્રક રજૂ કરવાની અને કલમ ૩૭ હેઠળ નમૂના જીએસટીઆર-૧માં અથવા ભરતિયું રજૂ કરવાની સુવિધાનો ઉપયોગ કરીને, ઈલેક્ટ્રોનિક ખરાઈ (વેરિફિકેશન) કોડ (EVC) મારફત ખરાઈ કરેલા જાવક પુસ્તકોની વિગતો રજૂ કરવાની પણ છૂટ આપવી જોઈશે.”.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,

સરકારના નાયબ સચિવ.



Extra No. 151



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

TUESDAY, JULY 6, 2021 / ASADHA 15, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

વેધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
સચિવાલય, ગાંધીનગર, દહેલી જુલાઈ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગ-ના તારીખ: ૧૭મી મે, ૨૦૨૧ના સરકારી જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૨૨) જીએસટી-૨૦૨૧/એસ.૧૨૮(૨૮)ઠ. - નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

Notification

Regarding

Amendment to the Notification of the Government of Gujarat, Finance Department, No. (GHN-134) GST-2018/S.128(13)-TH, Dated the 31st December, 2018, Notification No.76/2018-State Tax.

ગુજરાત સરકારના નાણા વિભાગનું તારીખ: ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૮નું જાહેરનામું ક્રમાંક: (જીએચએન-૧૩૪) જીએસટી-૨૦૧૮/એસ.૧૨૮(૧૩)-ઠ, જાહેરનામું ક્રમાંક. ૭૬/૨૦૧૮-રાજ્ય વેરો

સુધારવા સંબંધી

જાહેરનામું.

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, તારીખ: ૧૭મી મે, ૨૦૨૧

જાહેરનામું ક્રમાંક. ૦૮/૨૦૨૧-રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક: (જીએચએન-૨૨)/જીએસટી-૨૦૨૧/એસ.૧૨૮(૨૮)-ઠ:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા)ની કલમ ૧૨૮થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, કાઉન્સિલની ભલામણોના આધારે, આથી, ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૮ના જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૧૩૪) જીએસટી-૨૦૧૮/એસ.૧૨૮(૧૩)-ઠ, જાહેરનામું ક્રમાંક. ૭૬/૨૦૧૮-રાજ્ય વેરોમાં, નીચેના વધુ સુધારા કરે છે:-

સદરહુ જાહેરનામામાં, સાતમા પરંતુક પછી, નીચેનો પરંતુક દાખલ કરવો:-

“ વળી, વધુમાં નિયત તારીખ સુધીમાં નમૂના જીએસટીઆર ઉખ-માં પત્રક રજૂ કરવામાં ચૂક કરે તેવી, નીચે દર્શાવેલ કોષ્ટકના કોલમ (૨)માંની તત્સમાન નોંધમાં જણાવેલી રજિસ્ટર થયેલી વ્યક્તિઓના વર્ગ માટે, સદરહુ કોષ્ટકના કોલમ (૩)માંની તેને અનુરૂપ નોંધમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણેની વેરા મુદત માટેની, કલમ ૪૭ હેઠળ ચૂકવવાપાત્ર થતી વિલંબ ફી ની રકમ, સદરહુ કોષ્ટકના કોલમ (૪)માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણેની મુદત માટે માફ (જતી) કરવામાં આવશે:-

કોષ્ટક

અનુક્રમાંક (૧)	રજિસ્ટર થયેલી વ્યક્તિઓનો વર્ગ (૨)	વેરા મુદત (૩)	વિલંબ ફી માફ (જતી) કરાઈ હોય તે મુદત (૪)
૧.	અગાઉના નાણાકીય વર્ષમાં ૫ કરોડ રૂપિયાથી વધુ એકંદર ટર્નઓવર ધરાવતા વેરા ચૂકવનાર	માર્ચ, ૨૦૨૧ અને એપ્રિલ, ૨૦૨૧	પત્રક રજૂ કરવાની નિયત તારીખથી પંદર દિવસ.
૨.	કલમ ૩૮ની પેટા-કલમ (૧) હેઠળ નિર્દિષ્ટ કર્યા પ્રમાણે પત્રક રજૂ કરવા માટે જવાબદાર હોય તેવા, અગાઉના નાણાકીય વર્ષમાં ૫ કરોડ રૂપિયા સુધીનું એકંદર ટર્નઓવર ધરાવતા વેરા ચૂકવનાર	માર્ચ, ૨૦૨૧ અને એપ્રિલ, ૨૦૨૧	પત્રક રજૂ કરવાની નિયત તારીખથી ત્રીસ દિવસ.
૩.	કલમ ૩૮ની પેટા-કલમ (૧)ના પરંતુક હેઠળ નિર્દિષ્ટ કર્યા પ્રમાણે પત્રક રજૂ કરવા માટે જવાબદાર હોય તેવા, અગાઉના નાણાકીય વર્ષમાં ૫ કરોડ રૂપિયા સુધીનું એકંદર ટર્નઓવર ધરાવતા વેરા ચૂકવનાર	જાન્યુઆરી - માર્ચ, ૨૦૨૧	પત્રક રજૂ કરવાની નિયત તારીખથી ત્રીસ દિવસ.”

૨. આ જાહેરનામું સન ૨૦૨૧ના એપ્રિલ મહિનાની ૨૦મી તારીખથી અમલમાં આવ્યું હોવાનું ગણાશે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.



Extra No. 154



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

TUESDAY, JULY 6, 2021 / ASADHA 15, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
સચિવાલય, ગાંધીનગર, દહેજી જુલાઈ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૧૭મી મે, ૨૦૨૧ના જાહેરનામા ક્રમાંક:
(જીએચએન-૨૩)/જીએસટી-૨૦૨૧/એસ.૫૦(૧)(૨)-૬.- નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

Notification

Regarding

Amendment to the Notification of the Government of Gujarat,
Finance Department, No. (GHN-30) GST-2017/S.50, 54 & 56 (1)-TH,
Dated the 30th June, 2017, Notification No.13/2017-State Tax.

ગુજરાત સરકારના નાણા વિભાગનું તારીખ: ૩૦મી જૂન, ૨૦૧૭નું જાહેરનામું
ક્રમાંક: (જીએચએન-૩૦) જીએસટી-૨૦૧૭/એસ.૫૦, ૫૪ અને ૫૬ (૧)-ઠ, જાહેરનામું ક્રમાંક. ૧૩/૨૦૧૭-રાજ્ય વેરો

સુધારવા સંબંધી

જાહેરનામું

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૭મી મે, ૨૦૨૧.

જાહેરનામું ક્રમાંક. ૦૮/૨૦૨૧-રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક: (જીએચએન-૨૩)/જીએસટી-૨૦૨૧/એસ.૫૦(૧)(૨)-ઠ:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા)ની કલમ ૧૪૮ સાથે વાંચતા, સદરહુ અધિનિયમની કલમ ૫૦-ની પેટા-કલમ (૧)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોના આધારે, આથી, ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૩૦મી જૂન, ૨૦૧૭ના જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૩૦) જીએસટી-૨૦૧૭/એસ.૫૦, ૫૪ અને ૫૬ (૧)-ઠ, જાહેરનામું ક્રમાંક. ૧૩/૨૦૧૭-રાજ્ય વેરોમાં, નીચેના વધુ સુધારા કરે છે:-

(૧) સદરહુ જાહેરનામામાં, પ્રથમ પરિચ્છેદમાં, પ્રથમ પરંતુકમાં, કોષ્ટકમાં, અનુક્રમાંક ૩ પછી, નીચેનો મજકૂર દાખલ કરવો:-

(૧)	(૨)	(૩)	(૪)
“૪.	અગાઉના નાણાકીય વર્ષમાં ૫ કરોડ રૂપિયાથી વધુ એકંદર ટર્નઓવર ધરાવતા વેરા ચૂકવનાર.	નિયત તારીખથી પ્રથમ ૧૫ દિવસ માટે ૮ ટકા અને ત્યાર પછી ૧૮ ટકા.	માર્ચ, ૨૦૨૧, એપ્રિલ, ૨૦૨૧
૫.	કલમ ૩૮ની પેટા-કલમ (૧) હેઠળ નિર્દિષ્ટ કર્યા પ્રમાણે પત્રક રજૂ કરવા માટે જવાબદાર હોય તેવા, અગાઉના નાણાકીય વર્ષમાં ૫ કરોડ રૂપિયા સુધીનું એકંદર ટર્નઓવર ધરાવતા વેરા ચૂકવનાર	નિયત તારીખથી પ્રથમ ૧૫ દિવસ માટે શૂન્ય, પછીના ૧૫ દિવસ માટે ૮ ટકા અને ત્યાર પછી ૧૮ ટકા.	માર્ચ, ૨૦૨૧, એપ્રિલ, ૨૦૨૧
૬.	કલમ ૩૮ની પેટા-કલમ (૧)ના પરંતુક હેઠળ નિર્દિષ્ટ કર્યા પ્રમાણે પત્રક રજૂ કરવા માટે જવાબદાર હોય તેવા, અગાઉના નાણાકીય વર્ષમાં ૫ કરોડ રૂપિયા સુધીનું એકંદર ટર્નઓવર ધરાવતા વેરા ચૂકવનાર	નિયત તારીખથી પ્રથમ ૧૫ દિવસ માટે શૂન્ય, પછીના ૧૫ દિવસ માટે ૮ ટકા અને ત્યાર પછી ૧૮ ટકા.	માર્ચ, ૨૦૨૧, એપ્રિલ, ૨૦૨૧
૭.	કલમ ૩૮ની પેટા-કલમ (૨) હેઠળ નિર્દિષ્ટ કર્યા પ્રમાણે પત્રક રજૂ કરવા માટે જવાબદાર હોય તેવા વેરા ચૂકવનાર	નિયત તારીખથી પ્રથમ ૧૫ દિવસ માટે શૂન્ય, પછીના ૧૫ દિવસ માટે ૮ ટકા અને ત્યાર પછી ૧૮ ટકા.	માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરો થતો ત્રિમાસ.”

૨. આ જાહેરનામું સન ૨૦૨૧ના એપ્રિલ મહિનાની ૧૮મી તારીખથી અમલમાં આવ્યું હોવાનું ગણાશે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.



Extra No. 146



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

MONDAY, JULY 5, 2021 / ASADHA 14, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૫મી જુલાઈ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૧૭મી મે, ૨૦૨૧ના જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૨૫)/જીએસટી-૨૦૨૧/એસ.૧૪૮(૩૭)ઠ, અને (જીએચએન-૨૪)/જીએસટી-૨૦૨૧/એસ.૧૬૪(૭૦)-ઠ. નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

NOTIFICATION

Regarding

**AMENDMENT TO THE GOVERNMENT NOTIFICATION, FINANCE DEPARTMENT NO. (GHN-43)
GST-2019/S.148(15)-TH, DATED 24TH APRIL, 2019, NOTIFICATION NO.21/2019-STATE TAX.**

નાણા વિભાગનું તારીખ: ૨૪મી એપ્રિલ, ૨૦૧૯નું સરકારી જાહેરનામું
ક્રમાંક: (જીએચએન-૪૩) જીએસટી-૨૦૧૯/એસ.૧૪૮ (૧૫)-૬, જાહેરનામું ક્રમાંક. ૨૧/૨૦૧૯-રાજ્ય વેરો. સુધારવા સંબંધી
જાહેરનામું.

નાણા વિભાગ,

સચિવાલય, ગાંધીનગર, ૧૭ મી મે, ૨૦૨૧.

જાહેરનામું ક્રમાંક. ૧૦/૨૦૨૧-રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક: (જીએચએન-૨૫)/જીએસટી-૨૦૨૧/એસ.૧૪૮(૩૭)-૬ :- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા)ની કલમ ૧૪૮-થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોના આધારે, આથી, નાણા વિભાગના તારીખ: ૨૪મી એપ્રિલ, ૨૦૧૯ના સરકારી જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૪૩) જીએસટી-૨૦૧૯/એસ.૧૪૮ (૧૫)-૬, જાહેરનામું ક્રમાંક. ૨૧/૨૦૧૯-રાજ્ય વેરો-માં, નીચેના વધુ સુધારા કરે છે:-

સદરહુ જાહેરનામામાં, ત્રીજા પરિચ્છેદમાં, પ્રથમ પરંતુક પછી, નીચેનો પરંતુક દાખલ કરવો:-

“વધુમાં સન ૨૦૨૧-ના માર્ચ મહિનાની ૩૧-મી તારીખે પૂરા થતા નાણાકીય વર્ષ માટે, સદરહુ વ્યક્તિઓએ, ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭-ના નમૂના જીએસટીઆર-૪-માં, સન ૨૦૨૧-ના મે મહિનાની ૩૧-મી તારીખ સુધીમાં પત્રક રજૂ કરવું જોઈશે.”.

૨. આ જાહેરનામું સન ૨૦૨૧-ના એપ્રિલ મહિનાની ૩૦-મી તારીખથી અમલમાં આવ્યું હોવાનું ગણાશે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,

સરકારના નાયબ સચિવ.

NOTIFICATION

Regarding

AMENDMENT TO THE GUJARAT GOODS AND SERVICES TAX RULES, 2017.

ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ સુધારવા સંબંધી
જાહેરનામું.

નાણા વિભાગ,

સચિવાલય, ગાંધીનગર, ૧૭મી મે, ૨૦૨૧.

જાહેરનામું ક્રમાંક: ૧૩/૨૦૨૧ - રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક. (જીએચએન-૨૪)જીએસટી-૨૦૨૧/એસ.૧૬૪(૭૦)-૬ :- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા)ની કલમ ૧૬૪થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોને આધારે, આથી, ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ વધુ સુધારવા માટે નીચેના નિયમો કરે છે:-

૧. ટૂંકી સંજ્ઞા અને આરંભ:

(૧) આ નિયમો ગુજરાત માલ અને સેવા વેરા (તૃતીય સુધારા) નિયમો, ૨૦૨૧ કહેવાશે.

(૨) આ નિયમો સન ૨૦૨૧-ના મે મહિનાની ૧-લી તારીખથી અમલમાં આવ્યા હોવાનું ગણાશે.

૨. ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭-માં,-

(૧) નિયમ ૩૬-ના પેટા-નિયમ (૪)માં, પ્રથમ પરંતુક પછી, નીચેનો પરંતુક ઉમેરવો:-

“વધુમાં આવી શરત, એપ્રિલ અને મે, ૨૦૨૧-ની મુદત માટે એકંદરે લાગુ પડશે અને વેરા મુદત મે, ૨૦૨૧-માટેના નમૂના જીએસટીઆર-૩બ-માંનું પત્રક, ઉપર્યુક્ત શરત અનુસાર સદરહુ મહિનાઓ માટેના ઈનપુટ વેરા શાખના એકંદર સમાયોજન સાથે રજૂ કરવું જોઈશે.”;

(૨) નિયમ ૫૯-ના પેટા-નિયમ (૨)માં, નીચેનો પરંતુક દાખલ કરવો:-

“પરંતુ રજિસ્ટર થયેલી વ્યક્તિ એપ્રિલ, ૨૦૨૧-ના મહિના માટે આઈએફએફ નો ઉપયોગ કરીને સન ૨૦૨૧-ના મે મહિનાની ૧-લી તારીખથી સન ૨૦૨૧-ના મે મહિનાની ૨૮-મી તારીખ સુધીમાં આવી વિગતો રજૂ કરી શકશે.”.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.



Extra No. 201



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII | TUESDAY, AUGUST 3, 2021 / SRAVANA 12, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

वैधानिक अने संसदीय बाबतोनो विभाग

सचिवालय, गांधीनगर, २८मी जुलाई, २०२१

गुजरात गेजेटमां अंग्रेजमां प्रसिद्ध थयेला गुजरात सरकारना नाष्ठा विभागना तारीख: १७मी मे, २०२१ना जाहेरनामा कमांक:
(अभेयअन-२६)/अभेसटी-२०२१/अस.१६८८ (१०)६.- नो गुजराती अनुवाद आधी सर्व लोकोनी जाण सारु प्रसिद्ध कर्यो छे.

वी. अेन. शेण,
सरकारना नायब सचिव.

NOTIFICATION

Under

The Gujarat Goods and Services Tax Act, 2017.

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ હેઠળ

જાહેરનામું.

નાણા વિભાગ,

સચિવાલય, ગાંધીનગર, ૧૭મી મે, ૨૦૨૧.

જાહેરનામું ક્રમાંક: ૧૪/૨૦૨૧-રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક: (જીએચએન-૨૬)જીએસટી-૨૦૨૧/એસ.૧૬૮ક(૧૦)ઃ- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા) (જેનો આ જાહેરનામામાં હવે પછી, "સદરહુ અધિનિયમ" તરીકે ઉલ્લેખ કર્યો છે તે)ની કલમ ૧૬૮ ક-થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોને આધારે, આથી, ભારતના અનેક વિસ્તારોમાં કોવિડ-૧૯ મહામારીના ફેલાવાને ધ્યાનમાં લેતાં, નીચે પ્રમાણે જાહેર કરે છે,-

(૧) ઉપર્યુક્ત અધિનિયમની જોગવાઈઓ હેઠળ,-

- (ક) ગમે તે નામે ઓળખાતા કોઈ સત્તામંડળ, કમિશન (આયોગ) અથવા ટ્રિબ્યુનલ દ્વારા કોઈપણ કાર્યવાહી પૂરી કરવાના અથવા કોઈ હુકમ પસાર કરવાના અથવા કોઈ નોટિસ આપવાના, જાણ કરવાના, જાહેરનામું બહાર પાડવાના, પરવાનગી અથવા મંજૂરી આપવાના અથવા ગમે તે નામે ઓળખાતી એવી બીજી કાર્યવાહીના; અથવા
- (ખ) કોઈ અપીલ, જવાબ અથવા અરજી ફાઇલ (દાખલ) કરવાના અથવા કોઈ રિપોર્ટ, દસ્તાવેજ, પત્રક (રિટર્ન), નિવેદન અથવા ગમે તે નામે ઓળખાતો એવો બીજો રેકર્ડ રજૂ કરવાના,

-હેતુઓ માટે હોય તે સહિતની કોઈપણ કાર્યવાહી, કોઈપણ સત્તામંડળે પૂરી કરવા અથવા કોઈપણ વ્યક્તિએ તેનું પાલન કરવા માટેની અને સન ૨૦૨૧ના એપ્રિલ મહિનાની ૧૫મી તારીખથી સન ૨૦૨૧ના મે મહિનાની ૩૦મી તારીખ સુધીની મુદત દરમિયાન આવતી સમયમર્યાદા, સદરહુ અધિનિયમ હેઠળ નિર્દિષ્ટ કરેલી અથવા ઠરાવેલી અથવા જાહેર કરેલી હોય અને આવી કાર્યવાહી, આવી સમયમર્યાદાની અંદર પૂરી કરી ન હોય અથવા તેનું પાલન કર્યું ન હોય ત્યારે, આવી કાર્યવાહી પૂરી કરવા અથવા તેનું પાલન કરવા માટેની સમયમર્યાદા, સન ૨૦૨૧ના મે મહિનાની ૩૧મી તારીખ સુધી લંબાવવી જોઈશે;

પરંતુ આવી લંબાવેલી સમયમર્યાદા, સદરહુ અધિનિયમની નીચેની જોગવાઈઓના પાલનને લાગુ પડશે નહિ:-

- (ક) પ્રકરણ ૪;
- (ખ) કલમ ૧૦ની પેટા-કલમ (૩), કલમો ૨૫, ૨૭, ૩૧, ૩૭, ૪૭, ૫૦, ૬૯, ૮૦, ૧૨૨, ૧૨૯;
- (ગ) પેટા-કલમો (૩), (૪) અને (૫) સિવાય, કલમ ૩૯;
- (ઘ) ઈલેક્ટ્રોનિક વે બિલને સંબંધિત હોય ત્યાં સુધી, કલમ ૬૮; અને
- (ચ) ઉપરના ખંડ (ક) થી (ઘ)-માં નિર્દિષ્ટ કરેલી જોગવાઈઓ હેઠળ બનાવેલા નિયમો:

પરંતુ ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ના નિયમ ૯ હેઠળ નિર્દિષ્ટ કરેલી અથવા ઠરાવેલી અથવા જાહેર કરેલી કોઈપણ કાર્યવાહી, કોઈપણ સત્તામંડળે પૂરી કરવા અથવા કોઈપણ વ્યક્તિએ તેનું પાલન કરવા માટેની સમયમર્યાદા, સન ૨૦૨૧ના મે મહિનાની ૧લી તારીખથી સન ૨૦૨૧ના મે મહિનાની ૩૧મી તારીખ સુધીની મુદત દરમિયાન આવતી હોય અને આવી કાર્યવાહી, આવી સમયમર્યાદાની અંદર પૂરી કરી ન હોય ત્યારે, આવી કાર્યવાહી પૂરી કરવા માટેની સમયમર્યાદા, સન ૨૦૨૧ના જૂન મહિનાની ૧૫મી તારીખ સુધી લંબાવવી જોઈશે;

(૨) સંપૂર્ણતઃ અથવા અંશતઃ રિફંડના દાવાના ઈન્કાર માટે નોટિસ આપવામાં આવી હોય અને સદરહુ અધિનિયમની કલમ ૫૪ની પેટા-કલમ (૭) સાથે વાંચતાં, પેટા-કલમ (૫)ની જોગવાઈઓના સંદર્ભમાં હુકમ આપવા માટેની સમયમર્યાદા, સન ૨૦૨૧ના એપ્રિલ મહિનાની ૧૫મી તારીખથી સન ૨૦૨૧ના મે મહિનાની ૩૦મી તારીખ સુધીની મુદત દરમિયાન આવતી હોય ત્યારે, આવા કિસ્સામાં, સદરહુ હુકમ આપવા

મોટેની સમયમર્યાદા, રજિસ્ટર થયેલી વ્યક્તિ પાસેથી નોટિસનો જવાબ મળ્યા પછી, પંદર દિવસ સુધી અથવા સન ૨૦૨૧ના મે મહિનાની ૩૧મી તારીખ સુધી, એ બંનેમાંથી જે મોડું હોય તે તારીખ સુધી લંબાવવી જોઈશે.

૨. આ જાહેરનામું સન ૨૦૨૧ના એપ્રિલ મહિનાની ૧૫મી તારીખથી અમલમાં આવ્યું હોવાનું ગણાશે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.



Extra No. 150



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

TUESDAY, JULY 6, 2021 / ASADHA 15, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
સચિવાલય, ગાંધીનગર, દહેલી જુલાઈ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૨૭ જૂન, ૨૦૨૧ના જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૨૭) જીએસટી-૨૦૨૧/એસ.૧૬૪(૭૧)૬.- નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

Notification

Regarding

Amendment to the Gujarat Goods and Services Tax Rules, 2017.

ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ સુધારવા સંબંધી

જાહેરનામું.

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૭ જૂન, ૨૦૨૧.

જાહેરનામું ક્રમાંક: ૧૫/૨૦૨૧-રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

(જીએચએન-૨૭) જીએસટી-૨૦૨૧/ એસ.૧૬૪(૭૧)ઠ:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા)ની કલમ ૧૬૪થી મળેલી સત્તાની રૂએ, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોને આધારે, ગુજરાત સરકાર, આથી, ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭, વધુ સુધારવા નીચેના નિયમો કરે છે:-

૧. ટૂંકી સંજ્ઞા અને આરંભ:

(૧) આ નિયમો ગુજરાત માલ અને સેવા વેરા (ચતુર્થ સુધારા) નિયમો, ૨૦૨૧ કહેવાશે.

(૨) આ નિયમો સન ૨૦૨૧ના મે મહિનાની ૧૮મી તારીખથી અમલમાં આવ્યા હોવાનું ગણાશે.

૨. ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭માં,-

(૧) નિયમ ૨૩માં, પેટા-નિયમ (૧)માં, “૨૬ કર્યાનો હુકમ બજાવ્યાની તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર” એ શબ્દો પછી “અથવા કલમ ૩૦ની પેટા-કલમ (૧)ના પરંતુક હેઠળ આપેલી સત્તાની રૂએ, નાયબ કમિશનર અથવા યથાપ્રસંગ, સંયુક્ત કમિશનર દ્વારા લંબાવેલા સમયગાળાની અંદર” એ શબ્દો દાખલ કરવા;

(૨) નિયમ ૮૦માં,-

(ક) પેટા-નિયમ (૩)માં, નીચેનો પરંતુક દાખલ કરવો,-

“પરંતુ નમૂના જીએસટી આરએફડી-૦૧માં રિફંડનો દાવો દાખલ કર્યાની તારીખથી, યોગ્ય અધિકારીએ નમૂના જીએસટી આરએફડી-૦૩ માં ખામીઓની જાણ કર્યાની તારીખ સુધીના સમયગાળાને, ખામીઓના સુધારા પછી અરજદારે દાખલ કરેલ રિફંડના એવા કોઈપણ નવા દાવાના સંબંધમાં, કલમ ૫૪ની પેટા-કલમ (૧) હેઠળ નિર્દિષ્ટ કર્યા મુજબની બે વર્ષની મુદતમાંથી બાકાત રાખવો જોઈશે.”;

(ખ) પેટા-નિયમ (૪) પછી, નીચેના પેટા-નિયમો દાખલ કરવા:-

“(પ) અરજદાર, નમૂના જીએસટી આરએફડી-૦૧માં દાખલ કરેલી રિફંડની અરજના સંબંધમાં, નમૂના જીએસટી આરએફડી-૦૪ માં રિફંડ મંજૂર કરતો કામચલાઉ હુકમ અથવા નમૂના જીએસટી આરએફડી-૦૬માં રિફંડ મંજૂર કરતો આખરી હુકમ અથવા નમૂના જીએસટી આરએફડી-૦૫ માં ચૂકવણીનો હુકમ અથવા નમૂના જીએસટી આરએફડી-૦૭માં રિફંડ અટકાવવાનો હુકમ અથવા નમૂના જીએસટી આરએફડી-૦૮માં નોટિસ આપે તે પહેલાં, નમૂના જીએસટી આરએફડી-૦૧૩બલ્યુ માં અરજ દાખલ કરીને રિફંડ માટેની સદરહુ અરજ પાછી ખેંચી શકશે.

(દ) નમૂના જીએસટી આરએફડી-૦૧માં રિફંડ માટેની અરજ દાખલ કરતી વખતે ઇલેક્ટ્રોનિક જમા ખાતાવહી અથવા યથાપ્રસંગ, ઇલેક્ટ્રોનિક રોકડ ખાતાવહીમાંથી અરજદાર દ્વારા ઉધારેલ કોઈપણ રકમ, નમૂના જીએસટી આરએફડી-૦૧૩બલ્યુ માં રિફંડની અરજ પાછી ખેંચવા માટેની અરજ રજૂ કર્યે, તેવી રકમ જે ખાતાવહીમાંથી ઉધારેલ હોય તે ખાતાવહીમાં પરત જમા થશે.”.

(૩) નિયમ ૮૨ માં,-

(ક) પેટા-નિયમ (૧)માં, પરંતુક કમી કરવો;

(ખ) પેટા-નિયમ (૨)માં,-

(૧) “ભાગ-ખ” એ શબ્દ અને અક્ષરને બદલે, “ભાગ-ક” એ શબ્દ અને અક્ષર મૂકવા;

(૨) નીચેનો પરંતુક દાખલ કરવો:-

“પરંતુ યોગ્ય અધિકારી અથવા કમિશનરને ખાતરી થાય છે કે રિફંડ હવે અટકાવવા પાત્ર નથી, ત્યારે તે નમૂના જીએસટી આરએફડી-૦૭ ના ભાગ-ખ માં અટકાવેલ રિફંડ મુક્ત કરવા માટેનો હુકમ પસાર કરી શકશે.”;

(૪) નિયમ ૯૬માં,

(ક) પેટા-નિયમ (૬)માં, “ભાગ-ખ” એ શબ્દ અને અક્ષરને બદલે, “ભાગ-ક” એ શબ્દ અને અક્ષર મૂકવા;

(ખ) પેટા-નિયમ (૭)માં, “નમૂના જીએસટી આરએફડી-૦૬માં હુકમ કર્યા પછી” એ શબ્દો, અક્ષરો અને આંકડાને બદલે, “નમૂના જીએસટી આરએફડી-૦૭ના ભાગ-ખ માં અટકાવેલ રિફંડને મુક્ત કરવા માટેનો હુકમ કર્યા પછી, “નમૂના જીએસટી આરએફડી-૦૬માં હુકમ કરીને” એ શબ્દો, અક્ષરો અને આંકડા મૂકવા;

(૫) નમૂના જીએસટી આરએફડી-૨૧માં, પેટા-શીર્ષક “૨૬ કરેલું રજિસ્ટ્રેશન રદબાતલ કરવા માટેની અરજી રજૂ કરવા માટેની સૂચનાઓ” હેઠળ, પહેલાં બુલેટ પોઇન્ટમાં “રજિસ્ટ્રેશન રદ કર્યાના હુકમની બજવણીની તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર” એ શબ્દો પછી, “અથવા કલમ ૩૦ની પેટા-કલમ (૧)ના પરંતુક હેઠળ આપેલી સત્તાની રૂએ, નાયબ કમિશનર અથવા યથાપ્રસંગ, સંયુક્ત કમિશનર દ્વારા લંબાવેલા સમયગાળાની અંદર” એ શબ્દો અને આંકડા દાખલ કરવા;

(૬) નિયમ ૧૩૮માં, “રજિસ્ટર થયેલ વ્યક્તિના સંબંધમાં, પુરવઠાકાર અથવા પુરવઠો મેળવનાર તરીકે, ફોર્મ (નમૂનો) જીએસટી ઈડબ્લ્યુબી-૦૧ના ભાગ ક-માં માહિતી પૂરી પાડવાની પરવાનગી આપવામાં આવશે નહિ, કે જેણે” એ શબ્દો, કૌંસ, આંકડા અને અક્ષરને બદલે, “રજિસ્ટર થયેલ વ્યક્તિના માલની કોઈપણ જાવકની હેરફેરના સંબંધમાં, ફોર્મ (નમૂનો) જીએસટી ઈડબ્લ્યુબી-૦૧ના ભાગ-ક-માં માહિતી પૂરી પાડવાની પરવાનગી આપવામાં આવશે નહિ, કે જેણે” એ શબ્દો, કૌંસ, આંકડા અને અક્ષર મૂકવા.

(૭) નમૂનો-જીએસટી-આરએફડી-૦૭ ને બદલે, નીચેનો નમૂનો મૂકવો:-

નમૂનો-જીએસટી-આરએફડી-૦૭

[જુઓ નિયમો ૯૨(૨) અને ૯૬(૬)]

સંદર્ભ ક્રમાંક.

તારીખ: <DD/MM/YYYY>

પ્રતિ

----- (જીએસટીઆઈએન/ વિશિષ્ટ ઓળખ નંબર /કામચલાઉ ઓળખ નંબર)

----- (નામ)

----- (સરનામું)

----- (એઆરએન)

ભાગ-ક

રિફંડ અટકાવી રાખવા માટેનો હુકમ

ઉપર નિર્દિષ્ટ કરેલ એઆરએન(ARN) ના સંબંધમાં વેરાદાતાને ચૂકવવાપાત્ર રિફંડ, જીએસટી અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૫૪ની પેટા-કલમ (૧૦)/(૧૧) ની જોગવાઈઓ અનુસાર આથી અટકાવવામાં આવેલ છે. અટકાવવા માટેના કારણો નીચે મુજબ આપેલ છે:

અનુક્રમાંક	વિગતો	
૧	એઆરએન	
૨	આરએફડી-૦૧માં દાવો કરેલ રકમ <ઓટો પોપ્યુલેટેડ>	
૩	આરએફડી-૦૬માં અગ્રાહ્ય રકમ <ઓટો પોપ્યુલેટેડ>	
૪	આરએફડી-૦૬માં સરભર કરેલી રકમ <ઓટો પોપ્યુલેટેડ>	
૫	અટકાવેલી રકમ	
૬	અટકાવવા માટેના કારણો (એક કરતા વધુ કારણો પસંદ કરી શકાશે)	<ul style="list-style-type: none"> ○ વસૂલવાપાત્ર બાકી રકમ ચૂકવેલ નથી ○ કલમ ૫૪ની પેટા-કલમ ૧૧ના મુજબ ○ ગંભીર પ્રકારની છેતરપિંડી/છેતરપિંડીઓ ના કારણે ○ અન્ય, (નિર્દિષ્ટ કરવું)
૭	કારણોનું વર્ણન	(૫૦૦ અક્ષરો સુધી, વિગતવાર કારણો માટે અલગથી ફાઇલ જોડી શકાશે)
૮	રૂબરૂ સુનાવણીનો રેકર્ડ	(૫૦૦ અક્ષરો સુધી, વિગતવાર રેકર્ડ માટે અલગથી ફાઇલ જોડી શકાશે)

ભાગ-ખ

અટકાવેલ રિફંડને મુક્ત કરવા માટેનો હુકમ

તારીખ: <તારીખ>ની આપની રિફંડ અરજી <એઆરએન>ના સંદર્ભમાં કે જેની સામે તારીખ: <તારીખ>ના હુકમ <આરએફડી-૦૬ હુકમ ક્રમાંક> થી મંજૂર કરેલ રિફંડ રકમની ચૂકવણી તારીખ: <તારીખ>ના આ કચેરીના હુકમ <હુકમ સંદર્ભ ક્રમાંક>થી અટકાવવામાં આવી હતી. મને હવે ખાતરી થઈ છે કે રિફંડ અટકાવી રાખવા માટેની સ્થિતિ હવે વિદ્યમાન નથી અને તેથી, અટકાવી રાખેલ રિફંડની રકમને, આથી, નીચે મુજબ મુક્ત કરવાની પરવાનગી આપવામાં આવે છે.

અનુક્રમાંક	વિગતો	
૧	એઆરએન	
૨	આરએફડી-૦૧માં દાવો કરેલ રકમ	<ઓટો-પોપ્યુલેટેડ>
૩	આરએફડી-૦૬માં અગ્રાહ્ય રકમ	<ઓટો-પોપ્યુલેટેડ>
૪	આરએફડી-૦૬માં સરભર કરેલી રકમ	<ઓટો-પોપ્યુલેટેડ>
૫	આરએફડી-૦૭ ક-માં અટકાવેલી રકમ	<ઓટો-પોપ્યુલેટેડ>
૬	મુક્ત કરેલી રકમ	
૭	ચૂકવવાની રકમ	

તારીખ:

સહી (ડીએસસી):

સ્થળ:

નામ:

હોદ્દો:

કચેરીનું સરનામું:"

(૮) નમૂનો-જીએસટી-આરએફડી-૦૧-ખ પછી, નીચેનો નમૂનો દાખલ કરવો:-

“નમૂનો-જીએસટી-આરએફડી-૦૧-ડબલ્યું

[જુઓ નિયમ ૯૦(૫)]

રિફંડની અરજી પાછી ખેંચવા માટેની અરજી

૧. એઆરએન:
૨. જીએસટીઆઈએન:
૩. વ્યવસાયનું નામ (કાનૂની):
૪. વેપારનું નામ, કોઈ હોય, તો:
૫. વેરા મુદત:
૬. દાવો કરેલ રિફંડની રકમ:
૭. રિફંડનો દાવો પાછો ખેંચવા માટેના આધાર:
 ૧. ભૂલથી રિફંડ અરજી ફાઇલ કરેલી
 ૨. ખોટી કક્ષા હેઠળ રિફંડ અરજી ફાઇલ કરેલી
 ૩. રિફંડ અરજીમાં ખોટી વિગતો દર્શાવેલી
 ૪. અન્ય (નિર્દિષ્ટ કરવા વિનંતી)
૮. એકરાર: હું/ અમે, <વેરાદાતાનું નામ>, આથી, ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરીએ છીએ અને જાહેર કરીએ છીએ કે અહીં ઉપર આપેલી વિગતો મારી/ અમારી જાણકારી અને માન્યતા મુજબ સાચી અને ખરી છે અને તેમાં કોઈ વિગત છુપાવવામાં આવી નથી.

સ્થળ:

અધિકૃત સહી કરનારની સહી

તારીખ:

નામ

હોદ્દો/ પદ”.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,

સરકારના નાયબ સચિવ.



Extra No. 165



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

MONDAY, JULY 12, 2021 / ASADHA 21, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૮મી જુલાઈ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૨૭ જૂન, ૨૦૨૧ના સરકારી જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૨૭એ)-જીએસટી-૨૦૨૧/એસ.૮(૧)(૩૪)-૬.- નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

Notification**Regarding****Amendment to the Government Notification, Finance Department No. (GHN-31)GST-2017/S.9(1)(1)-TH****Dated the 30th June, 2017, Notification No.1/2017-State Tax (Rate).**

નાણા વિભાગનું તારીખ: ૩૦મી જૂન, ૨૦૧૭નું સરકારી જાહેરનામું

ક્રમાંક: (જીએચએન-૩૧) જીએસટી-૨૦૧૭/એસ.૯(૧)(૧)-૬, જાહેરનામું ક્રમાંક. ૧/૨૦૧૭-રાજ્ય વેરો (દર) સુધારવા સંબંધી

જાહેરનામું

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૭ જૂન, ૨૦૨૧.

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક.(જીએચએન-૨૭એ) જીએસટી-૨૦૨૧/એસ.૯(૧)(૩૪)૬:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા)ની કલમ ૯ની પેટા-કલમ (૧) અને કલમ ૧૫-ની પેટા-કલમ (૫)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોને આધારે, આથી, ગુજરાત સરકારના, નાણા વિભાગના, તારીખ: ૩૦મી જૂન, ૨૦૧૭ના જાહેરનામા ક્રમાંક. (જીએચએન-૩૧) જીએસટી-૨૦૧૭/એસ.૯(૧) (૧)-૬, જાહેરનામા ક્રમાંક. ૧/૨૦૧૭-રાજ્ય વેરો (દર)માં નીચે પ્રમાણે વધુ સુધારા કરે છે:-

સદરહુ જાહેરનામામાં,-

- (ક) અનુસૂચિ ૧-૨.૫% માં, અનુક્રમાંક ૨૫૯-ક સામે, કોલમ (૨)માંની નોંધને બદલે, નોંધ "૯૫૦૩" મૂકવી;
- (ખ) અનુસૂચિ ૧ પછી, યાદી ૧માં, અનુક્રમાંક ૨૩૦ અને તેને સંબંધિત નોંધો પછી, નીચેનો મજકૂર દાખલ કરવો-
"૨૩૧) ડાયથાઈલકાર્બોમેઝાઈન".

૨. આ જાહેરનામું સન ૨૦૨૧ના જૂન મહિનાની ૨-જી તારીખથી અમલમાં આવશે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.



Extra No. 198



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII | TUESDAY, AUGUST 3, 2021 / SRAVANA 12, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૮મી જુલાઈ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૯મી જૂન, ૨૦૨૧ના જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૩૨)/જીએસટી-૨૦૨૧/એસ.૧૬૮૬ (૧૧)૬.- નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

NOTIFICATION

Regarding

Amendment to the notification of the Government of Gujarat, Finance Department, No. (GHN-26) GST-2021/S.168A(10)-TH, Dated the 17th May, 2021, Notification No.14/2021-State Tax.

ગુજરાત સરકારના નાણા વિભાગનું તારીખ: ૧૭મી મે, ૨૦૨૧નું જાહેરનામું

ક્રમાંક: (જીએચએન-૨૬)જીએસટી-૨૦૨૧/એસ.૧૬૮૬(૧૦)-૬, જાહેરનામું ક્રમાંક. ૧૪/૨૦૨૧-રાજ્ય વેરો સુધારવા સંબંધી

જાહેરનામું

નાણા વિભાગ,

સચિવાલય, ગાંધીનગર, ૮મી જૂન, ૨૦૨૧.

જાહેરનામું ક્રમાંક. ૨૪/૨૦૨૧-રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક: (જીએચએન-૩૨) જીએસટી-૨૦૨૧/એસ.૧૬૮૬ (૧૧)૬:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા/જેનો આ જાહેરનામામાં હવે પછી, “સદરહુ અધિનિયમ” તરીકે ઉલ્લેખ કર્યો છે તે)ની કલમ ૧૬૮ ક-થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોના આધારે, આથી, તારીખ: ૧૭મી મે, ૨૦૨૧ના નાણા વિભાગના સરકારી જાહેરનામા ક્રમાંક.(જીએચએન-૨૬)જીએસટી-૨૦૨૧/એસ.૧૬૮૬(૧૦)-૬, જાહેરનામા ક્રમાંક. ૧૪/૨૦૨૧-રાજ્ય વેરો-માં, નીચે પ્રમાણે સુધારા કરે છે:-

સદરહુ જાહેરનામાં, પ્રથમ પરિચ્છેદમાં,-

(૧) ખંડ (૧),-

ક. “સન ૨૦૨૧ના મે મહિનાની ૩૦મી તારીખ” એ આંકડા, અક્ષરો અને શબ્દોને બદલે, “સન ૨૦૨૧ના જૂન મહિનાની ૨૮મી તારીખ” એ આંકડા, અક્ષરો અને શબ્દો મૂકવા;

ખ. “સન ૨૦૨૧ના મે મહિનાની ૩૧મી તારીખ” એ આંકડા, અક્ષરો અને શબ્દોને બદલે, “સન ૨૦૨૧ના જૂન મહિનાની ૩૦મી તારીખ” એ આંકડા, અક્ષરો અને શબ્દો મૂકવા;

(૨) ખંડ (૧)ના પરંતુકમાં,-

ક. “સન ૨૦૨૧ના મે મહિનાની ૩૧મી તારીખ” એ આંકડા, અક્ષરો અને શબ્દોને બદલે, “સન ૨૦૨૧ના જૂન મહિનાની ૩૦મી તારીખ” એ આંકડા, અક્ષરો અને શબ્દો મૂકવા;

ખ. “સન ૨૦૨૧ના જૂન મહિનાની ૧૫મી તારીખ” એ આંકડા, અક્ષરો અને શબ્દોને બદલે, “સન ૨૦૨૧ના જુલાઈ મહિનાની ૧૫મી તારીખ” એ આંકડા, અક્ષરો અને શબ્દો મૂકવા;

(૩) ખંડ (૨)માં,-

ક. “સન ૨૦૨૧ના મે મહિનાની ૩૦મી તારીખ” એ આંકડા, અક્ષરો અને શબ્દોને બદલે, “સન ૨૦૨૧ના જૂન મહિનાની ૨૮મી તારીખ” એ આંકડા, અક્ષરો અને શબ્દો મૂકવા;

ખ. “સન ૨૦૨૧ના મે મહિનાની ૩૧મી તારીખ” એ આંકડા, અક્ષરો અને શબ્દોને બદલે, “સન ૨૦૨૧ની જૂન મહિનાની ૩૦મી તારીખ” એ આંકડા, અક્ષરો અને શબ્દો મૂકવા.

૨. આ જાહેરનામું સન ૨૦૨૧ના મે મહિનાની ૩૦મી તારીખથી અમલમાં આવ્યું હોવાનું ગણાશે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.



Extra No. 149



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

MONDAY, JULY 5, 2021 / ASADHA 14, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, પમી જુલાઈ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગ-ના તારીખ: ૯મી જૂન, ૨૦૨૧ના જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૩૫) જીએસટી-૨૦૨૧/એસ.૧૨૮(૩૦)-૬.- નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

NOTIFICATION

Regarding

AMENDMENT TO THE NOTIFICATION OF THE GOVERNMENT OF GUJARAT,
FINANCE DEPARTMENT, NO. (GHN-8)/ GST-2018/S.128(5)-TH, DATED THE 23RD JANUARY, 2018,
NOTIFICATION NO.4/2018-STATE TAX.

ગુજરાત સરકારના નાણા વિભાગનું તારીખ: ૨૩મી જાન્યુઆરી, ૨૦૧૮નું જાહેરનામું
ક્રમાંક: (જીએચએન-૮)/ જીએસટી-૨૦૧૮/એસ.૧૨૮(૫)-૬, જાહેરનામું ક્રમાંક. ૪/૨૦૧૮-રાજ્ય વેરો સુધારવા સંબંધી
જાહેરનામું.

નાણા વિભાગ,

સચિવાલય, ગાંધીનગર, ૯મી જૂન, ૨૦૨૧.

જાહેરનામું ક્રમાંક. ૨૦/૨૦૨૧-રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક: (જીએચએન-૩૫)જીએસટી-૨૦૨૧/એસ.૧૨૮(૩૦)-૬ :- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા) (જેનો આ જાહેરનામામાં હવે પછી સદરહુ અધિનિયમ તરીકે ઉલ્લેખ કર્યો છે તે)ની કલમ ૧૨૮થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોના આધારે, આથી, ગુજરાત સરકારના નાણા વિભાગનું જાહેરનામું ક્રમાંક. ૪/૨૦૧૮-રાજ્ય વેરા એટલે કે તારીખ: ૨૩મી જાન્યુઆરી, ૨૦૧૮ના જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૮)/ જીએસટી-૨૦૧૮/એસ.૧૨૮(૫)-૬.માં, નીચેના વધુ સુધારા કરે છે:-

સદરહુ જાહેરનામામાં, ચોથા પરંતુક પછી, નીચેનો પરંતુક દાખલ કરવો:-

“વળી વધુમાં, નિયત તારીખ સુધીમાં, નમૂના જીએસટીઆર-૧માં જાવક પુરવઠાની વિગતો રજૂ કરવામાં ચૂક કરેલી હોય તેવા, સદરહુ કોષ્ટકની કોલમ (૨)ની તત્સમાન નોંધમાં નિર્દિષ્ટ કરેલ રજિસ્ટર થયેલ વ્યક્તિઓના વર્ગ માટે, જૂન, ૨૦૨૧ પછીની વેરા મુદત અથવા યથાપ્રસંગ, જૂન, ૨૦૨૧-એ પૂરા થતા ત્રિમાસ પછી માટે, નીચે દર્શાવેલ કોષ્ટકની કોલમ (૩)માં ઉલ્લેખેલ રકમથી વધુ હોય તેટલી, સદરહુ અધિનિયમની કલમ ૪૭ હેઠળ ચૂકવવાપાત્ર વિલંબની ફીની કુલ રકમ માફ કરવામાં આવશે.

કોષ્ટક

અનુક્રમાંક (૧)	રજિસ્ટર થયેલ વ્યક્તિઓનો વર્ગ (૨)	રકમ (૩)
૧.	વેરા મુદતમાં કોઈપણ જાવક પુરવઠો ન હોય તેવી રજિસ્ટર થયેલ વ્યક્તિઓ	બસો પચાસ રૂપિયા
૨.	અનુક્રમાંક ૧ હેઠળ આવતા હોય તે સિવાય, અગાઉના નાણાકીય વર્ષમાં રૂપિયા ૧.૫ કરોડ સુધી એકંદર ટર્નઓવર ધરાવતી રજિસ્ટર થયેલ વ્યક્તિઓ	એક હજાર રૂપિયા
૩.	અનુક્રમાંક ૧ હેઠળ આવતા હોય તે સિવાય, અગાઉના નાણાકીય વર્ષમાં રૂપિયા ૧.૫ કરોડથી વધુ અને રૂપિયા ૫ કરોડ સુધી એકંદર ટર્નઓવર ધરાવતી રજિસ્ટર થયેલ વ્યક્તિઓ	બે હજાર પાંચસો રૂપિયા”.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.



Extra No. 145



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

MONDAY, JULY 5, 2021 / ASADHA 14, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૫મી જુલાઈ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૯મી જૂન, ૨૦૨૧ના સરકારી જાહેરનામા ક્રમાંક: (જાએચએન-૩૬) જાએસટી-૨૦૨૧/એસ.૧૨૮(૩૧)૬- નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

Notification**regarding**

**Amendment to the Government Notification, Finance Department,
No. (GHN-141) GST-2017/ S.128 (4)-TH, Dated 29th December, 2017.**

નાણા વિભાગનું તારીખ: ૨૯મી ડિસેમ્બર, ૨૦૧૭નું સરકારી જાહેરનામું ક્રમાંક.

(જીએચએન-૧૪૧) જીએસટી-૨૦૧૭/ એસ.૧૨૮(૪)-ઠ. સુધારવા સંબંધી

જાહેરનામું.

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૯મી જૂન, ૨૦૨૧.

જાહેરનામું ક્રમાંક: ૨૧/૨૦૨૧-રાજ્ય વેરો (૬૨)

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક: (જીએચએન-૩૬) જીએસટી-૨૦૨૧/એસ.૧૨૮(૩૧)-ઠ:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા) (જેનો આ જાહેરનામામાં હવે પછી સદરહુ અધિનિયમ તરીકે ઉલ્લેખ કર્યો છે તે) ની કલમ ૧૨૮થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોને આધારે, આથી, નાણા વિભાગનું તારીખ: ૨૯મી ડિસેમ્બર, ૨૦૧૭નું સરકારી જાહેરનામું ક્રમાંક: (જીએચએન-૧૪૧) જીએસટી-૨૦૧૭/એસ.૧૨૮(૪)-ઠ, જાહેરનામા ક્રમાંક. ૭૩/૨૦૧૭-રાજ્ય વેરા-માં, નીચેના વધુ સુધારા કરે છે.

સદરહુ જાહેરનામામાં, ત્રીજા પરંતુક પછી, નીચેનો પરંતુક દાખલ કરવાનો રહેશે:-

“વળી, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ પછીના વર્ષો માટે નિયત તારીખ સુધી, નમૂના જીએસટીઆર-૪ માં પત્રક રજૂ કરવામાં ચૂક કરી હોય તેવી રજિસ્ટર થયેલી વ્યક્તિઓએ,

(૧) સદરહુ પત્રકમાં ચૂકવવાપાત્ર રાજ્ય વેરાની કુલ રકમ નીલ(Nil) હોય ત્યારે બસો પચાસ રૂપિયાથી વધુ હોય;

(૨) ખંડ (૧) હેઠળ આવતા હોય તે સિવાયના રજિસ્ટર થયેલા વ્યક્તિઓ માટે એક હજાર રૂપિયાથી વધુ હોય

- તેટલી સદરહુ અધિનિયમની કલમ ૪૭ હેઠળ ચૂકવવાપાત્ર વિલંબ ફીની કુલ રકમ માફ કરવામાં આવશે.”

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલિપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.



Extra No. 227



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII | THURSDAY, AUGUST 26, 2021 / BHADRA 4, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૬મી ઓગસ્ટ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણાં વિભાગના તારીખ: ૯મી જૂન, ૨૦૨૧ના સરકારી જાહેરનામા ક્રમાંક: (જાએચએન-૩૮) જાએસટી-૨૦૨૧/એસ.૯૬(૩)૬-નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

NOTIFICATION

Regarding

Amendment to the Notification of the Government of Gujarat, Finance Department,

No. (GHN-58) GST-2017/S.96(1)-TH, Dated the 12th July, 2017

ગુજરાત સરકારના, નાણા વિભાગનું તારીખ: ૧૨મી જુલાઈ, ૨૦૧૭નું જાહેરનામું

ક્રમાંક: (જીએચએન-૫૮) જીએસટી-૨૦૧૭/એસ.૯૬(૧)-ઠ. સુધારવા સંબંધી

જાહેરનામું

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૯મી જૂન, ૨૦૨૧

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક: (જીએચએન-૩૮)જીએસટી-૨૦૨૧/એસ.૯૬(૩)ઠ:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા)ની કલમ ૯૬થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, ગુજરાત સરકારના નાણા વિભાગનું તારીખ: ૧૨મી જુલાઈ, ૨૦૧૭નું જાહેરનામું ક્રમાંક: (જીએચએન-૫૮) જીએસટી-૨૦૧૭/એસ.૯૬(૧)-ઠ., નીચે પ્રમાણે સુધારે છે:-

સદરહુ જાહેરનામામાં, વિદ્યમાન નોંધો (૧) અને (૨)ને બદલે, નીચેની નોંધો મૂકવી:-

“(૧) કેન્દ્ર સરકારે નામનિયુક્ત કર્યા પ્રમાણેના કેન્દ્રીય વેરા અધિક કમિશનર અથવા સંયુક્ત કમિશનર; અને

(૨) રાજ્ય વેરા સંયુક્ત કમિશનર (કાયદા).”.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.



Extra No. 180



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

FRIDAY, JULY 16, 2021 / ASADHA 25, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૬મી જુલાઈ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૧૪મી જૂન, ૨૦૨૧-ના જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૪૧) જીએસટી-૨૦૨૧/એસ.૧૧(૧)(૫૪)-૬-નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

NOTIFICATION

Under

The Gujarat Goods and Services Tax Act, 2017

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ હેઠળ

જાહેરનામું.

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૪મી જૂન, ૨૦૨૧

જાહેરનામું ક્રમાંક. ૫/૨૦૨૧-રાજ્ય વેરો (દર)

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક: (જીએચએન-૪૧) જીએસટી-૨૦૨૧/ એસ.૧૧(૧)(૫૪)-ઠ:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા) (જેનો આ જાહેરનામામાં હવે પછી, "સદરહુ અધિનિયમ" તરીકે ઉલ્લેખ કર્યો છે તે)ની કલમ ૧૧ની પેટા-કલમ (૧)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, જાહેર હિતમાં તેમ કરવું જરૂરી છે તેવી પોતાને ખાતરી થયેથી, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોને આધારે, આથી, જેનું વર્ણન નીચેના કોષ્ટકના કોલમ (૩)માં નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે તેવા અને નીચેના કોષ્ટકમાં કોલમ (૨)માંની તત્સમાન નોંધમાં, કસ્ટમ્સ ટેરિફ અધિનિયમ, ૧૯૭૫ (સન ૧૯૭૫ના ૫૧મા)ની પહેલી અનુસૂચિમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે ટેરિફની બાબત, પેટા-શીર્ષક, શીર્ષક અથવા યથાપ્રસંગ, પ્રકરણ હેઠળ આવતા માલ ઉપર, કોલમ (૪)માંની તત્સમાન નોંધમાં નિર્દિષ્ટ રકમ કરતા વધુ હોય તેટલા, સદરહુ અધિનિયમની કલમ ૯ હેઠળ લેવાપાત્ર રાજ્ય વેરામાંથી મુક્તિ આપે છે :-

કોષ્ટક

અનુક્રમાંક	પ્રકરણ, શીર્ષક, પેટા-શીર્ષક, ટેરિફની બાબત	માલનું વર્ણન	દર
(૧)	(૨)	(૩)	(૪)
૧	૨૮૦૪	મેડિકલ ગ્રેડ ઓક્સિજન	૨.૫%
૨	૩૦	ટોસિલીગુમેબ	શૂન્ય
૩	૩૦	એમ્ફોટેરિસીન બી	શૂન્ય
૪	૩૦	રેમડેસિવીર	૨.૫%
૫	૩૦	હિપેરિન (એન્ટિ-કોગ્યુલેન્ટ)	૨.૫%
૬	૩૦૦૨ અથવા ૩૮૨૨	કોવિડ-૧૯ ટેસ્ટિંગ કિટ્સ	૨.૫%
૭	૩૦૦૨ અથવા ૩૮૨૨	ઇન્ફલેમેટરી ડાયગ્નોસ્ટિક્સ (માર્કર) કિટ્સ, જેમ કે- આઈએલ૬, ડી-ડાઈમર, સીઆરપી (સી-રીએક્ટિવ પ્રોટીન), એલડીએચ (લેક્ટેટ ડી-હાઇડ્રોજનેઝ, ફેરીટીન, પ્રોકેલ્સિટોનીન (પીસીટી) અને બ્લડ ગેસ રીએજન્ટ્સ.	૨.૫%
૮	૩૮૦૪ ૯૪	હેન્ડ સેનિટાઇઝર	૨.૫%
૯	૬૫૦૬ ૯૯ ૦૦	નોન-ઇન્વેસિવ વેન્ટિલેશન સાથે ઉપયોગ માટેના હેલ્મેટ	૨.૫%
૧૦	૮૪૧૭ અથવા ૮૫૧૪	સ્મશાન માટે ગેસ/ ઇલેક્ટ્રિક/ અન્ય ભઠ્ઠીઓ	૨.૫%
૧૧	૯૦૧૮ ૧૯ અથવા ૯૮૦૪	પલ્સ ઓક્સિમીટર	૨.૫%
૧૨	૯૦૧૮	હાઈ ફ્લો નેઝલ કેન્યુલા ડિવાઇસ	૨.૫%
૧૩	૯૦૧૯ ૨૦ અથવા ૯૮૦૪	ઓક્સિજન કન્સન્ટ્રેટર/ જનરેટર	૨.૫%
૧૪	૯૦૧૮ અથવા ૯૦૧૯	વેન્ટિલેટર	૨.૫%
૧૫	૯૦૧૯	બાઇપેપ (BiPAP) મશીન	૨.૫%
૧૬	૯૦૧૯	(૧) આઈસીયુ વેન્ટિલેટર માટે નોન-ઇન્વેસિવ વેન્ટિલેશન નેઝલ અથવા ઓરોનેઝલ માસ્ક્સ (૨) વેન્ટિલેટરો સાથે ઉપયોગમાં લેવાની કેન્યુલા	૨.૫%
૧૭	૯૦૨૫	તાપમાન માપવાના સાધનો	૨.૫%
૧૮	૯૭૦૨ અથવા ૯૭૦૩	એમ્બ્યુલન્સ	૬%

૨. આ જાહેરનામું સન ૨૦૨૧ના સપ્ટેમ્બર મહિનાની ૩૦મી તારીખ સહિત અને તે તારીખ સુધી અમલમાં રહેશે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

વિજય સંગાડીયા,

સરકારના સેક્શન અધિકારી.



Extra No. 192



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII]

THURSDAY, JULY 29, 2021 / SRAVANA 7, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૮મી જુલાઈ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૨૩મી જૂન, ૨૦૨૧ના શુદ્ધિપત્ર ક્રમાંક: (જીએચએન-૪૨)જીએસટી-૨૦૨૧/એસ.૧૧(૧)(૫૫) ઠ. -નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

Corrigendum*to*

**The Notification of Government of Gujarat, Finance Department,
No.(GHN-41) GST-2021/S.11(1)(54)-TH dated the 14th June, 2021,
Notification No.5/2021-State Tax (Rate).**

ગુજરાત સરકાર, નાણા વિભાગનું તારીખ: ૧૪મી જૂન, ૨૦૨૧નું જાહેરનામું
ક્રમાંક.(જીએચએન-૪૧) જીએસટી-૨૦૨૧/એસ.૧૧(૫૪)-ઠ.
જાહેરનામું ક્રમાંક.૫/૨૦૨૧-રાજ્ય વેરો (દર)નું

શુદ્ધિપત્ર

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૩મી જૂન, ૨૦૨૧

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક.(જીએચએન-૪૨)જીએસટી-૨૦૨૧/એસ.૧૧(૧) (૫૫) ઠ:- ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૧૪મી જૂન, ૨૦૨૧ના જાહેરનામા ક્રમાંક.(જીએચએન-૪૧) જીએસટી-૨૦૨૧/એસ.૧૧(૧)(૫૪)-ઠ, જાહેરનામું ક્રમાંક.૫/૨૦૨૧-રાજ્ય વેરો (દર)-માં, કોષ્ટકમાં, અનુક્રમાંક ૮ની સામે, કોલમ (૨)માં, "૩૮૦૪ ૯૪" ને બદલે, "૩૮૦૮ ૯૪" વાંચવું.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.



Extra No. 196



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII] TUESDAY, AUGUST 3, 2021 / SRAVANA 12, 1943#

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

वैधानिक अने संसदीय भाषतोनी वल्लाग

सचलवलल, गलंधीनगर, २६मी जूललरु, २०२१

गुजरात गेलेटमां अंग्रेजमां प्रसलद थयेला गुजरात सरकारना नलषा वलल्लागना तारीख: २७ जूललरु, २०२१-ना जलडेरनामा
कमांक: (जअेयअेन-४५) जअेसटी-२०२१/अेस.१(१४)६.-नो गुजराती अनुवाद आथी सर्व लोकोनी जलषा सारु प्रसलद करुं ऐ.

वी. अेन. शेख,
सरकारना नलयख सचलव.

NOTIFICATION

*Under***The Gujarat Goods and Services Tax Act, 2017**

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ હેઠળ

જાહેરનામું

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૭ જુલાઈ, ૨૦૨૧

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક: (જીએચએન-૪૫) જીએસટી-૨૦૨૧/ એસ.૧(૧૪)-૬:- ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) અધિનિયમ, ૨૦૧૮ (સન ૨૦૧૮ના ગુજરાતના ૨૮મા) ની કલમ ૧ની પેટા-કલમ (૨)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી જે તારીખે સદરહુ અધિનિયમની કલમ ૧૩ની જોગવાઈઓ અમલમાં આવશે તે તારીખ તરીકે સન ૨૦૧૮ના ડિસેમ્બર મહિનાની ૧૭મી તારીખ નક્કી કરે છે અને તે જ તારીખ નક્કી કર્યું હોવાનું ગણાશે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.

Extra No. 208



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII | THURSDAY, AUGUST 5, 2021 / SRAVANA 14, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૫મી ઓગસ્ટ, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૯મી જુલાઈ, ૨૦૨૧ના જાહેરનામા ક્રમાંક: (જાએચએન-૪૮)/જાએસટી-૨૦૨૧/એસ.૧૨૮(૩૩)-ઠ. નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

Notification

Under

The Gujarat Goods and Services Tax Act, 2017

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ હેઠળ

જાહેરનામું

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૮ મી જુલાઈ, ૨૦૨૧

જાહેરનામું ક્રમાંક. ૨૮/૨૦૨૧-રાજ્ય વેરો

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક: (જીએચએન-૪૮)/જીએસટી-૨૦૨૧/એસ.૧૨૮(૩૩)-ઠ:- ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫) (જેનો આ જાહેરનામામાં હવે પછી, સદરહુ અધિનિયમ તરીકે ઉલ્લેખ કર્યો છે તે)ની કલમ ૧૨૮-થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, માલ અને સેવા વેરા કાઉન્સિલની ભલામણોના આધારે, અને તારીખ: ૧૭મી ડિસેમ્બર, ૨૦૨૦-નું ગુજરાત સરકારના નાણા વિભાગનું જાહેરનામું ક્રમાંક: (જીએચએન-૧૧૫) જીએસટી-૨૦૨૦/એસ.૧૨૮ (૨૬)-ઠ, જાહેરનામું ક્રમાંક. ૮૮/૨૦૨૦-રાજ્ય વેરો રદ કરીને, એવી રીતે રદ કરતા પહેલા કરેલી અથવા કરવાની પડતી મૂકેલી અમુક બાબતોના સંબંધમાં હોય તે સિવાય, ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૨૭મી માર્ચ, ૨૦૨૦-ના જાહેરનામા ક્રમાંક: (જીએચએન-૨૧) જીએસટી-૨૦૨૦/આર.૪૬ (૨)-ઠ, જાહેરનામું ક્રમાંક. ૧૪/૨૦૨૦-રાજ્ય વેરો-ની જોગવાઈઓના અપાલન બદલ, સદરહુ અધિનિયમની કલમ ૧૨૫ હેઠળ રજિસ્ટર થયેલી કોઈ વ્યક્તિએ સન ૨૦૨૦-ના ડિસેમ્બર મહિનાની ૧-લી તારીખથી સન ૨૦૨૧-ના સપ્ટેમ્બર મહિનાની ૩૦-મી તારીખની મુદત દરમિયાન ચૂકવવાપાત્ર દંડની રકમ જતી કરે છે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.

Extra No. 229



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII | THURSDAY, SEPTEMBER 2, 2021 / BHADRA 11, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગ-ના તારીખ: ૧૧મી ઓગસ્ટ, ૨૦૨૧ના જાહેરનામા ક્રમાંક: (જાએચએન-૫૬) જાએસટી-૨૦૨૧/એસ.૫૭(૧)૬.- નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

NOTIFICATION

*Under***The Gujarat Goods and Services Tax Act, 2017**

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ હેઠળ

જાહેરનામું

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૧મી ઓગસ્ટ, ૨૦૨૧

ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭.

ક્રમાંક: (જીએચએન-૫૬) જીએસટી-૨૦૨૧/એસ.૫૭(૧)ઠ-ગુજરાત માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ગુજરાતના ૨૫મા)ની કલમ ૫૭થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, સદરહુ અધિનિયમના હેતુઓ માટે, સન ૨૦૧૭ના જુલાઈ મહિનાની ૧લી તારીખથી અમલમાં આવે તેમ, ગુજરાત ગ્રાહક કલ્યાણ નિધિ (ફંડ)-ની રચના કરે છે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,
દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.



Extra No. 230



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY

Vol. LXII] THURSDAY, SEPTEMBER 2, 2021 / BHADRA 11, 1943

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.

વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧

ગુજરાત ગેઝેટમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા વિભાગના તારીખ: ૧૧મી ઓગસ્ટ, ૨૦૨૧ના જાહેરનામા ક્રમાંક: (જાએચએન-૫૭) જાએસટી-૨૦૨૧/આર.૮૭(૪)(૧)૬.- નો ગુજરાતી અનુવાદ આથી સર્વ લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

વી. એન. શેખ,
સરકારના નાયબ સચિવ.

ORDER*Under***The Gujarat Goods and Services Tax Act, 2017**

ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ હેઠળ

હુકમ

નાણા વિભાગ

સચિવાલય, ગાંધીનગર, ૧૧મી ઓગસ્ટ, ૨૦૨૧

ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭.

ક્રમાંક: (જીએચએન-૫૭) જીએસટી-૨૦૨૧/આર.૮૭ (૪)(૧)ઠ- ગુજરાત માલ અને સેવા વેરા નિયમો, ૨૦૧૭ના નિયમ ૯૭ના પેટા-નિયમ (૪)થી મળેલી સત્તા અનુસાર, ગુજરાત સરકાર, આથી, ગ્રાહકોના કલ્યાણ માટે ગુજરાત ગ્રાહક કલ્યાણ નિધિ (ફંડ)માં જમા થયેલ નાણાના યોગ્ય ઉપયોગ માટે ભલામણો કરવા, નીચેના સભ્યોની બનેલી, સ્થાયી સમિતિની રચના કરે છે:-

૧.	મુખ્ય રાજ્ય વેરા કમિશનર	અધ્યક્ષ
૨.	ખાસ રાજ્ય વેરા કમિશનર	ઉપાધ્યક્ષ
૩.	અધિક રાજ્ય વેરા કમિશનર	સભ્ય-સચિવ
૪.	અધિક સચિવ/ સંયુક્ત સચિવ/ નાયબ સચિવ (વેરા), નાણા વિભાગ	સભ્ય
૫.	અધિક સચિવ/ સંયુક્ત સચિવ/ નાયબ સચિવ, ઉદ્યોગ અને ખાણ વિભાગ	સભ્ય
૬.	મેનેજીંગ ડિરેક્ટર, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ	સભ્ય
૭.	માહિતી કમિશનર/નિયામક	સભ્ય

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,
દિલીપ ઠાકર,
સરકારના નાયબ સચિવ.



Statement for the Delay in laying down the notifications on the table of legislative Assembly issued under SGST Act and SGST Rules described in the table attached herewith.

- Large number of Notifications are being issued by the department due to application of one tax regime in the whole country from 01-07-2017. (i.e. 99 in 2017, 83 in 2018, 84 in 2019, 70 in 2020, 34 in 2021 (Up to Date 20-09-2021) have been issued so far.)
- 350 Copies of the notifications are needed (both in English and Gujarati each), that are to be laid down on the table of legislative assembly. Legislative and Parliamentary Affairs department translates English Notifications into Gujarati.
- These Notifications could not be placed on the Table of the legislative assembly because Legislative and Parliamentary Affairs department couldn't provide Gujarati copies of this Notifications in time.
- In addition, Copies of the Gujarati notifications received by the department time to time were not in order. Still the Copies of Gujarati notifications received by Finance department are not in order; But in order to avoid delay in the process of lay down, we may put the 350 copies of the available notifications with Gujarati translation on the table of legislative assembly. Still 19 Notifications cannot be laid down on table of the legislative assembly in this session whose Gujarati version is not available.

આ સાથે સામેલ પત્રકમાં દર્શાવેલ SGST Act અને SGST Rules સંબંધિત અધિસૂચનાઓ સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલ વિલંબના કારણો.

- ૧/૭/૨૦૧૭ થી સમગ્ર ભારત દેશમાં એક જ કર પ્રણાલી લાગુ થવાથી વિભાગ કક્ષાએ બહાર પાડવામાં આવેલ અધિસૂચનાઓની સંખ્યા મોટા પ્રમાણમાં હતી. (વર્ષ - ૨૦૧૭ માં ૯૯, વર્ષ-૨૦૧૮ માં ૮૩, વર્ષ-૨૦૧૯ માં ૮૪, વર્ષ-૨૦૨૦માં ૭૦, વર્ષ-૨૦૨૧માં ૩૪ (તા:૨૦-૦૯-૨૦૨૧ સુધી) અધિસૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે.)
- સભાગૃહના મેજ ઉપર મૂકવાની થતી અધિસૂચનાઓની અંગ્રેજી અને ગુજરાતીની ૩૫૦-૩૫૦ નકલો આવશ્યક હોય છે. અંગ્રેજી અધિસૂચનાઓનું ગુજરાતીમાં ભાષાંતર વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ દ્વારા કરવામાં આવે છે.
- આટલી મોટી સંખ્યામાં બહાર પાડવામાં આવેલ અધિસૂચનાઓનો ગુજરાતી અનુવાદ વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ તરફથી જે-તે સમયે વિભાગને સમયસર ઉપલબ્ધ ન થયેલ હોવાથી, સદર અધિસૂચનાઓ સભાગૃહના મેજ પર મૂકી શકાઈ નહોતી.
- વધુમાં, સમયાંતરે વિભાગને મળતી ગુજરાતી અનુવાદની નકલો ક્રમાનુસાર નહોતી. હજી પણ નાણા વિભાગ પાસે જે ગુજરાતી ભાષાંતર કરેલ અધિસૂચનાઓ પ્રાપ્ત થયેલ છે, તે ક્રમાનુસાર નથી; પરંતુ, હવે વધુ વિલંબ નિવારવાના હેતુથી જેટલી અધિસૂચનાઓનું ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ છે, તે તમામ અધિસૂચનાઓની અંગ્રેજી અને ગુજરાતીમાં ૩૫૦-૩૫૦ નકલો વિધાનસભાગૃહના મેજ પર મૂકીએ. હજુ પણ જે અધિસૂચનાઓનું ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ નથી તેવી ૧૯ અધિસૂચનાઓ આ સત્ર દરમિયાન વિધાનસભાગૃહના મેજ ઉપર રજુ કરી શકાશે નહિ.

પત્રક

No.	Notification	Date
1.	(GHN-31)GSTR-2020/S.164(54)TH	27-03-2020
2.	(GHN-110)GST-2020/S.148(36)TH	21-11-2020
3.	(GHN-111)GSTR-2020/S.164(66)TH	21-11-2020
4.	(GHN-116) GST-2020/S.168A(9)TH	18-12-2020
5.	(GHN-1) GST-2021/S.164(68)TH	01-01-2021
6.	(GHN-9) GST-2021/S.25 (6D) (2) TH	02-03-2021
7.	(GHN-13) GST-2021/R.48(4)(6) TH	18-03-2021



(Mehul Vasava)

Deputy Secretary (Tax)
Finance Department.

